

4746

4746





b. 8.



THOMAE ERPENII

GRAMMATICA

ARABICA.

---

ACCEDUNT LOCMANI SAPIENTIS FABULAE  
ET SELECTAE QUAEDAM ARABUM SENTENTIAE.

---



ROMAE MDCCXXIX.

---

IN COLLEGIO URBANO  
DE PROPAGANDA FIDE.



80

Wt. graw. 446 C

$$\begin{array}{r} 47.50 \\ - 2.15 \\ \hline 35 \end{array}$$

## THOMAE ERPENII CONSILIU \*

de ratione addiscendae grammatica arabiscae



I. Si quis omnino rudis accesserit, primum exemplum potius intuitu, quam prolixiore explicacione, discat elementa; quae sunt consonantes, vocales, et notae orthographicae. Harum attente contempletur figuram, et expenda potestes seu valores. Viginti octo consonantium notitia petetur ex initio cap. primi, ipsa nempe eius tabella; tria vocum ex tabella et fine cap. tertii: quinque peculiares notas orthographicas docet principium cap. quarti, et pars quinti prima et ultima. Ubi et obiter notasse profuerit, uti tres tantum sunt vocales *a*, *o*, *i*; ita tres dumtaxat nominum casus: et *o* pertinere ad nominativum et vocativum; *a* ad accusativum; denique *i* ad casus reliquos.

II. Tum cognita illa elementa inter se nectere in syllabas assuescat: quem in finem iuvari poterit exemplis, tum singulairum vocum, pag. 6, 16, 17; tum vocum plurium, pag. 18, 21, 22, 23; et integrae sententiae, pag. 16: quippe ubi arabica etiam litteris exprimuntur.

III. Hoc praevio defunctus rudimento, librum primum diligenter legat, ab initio usque appendicem eius, quae pag. 24. occurrit. Ita quidem, ut iis quae ad rem propositam scitu magis esse necessaria iudicaverit, maiorem adhibeat attentionem. Quaedam enim curiosae esse potius et uberioris doctrinae satis liquet.

Ubi et hoc observa, in tesdid euphonico, de quo pag. 18 et 19; et wesla, de qua pag. 20 et 21, lingua exprimendis, non adeo esse laborandum: nam hoc, ut natum est ab expedite loquentis naturali propensione quadam et euphoniam; ita ab ea potius quam ab artis affectatione et conatu pendet.

\* Hoc Erpeni consilium desumptum est ex editione huius grammaticae, quae, curante viro eruditissimo Iacobo Golio, Lugdani Batavorum an. 1656. est impressa.

IV. Appendicem libri I , quod spectat , illa continet canones toti linguae , hoc est omnibus , vel saltem praecipuis , orationis partibus communes ; utpote euphoniae et facili elocutioni inservientes . Per quos potiori ex parte tollitur quae videatur esse in arabismo anomalia : ac proinde sine quibus nemo possit feliciter arabicari . At licet illi canones per se singuli sint facilissimi , ut nullo negotio intelligi et memoriae mandari possint ; multitudo tamen ob ipsam affinitatem facile confusionem inducit . Ea propter omnino praestiterit , ut singulis , aut ad summum binis , accurate perpendendis et memoriae imprimendis , singuli dentur dies .

V. Libro primo cacteris rebus cognito , interea dum istoc modo canonibus etiam opera datur , prògrediendum est ad secundum librum de verbis . Ubi primum coniugationum tabella , quam exhibet pag . 32 , diligenter est discenda : et ad maiorem confirmationem , verba quaedam trilittera , ut كَتَبَ ، فَرَقَ , et alia quaelibet , per eam deduci debent : donec oblatae cuiusque radicis coniugationem expedite et prompte formare noris .

VI. Hinc procedendum ad paradigma regulare primae coniugationis activae , quod bene memoriae est imprimendum , cum ab eo reliqua omnia dependeant : mox pracepta ei adiuncta legenda quoque atque discenda sunt .

VII. Deinde differentiae coniugationum derivativarum a prima , sequentibus duobus capitibus III et IV traditae , etiam memoriae penitus infigi debent ; et ad eandem normam radices plures per primas tantum temporum voces in coniugatione prima et reliquis deducendae sunt . Nec ante pergendum ad verba imperfecta , quam perfectorum coniugationes omnes , tum primitivae , tum derivativae , bene perspectae et cognitae fuerint ; et simul primi libri repetita semel atque iterum appendix memoria teneatur .

VIII. Hinc ad imperfecta fiat progressus , et singulis speciebus singuli attribuantur dies , confusionis evitandae gratia : nisi forte species quarta et quinta , sive cap . VIII et IX . dies exigere binos videantur . In iis bene considerentur et memoriae mandentur generales imperfectionis regulae , et ipsae ad eu-

phoniam facientes ; quae fere circa initium singulorum capitum proponuntur . Hisce enim intellectis et cognita verbi perfecti coniugatione , facile erit formare imperfectum . Nam ut minori hoc molestia facias , omnino consultum est , quamlibet vocem verbi imperfecti eo formare modo , ac si verbum perfectum sit . Ita formata cum erit , evidenter apparebit an contra generales illas imperfectionis regulas , an speciales peccet . In hisce verbis videbunt studiosi , quanti momenti sint aurei illi appendicis libr . I . canones : quos propterea hic saepe consulere et applicare oportet .

Verbis cognitis pergatur ad nomina ; et ab hisce ad reliqua : de quibus nihil peculiare est monendum : quoniam ibi res plana est ac manifesta ; nempe iis , qui iam praecedentium habeant cognitionem . Ubi quae per se maior esse , quam in illis sequentibus , difficultas videtur , ei ab Erpenio provisum fuit ipsa praceptorum traditione ; perspicua nempe et evidenter distincta . Quae si contracta nimis et in unum pressa , alio praesertim ordine , simul ingeri contingat , utique in dirigendo haud paulo plus negotii discentibus facessent .

10	1A. De ieiunis diversis
11	A. De ieiuno sive purificante secundum ieiunium .
12	1B. De ieiuno purificante .
13	1C. De ieiuno diversitate regre et eius .
14	1D. De diuocante via .
15	1E. De ieiuno diversitate .
16	1F. De ieiuno diversitate ieiuniorum .
17	1G. De ieiuno diversitate ieiuniorum .
18	1H. De ieiuno diversitate ieiuniorum .
19	1I. De ieiuno diversitate ieiuniorum .
20	1J. De ieiuno diversitate ieiuniorum .
21	1K. De ieiuno diversitate ieiuniorum .
22	1L. De ieiuno diversitate ieiuniorum .
23	1M. De ieiuno diversitate ieiuniorum .
24	1N. De ieiuno diversitate ieiuniorum .
25	1O. De ieiuno diversitate ieiuniorum .
26	1P. De ieiuno diversitate ieiuniorum .
27	1Q. De ieiuno diversitate ieiuniorum .
28	1R. De ieiuno diversitate ieiuniorum .
29	1S. De ieiuno diversitate ieiuniorum .
30	1T. De ieiuno diversitate ieiuniorum .
31	1U. De ieiuno diversitate ieiuniorum .
32	1V. De ieiuno diversitate ieiuniorum .
33	1W. De ieiuno diversitate ieiuniorum .
34	1X. De ieiuno diversitate ieiuniorum .
35	1Y. De ieiuno diversitate ieiuniorum .
36	1Z. De ieiuno diversitate ieiuniorum .

## LIBER III.

37	2A. De ieiunis diversis
38	2B. De ieiuno sive purificante .
39	2C. De ieiuno diversitate .
40	2D. De ieiuno diversitate .
41	2E. De ieiuno diversitate .
42	2F. De ieiuno diversitate .
43	2G. De ieiuno diversitate .
44	2H. De ieiuno diversitate .
45	2I. De ieiuno diversitate .
46	2J. De ieiuno diversitate .
47	2K. De ieiuno diversitate .
48	2L. De ieiuno diversitate .
49	2M. De ieiuno diversitate .
50	2N. De ieiuno diversitate .
51	2O. De ieiuno diversitate .
52	2P. De ieiuno diversitate .
53	2Q. De ieiuno diversitate .
54	2R. De ieiuno diversitate .
55	2S. De ieiuno diversitate .
56	2T. De ieiuno diversitate .
57	2U. De ieiuno diversitate .
58	2V. De ieiuno diversitate .
59	2W. De ieiuno diversitate .
60	2X. De ieiuno diversitate .
61	2Y. De ieiuno diversitate .
62	2Z. De ieiuno diversitate .

## INDEX CAPITUM

	Liber I.
Cap. I. De litteris .	pag. 1
II. De divisionib <sup>us</sup> litterarum .	13
III. De vocalibus .	15
IV. De syllabis , ubi de gjezm et tesdid .	17
V. De reliquis notis orthographicis ; ubi de ham- za wesla et medda .	20
Appendix libri primi seu canones de littera- rum اوی natura et permutatione .	24
	Liber II.
Cap. I. De verbo in genere .	31
II. De prima trilitteri coniugatione .	38
III. De quadrilitteris et coniugationibus derivati- vis primae classis .	48
IV. De reliquis derivativis .	50
V. De verbo surdo seu geminante secundam radicalem .	53
VI. De verbo hamzato .	58
VII. De verbo quiescente phe و et ۹ .	61
VIII. De quiescente ain .	63
IX. De verbo quiescente ج .	72
X. De verbo dupliciter imperfecto .	80
	Liber III.
Cap. I. De qualitate nominum .	85
II. De specie nominum .	86
III. De forma nominum .	92
IV. De genere nominum .	94
V. De motione nominum .	95
VI. De numero .	97
VII. De casu .	109

VIII. De declinatione .	pag. 115
IX. De comparatione .	116
X. De numeralibus .	ib.
XI. De pronomine .	118

## Liber. IV.

Cap. I. De particulis coniunctis .	123
II. De particulis separatis .	126

## Liber V.

Cap. I. De syntaxi nominum .	131
II. De syntaxi verborum .	134
III. De syntaxi particularum .	136



R E I M P R I M A T U R

F. Dominicus Buttaoni M. S. P. A. Soc.

R E I M P R I M A T U R

*Jo. Della Porta Patr. Constantinop. Vicesgerens.*

THOMAE ERPENII

# GRAMMATICA ARABICA

LIBER PRIMUS

## DE ORTHOGRAPHIA.

### CAPUT PRIMUM

#### De litteris.

Arabum litterae consonantes sunt viginti octo , quarum nomina ordinem , et figuram cum suis potestatibus sequens tabella exhibit .

Ordo. Nomen et potestas.

Figura.

		in fine dictionis, annexa	extra finem dictionis, non annexa	in fine dictionis, annexa	extra finem dictionis, non annexa
1	Elif.	أ	ل	ل	ل
		Spiritus lenis Graecorum, & Hebraeorum.			
2	Be.	ب	ب	ب	ب
		B.			
3	Te.	ت	ت	ت	ت
		T.			
4	Thse.	ث	ث	ث	ث
		T blaesum.			
5	Gjim.	ج	ج	ج	ج
		G Gallorum ante e et i.			

A

T H O M A E E R P E N I I

Ordo. Nomen et potestas.

Figura.

6	Hha.	خَاءٌ	خ	ح	خ	ه	ه
		¶ Hebraeum, i. e. duplex h ex imo pectore protractum h̄, hh.					
7	Cha.	خَاءٌ	خ	خ	خ	خ	خ
		Ch. seu $\chi$ Graecorum cum ratione gutturis.					
8	Dal.	دَالٌ	د	د	د	د	د
		D.					
9	Dhsal.	ذَالٌ	ذ	ذ	ذ	ذ	ذ
		D. blaesum					
10	Re.	رَاءٌ	ر	ر	ر	ر	ر
		R.					
11	Ze.	زَاءٌ	ز	ز	ز	ز	ز
		Z, aut z inter duas vocales.					
12	Sin.	سِينٌ	س	س	س	س	س
		S initio dictionis, aut post consonantem.					
13	Sjin.	شِينٌ	ش	ش	ش	ش	ش
		Sj Belgarum, ch Gallorum, sch Germanorum, et sh An- glorum.					
14	Sad.	صَادٌ	ص	ص	ص	ص	ص
		TS, sed ita ut s magis quam t audiatur.					
15	Dad.	ضَادٌ	ض	ض	ض	ض	ض
		Idem blase.					

## Ordo. Nomen et potestas.

## Figura.

16 Ta.	تَ	ط	ط	ط	ط
	T in gutturē pronuntiatum.				
17 Da.	ذَ	ظ	ظ	ظ	ظ
	Idem blase: vix differt a نَ.				
18 Ain.	عَينٌ	ح	ع	غ	ه
	ع heb. difficillima littera.				
19 Gain.	غَينٌ	خ	غ	خ	غ
	G in gutture pronuntiatum.				
20 Fe.	فَاءُ	ف	ف	ف	ف
	F.				
21 Kaf.	قَافُ	ق	ق	ق	ق
	K in gutture pronuntiatum.				
22 Kef.	كَافُ	ك	ك	ك	ك
	C ante a o u , id est k in anteriori parte oris.				
23 Lam.	لَامُ	ل	ل	ل	ل
	L.				
24 Mim.	مَيمُ	م	م	م	م
	M.				
25 Nun.	نُونُ	ن	ن	ن	ن
	N.				
26 Waw.	وَوُ	و	و	و	و
	W nostrum , germanicum , anglicum.				

Ordo. Nomen et potestas.

Figura.

27 He.

אֵלֶּה

H.

א

ב

ג

ד

28 Ie.

אֵלֶּה

ב

ג

ה

ו

\* Heb.id est i consona, quam  
caveant Galli suo more pro-  
nuncient; is enim sonus τε  
ε est.

## De nominibus litterarum.

**N**omina haec *τεχνη* sunt, ut apud nos, *be*, *ce*, *el*, *em*, *ix*, *zeta*, &c. Quod si quaedam aliud etiam significant, casu sunt aequivoca. Declinantur autem Arabibus more reliquorum nominum: unde terminationem *on* in nominativo adsciscunt, quam ego brevitatis causa latine non expressi, ut ipsi quoque Arabes in recitatione alphabeti sui eam negligunt. *Elif* etiam hamza vocatur: ratio post patebit.

## De ordine.

Ordo hic orientalium Arabum est, id est, Asiaticorum et Aegyptiorum: occidentales, seu Mauri, paulo alium observant, scilicet

ا ب ت ث ج ح خ د ذ ر ز ط ظ ك ل م ن ص ض  
ع غ ف ق س ش و ل ا ي

Olim apud utrosque alius obtinuit, qui etiam numeris denotandis inservit, et octo fictis vocabulis vulgo exprimitur; apud illos, scilicet Asiaticos, idem qui apud Hebraeos, hoc modo,

\* ا ب ج د ه و ز ح ط ي ك ل م ن س ع ف ض ق ر ش ت ت خ د ض ظ غ

Apud hos, nempe Mauros, paulo alias, in hunc modum,

\* ا ب ج د ه و ز ح ط ي ك ل م ن س ع ف ض ق ر ش ت ت خ د ظ غ ش

Qui in alphabeto asiatico hodierno و litterae و postponunt contra omnium lexicorum, et alphabeticarum institutionum ipsorum orientalium, quae mihi videre contigit, id faciunt fidem.

## De figuris litterarum.

Dubium non est, quin pleraeque figurae litterarum arabicarum a syriacis derivatae sint.

Septem autem scripturae arabicae reperiuntur genera , quorum

Primum et potissimum est نسخی *nischi* , quo alcoranus vulgo apud illos solet scribi , apud nos autem libri excudi .

Secundum تعلیق *taalik* , quo Persae utuntur ; quique ad *nischi* se habet , ut typi hebraei Henrici Petri ad typos plantinianos aut bombergianos .

Tertium دیوانی *diwani* , quod in forensibus et quotidianis negotiis Turcae usurpant ; maxime cum turcice scribunt : habetque se ad *nischi* , ut *masket* Hebraeorum ad scripturam assyriacam . Ad huius scripturae elegantiam pertinere videtur , quod lineae in progressu ascendunt , maxime versus finem : raro enim quid hac scriptura expressum videoas , in quo id non contingat .

Quartum قرمہ *kirma* , cuius usus fere tantum est in tabulis accepti et expensi imperatoris Turcarum . Hoc minus attente consideratum similius videtur esse scripturae vulgari Iudeorum , quam τῷ *nischi* : litteris enim constat exiguis , nec invicem connexis .

Quintum est نلثی *tholothi* , in titulis librorum et diplomatum adhiberi solitum , habetque se ad *nischi* , ut maiusculi illi characteres latini , quibus librorum tituli apud nos excudi solent , ad characteres communes : litterae enim eadem sunt quae *nischi* , sed multo maiores et pinguiores , mireque elegantibus ductibus cohaerentes .

Sextum est ياقوتی *iakuti* , et septimum راحنی *rahani* , sic dicta ab auctoribus suis ياقوت et راحن ; qui ad maiorem scripturae venustatem , ut sunt Arabes καλλιγραφίας studio-sissimi , peculiares quosdam litterarum ductus et nexus , suo quisque modo , excogitarunt .

Hisce octavum addi queat mauritanicum, quod satis multum a praecedentibus differt; qua de re post nonnihil.

Nos typorum inopia primae tantum scripturae, tanquam praecipuae et primitivae, quaque cognita reliquae nullo fe-re negotio addiscuntur, litterales figurae proposuimus in ta-bula alphabetica.

Caeterum, cum litterae arabicae omnes, praeter sex د ذ ر ز و, sequenti in eadem dictione inter scribendum annexantur, et in fine liberiori ductu protrahantur, eius-dem litterae, ratione connexionis et situs, plures ortae sunt figurae: ita in tabella propositae, ut prima columna eas, quae initio dictionum, et in medio post sex illas illigabiles, secunda, quae in medio post ligabiles: reliquae duae quae in fine; prior quidem post illigabiles; posterior vero post ligabiles usurpantur, exhibeat. Separatim autem exprimendae, figura finali illigabili pinguntur.

I tamen τῳ ج subiungendum peculiare quiddam habet: nam aut separatim illi apponitur et quasi cadens includitur, sic ڻ; idque tum maxime, cum ج praecedenti annexetur: aut cum illo in unum coalescit, hoc modo ڻ, quem ج non cohaeret cum alia, atque istae litterae sic coniunctae nomine composito vocantur *lamelif*, ac si una essent; ut et quidam opinari videntur, dum ultimae alphabeti litterae eas praeponunt: at male.

Variant interdum, in codicibus manuscriptis praecipue, ut non omnes uno modo et aequa bene pingunt, figurae nonnihil a supra positis; sed ea variatio tanta est, ut nec regulis comprehendi, nec typis repraesentari facile possit. Tu talia exemplaria nactus diligenti consideratione et cum his nostris collatione facile eas agnosces et observabis, etiam in omni scripturae genere: essentialē enim ab his differunt non habent, nisi quod Mauri *kaf* uno puncto superne insigniunt, hoc modo ڏ; τῳ se vero, ut ab illo differat, suum apicem subiiciunt, in hunc modum ڏ: qua qui-dem nota certo dignosces codices eorum ab iis, qui in orien-te exarati sunt,

Orientales autem pro tripli puncto τε ش lineolam interdum adhibent, hoc م, aut hoc م modo. Utique compendii gratia omittunt subinde puncta illa διαρπίτινδ, quibus solis figurae quaedam diversarum litterarum distinguuntur; ut ب ت ح ج ش; unde scriptura exsurgit lectu et intellectu difficillima. Parum est, quod interdum in una et altera littera negligantur, quae absque iis facile agnosciuntur: ut in je finali hoc modo ى scripto; quod passim accidit.

Plerumque tamen puncta illa διαρπίτινδ solent adiici: quin et iis figuris, quae illorum absentia ab aliis discernuntur, scilicet د ر س ص ط ع ح, quaedam interdum apponi notae, significantes debitam punctorum absentiam, τοις د ر س ص ط ع ح

quidem superne hoc modo د ر س ص ط ع ح, reliquis vero inferne, similares illis aliae, minori ut plurimum forma, sic ح ص ط ع ح.

Idem subinde τφ م contingit; cui et eadem de causa interdum tria puncta subiiciuntur, hoc modo پ. Ita τφ he finali aliud interdum superponitur, indicans absentiam punctorum quibus interdum insignitur; de quo postea. Haec tamen hodie raro et non nisi in accuratissime scriptis observantur.

Figurarum in dictione, et dictionum in linea ea est consequitio, quae orientalium fere omnium; a dextra scilicet sinistram versus.

Pleraeque autem figurae basi lineae incumbunt, nec ullae infra eam deprimuntur, praeter و ه و ل, itemque finales protractas; unde خ خ خ annectendae litteris, quae ductum suum in basi lineae terminant, ne ipsae deprimantur,

eas, cumque iis saepe alias, connexas elevant: ut in تجربة experientia, videre est: sic المخاطب, التجربة colloquens, شهادة remotio, &c. Quae autem unius sunt dictionis, iuste a se invicem separatae sunt, nec nimis magnis distantiis aut vinculis se mutuo consequuntur, nisi lineae quantitas obstet: dictio enim in fine eius scribenda si satis loci non reperiat, admittit inter inconnexas grandius spatium, ac inter eas in

duas partes secatur ; quarum prior lineam reliquis adaequat , posterior in margine ponitur , hoc modo :

كُلُّ الْحَدَاءِ يَخْتَنِي بِهِ الْحَا فِي  
μυωπόδης . *Omni calceo calceatur γν-*

Crebro tamen priori superponitur , sic :

الْحَيَاةِ يَمْنَعُ الرَّزْقَ *Verecundia prohibet largitionem .*

Interdum initio sequentis lineae collocatur , quod perpetuo observant libri typis excusi . Si autem dissectionem istam dictio aliqua commode non admittat , tota initio sequentis lineae reservatur , et ad lineae complementum praecedentis distinctionis vinculum aliquod producitur in hunc modum :

فِي الْبَدْءِ كَانَ الْكَلْمَةُ وَالْكَلْمَةُ كَانَ عَنْدَ اللَّهِ وَأَنَّهُ  
هُوَ الْكَلْمَةُ . كَانَ هَذَا قَدِيمًا عَنْدَ اللَّهِ \*

*In principio erat verbum , et verbum erat apud Deum , et Deus erat verbum . Erat hoc aeternum apud Deum .*

Quae vinculi productio in principio aut medio lineae etiam interdum adhibetur ornatus gratia : maxime in trito illo,

\* بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

*In nomine Dei miseratoris misericordis .*

Dictionum a se invicem distantia maior quam quae est litterarum unius dictionis , in manuscriptis vix observatur , quod fines earum figuris literarum finalibus ut plurimum facile cognoscantur . At periodorum sic satis magna fere adhibetur , quin et notis hisce ؟ \* . . . et similibus , itemque ۚ et ۖ ن fines earum non raro indicantur ; quae tamen necessitate aliqua urgente periodi membris distinguendis inserviunt : particulares enim distinctionum et certarum orationis qualitatum notas extra alcoranum non facile est reperire : at in eo ظ minio voci superne adscriptum periodi finem , aut colon designat , ut ح hypocolon , et ل comma ; nisi , quod malim , hoc unionis potius quam distinctionis notam esse statuas .

Triplex autem punctus crassus et caudatus hoc modo “, et in quibusdam exemplaribus unus solum sic “, rhythmi nota est , non distinctionis ; etsi rhythmico sententiae non raro terminentur . Atque haec diabolico illi libro peculiares sunt , ut alia pleraque , de quibus alias . Ait Theseus Ambrosius • commatis , : coli , •• hypocoli , •• interrogationis , •• responsionis , et •• periodi apud Arabes notas esse : sed fides sit penes auctorem .

## ΠΑΡΕΡΓΟΝ.

Solent Arabes christiani et iudei odio Mahomedanorum pleraque sua quae ad religionem spectant scripta arabica alio charactere consignare : illi quidem christiano , id est syriaco ; hi vero iudaico , id est hebraeo . Ac tum litteras ﴿ و ﴽ et ﴿ ل ﴽ more Arabum formant ab affinium figuris apposito puncto , in hunc modum ﴿ ج ﴽ et ﴿ د ﴽ : ﴿ خ ﴽ autem et ﴿ ئ ﴽ a *caf* et *gimel* , Iudei quidem superscripto raphe , hoc modo ﴿ ن ﴽ ، quibus ﴿ ن ﴽ est ﴿ خ ﴽ , et ﴿ د ﴽ . Syri vero subscripto puncto , sed soli *caf* , sic ﴿ ئ ﴽ : nam *ghimel* manet nudum ; cui ut repreäsentet ﴿ خ ﴽ punctus inscribitur , hoc modo ﴿ ئ ﴽ . Litteris autem ﴿ و ﴽ et ﴿ ل ﴽ exprimendis Syri ﴿ ح ﴽ et ﴿ د ﴽ , id est figura τοῦ οὐ nullo constituto discrimine etiam adhibent ; secus Iudei , qui has cum daghes , sic ﴿ د ﴽ , illas cum raphe , in hunc modum ﴿ ح ﴽ , exprimunt , ut tale sit horum alphabetum arabicum .

ا ب ت س ث ج ح د ذ ر ز س ش ص ض ط ظ  
ا ب ت ت ن ه ب د د ر ز م ش ا ز ت ط  
ع غ ف ق ك ل م ن ه و ي .  
ع ن ف ك ب ل م ن ه و ي .

De potestate figurarum .

Potestas seu valor figurarum est quod ipsae tamquam signa repreäsentant ; estque primaria aut secundaria . Primaria

est ipse literarum sonus, quem aliarum linguarum characteribus, quarum valor notus est, in tabula quam potuimus convenientissime expressimus; quod in plerisque commode satis fieri potuit, in aliis non item. Praecipua difficultas est in <sup>تَحْكِيْمٌ صَنْعٌ</sup> حَسْبٍ, maxime in حَصْبٍ; quae vivam docentis vocem requirunt.

De solis ɔ et ə pauca quaedam hic addenda sunt; eae enim valorem suum interdum mutant: ə quidem in eum qui est τῆς ɔ, in cuius indicium huius puncta superne assumit hoc modo ɔ: quod in finibus nominum tantum accidit, ad genus foemininum aut plurale designandum, ut post siet manifestum.

ɔ autem vocali destitutum, positumque immediate ante aliud ɔ, aut litteras <sup>تَحْكِيْمٌ صَنْعٌ</sup> اهـ, retinet quidem proprium sonum, non secus ac si vocalem possideret; inque ejus indicium superne insignitur nun rubro, ut <sup>أَنْهَارٌ</sup> نَّعْلَى fluvii, منْ عَبْدِ اللَّهِ a ser-  
vo Dei: sed ante alias sonum variat: nam,

1. Ante ɔ sonat ut *mim*, idque indicat *mim* rubrum ei superscriptum, ut <sup>وَبَرٌ</sup> عنبر *ambaron*, non *anbaron*, *ambra*. منْ بَيْتٍ *mim beitin*, non *min beitin*, *de domo*. Sic Latini et Graeci *n* ante *b* in *m* mutant: ut, *imbibo*, εμβάλλω, pro *inbi-*  
*bo*, ενθάλλω.

2. Ante <sup>لُو</sup> مير acepit sonum sequentis, superposito *gain* rubro, et apposito ad <sup>لُو</sup> مير duplicitatis nota tesdid, de qua postea: ut, منْ رَبِّ *mirrabin*, non *min rabbin*, *a domino*; منْ لَيْلٍ *millailin*, non *min lailin*, *a nocte*. Sic Latini et Graeci *il-*  
*licitus*, *immunis*, ελλείχω εμπεύω, pro *inlicitus*, *inmunis*, ενλείχω, ενμέυω.

3. Ante reliquas sonat *n* cum *g* mixtum, quomodo Turcae ɔ non raro pronunciant, et vulgo nunc solet efferri y hebreum: eiusque soni nota est *cha* superscriptum; et rubedo puncti τς *nun*: ut, <sup>أَنْزَلٌ</sup> *angzala*, non *anzala*, *demisit*: منْ طِينٍ *ming tinin*, non *min tinin*, *ex luto*. Ante ɔ autem et ㄣ,

g illud  $\tau\tilde{\phi}$  n adiunctum est manifestius, sonusque ille mixtus fortior et vehementior; idque indicat punctum  $\tau\tilde{\phi}$  nun rubrica triplicatum: ut مُنْقَلَبٌ *mungkalabon*, *conversus*, من قلب *ming-kalbihi*, ex corde suo: من كلب *mungkadaron*, *confunditus*: sic من كفر *mang kafara* qui infidelis est. Sic et n apud Latinos ante c eum quoque sonum vulgo habet: ut, *incumbo*, *incredulus*; et similiter apud Graecos ante k, sed in γ mutatum, ut συγκλάω, πίστηνα.

Secundaria figurarum potestas sunt numeri; quorum notae sunt eodem modo, quo Hebraeis suae: alphabeti enim ordine antiquo (ut supra) descripti primae novem litterae unitates exprimunt, novem sequentes denarios, reliquae centenarios, ultima 十 millenarium: caeteros additione supplent, sicut Hebrei; ut يَا sit ۱۱, بِدَ ۱۲, تَعَجَّ ۱۳, بِدَ ۱۴, يَعَجَّ ۱۵, كَالَّا ۲۱, كَعَجَّ ۲۳, تَلَ ۴۳۰, غَشَّ ۱۱۰۰, غَيْمَ ۱۳۰۰, غَغَخَ ۳۰۰۰, &c.

Recentiores Arabes alias etiam ab Indis mutuati sunt, quas et his adiiciendas duximus.

I	P	M	R	O	Q	V	A	E	*
۱	۲	۳	۴	۵	۶	۷	۸	۹	۰

His eodem prorsus modo utuntur, quo nos vulgaribus istis nostris: ut ۱۰ sit ۱۰, ۱۱ ۱۱, ۱۲ ۱۲, ۱۳ ۱۳, ۱۴ ۱۴, ۱۵ ۱۵, ۱۰۰ ۱۰۰, ۴۰۰ ۴۰۰, ۱۰۰۰ ۱۰۰۰, ۱۶۱۳ ۱۶۱۳, et sic caetera. Observandum autem est, pro decima (۰) non raro usurpari quintam ۵; sed tunc quinarius hac figura exprimitur ۸: sic ۱۰۰ est ۱۰۰, ۱۸۸ ۱۵۵.

Sed ad figuras nostras litterarum revertamur: quarum duplii valori addi videtur posse tertius, quo compendii gratia signa integrarum dictionum sunt, assumpta ut plurimum superne hac ~ figura in mysterii huius indicium, idque accedit vocabuli significandi, si solum sit, litterae primae; ut حـ pro صـ *iustus*, جـ pro جـ *plurale*, طـ pro طـ *fnis*, si cum aliis coniunctum, vel primae, ut كـافـى pro كـهـيـعـصـ *efficax* (scilicet est Deus, ) director fـ

*delium, manus eius (sustentat omnia,) sciens (omnia,) verax (in promissis suis.) vel alii, puta primi vocabuli primae, medii mediae, ultimi ultimae; ut حَلِيَّةٌ مَعْدُوٌ pro أَنَا اللَّهُ أَعْلَمُ السَّلَامُ عَلَيْكُمْ، super eo sit pax: آلَمْ Ego Deus sum sapientissimus.*

## C A P U T S E C U N D U M

De divisionibus litterarum.

**D**ividuntur hae litterae multifariam, ratione scilicet pronunciationis, roboris, affinitatis, officii, et societatis.

Ratione pronunciationis: in gutturales, quae nullum certum linguae situm aut labiorum motum requirunt, sed in ipso gutture efformantur, suntque أحَقْعَفَةٌ.

Labiales, quae labiorum opera pronuntiantur, يومف.

Palatinas, quae efferuntur mucrone linguae inferius palatum tangente, et interiori eius parte superius palatum pulsando sonos distingue, et sunt حِيقَكَ.

Dentales, quae proferuntur mucrone linguae tangente superiores dentes, vel inferne نَذْظَرٌ، vel interne تَنْطَلَنْ.

Linguales, quae proferuntur mucrone linguae superius palatum mobiliter tangendo, suntque رِزْسَشَصْنَ. Hae una cum dentalibus solares vocantur, ut reliquae omnes lunares.

Ratione roboris dividuntur litterae in debiles, quae inter pronuntiandum interdum enervantur, sonoque proprio amissio alii inserviunt, أُوي؛ et robustas, quibus id non accidit, quales reliquae omnes.

Ratione affinitatis, in permutabiles, quae facile invicem commutantur, quales eae fere omnes sunt quae eiusdem sunt organi, itemque ض و ظ، et longe frequentissime debiles

أُوىٰ ; et impermutabiles , quae non permutantur invicem , ut pleraque aliae .

Ratione officii , in radicales , quae radicem ipsam seu primum thema solummodo constituunt , sequentes , تَحْمِلْ خَدْدَهْ صَفَطْ طَعْفَقْ رَزْشْ صَضْطْ طَعْفَقْ ; et serviles , quae derivatis formandis , et accidentibus radici inducendis non raro inserviunt , quales reliquae . Quin et طَهْ etiam interdum pro ئِ servili veniunt : sed de his postea .

Ratione societatis , in compatibiles , quae mutuo se in eadem dictione consequi possunt , et incompatibiles , quae conjungi recusant .

Incompatibles sunt

Gutturales حَكَّخَنَّ : interdum tamen وَرَهْ عَ subiungitur .

بَ وَ فَ مَ . At nun ante be sonum وَهْ mem induit , ut iam monui .

ت & ث	مَنْ & شِنْ
طَ طَ منْ صَنْ سَنْ & ث	ظَ طَ منْ & صَنْ
كَ قَ غَ حَ & جَ	ظَ ظَ & منْ
كَ قَ ظَ حَ & ظَ	كَ ظَ & طَ
ذَ دَ & دَ	قَ غَ & طَ
طَ طَ منْ صَنْ سَنْ & ذَ	كَ قَ غَ & غَ
لَ رَ & رَ	كَ قَ & قَ
ظَ صَنْ سَنْ & زَ	لَ & هَ ; si لَّنْ nequaquam , et
صَنْ سَنْ & سَنْ	عَلَيْنِ manifestavit , exceperis .

At serviles his inclusas ut radicem constituentes accipio : actu enim cum serviunt , cuilibet litterae adiungi possunt : ut بَغْصَةً argento , تُنْبَتْ confirmabis , لَرَبْ domino , كَقْوَلَكْ ut si dicas , &c.

Duae quoque similes initio dictionis quam rarissime concurrunt , nisi prior serviat . Et ئِ vocali destitutum in medio

dictionis raro ponitur ante litteras لوميور ; autem carens vocali , etsi interdum scribitur ante ω , nunquam tamen pronuntiatur ; qua de re cap. 4.

Reliquae omnes compatibilis sunt , quamvis aliae aliis saepius coniunguntur .

Huius observationis usus est ad ea scripta , quae punctis essentialibus consonantium destituantur , melius legenda , corrupta restituenda , ambigua determinanda , et denique vocabula arabica a barbaris discernenda .

### C A P U T T E R T I U M

#### De vocalibus .

**C**onsonantes ex claustris oris educuntur a vocalibus , quarum tabella haec est .

Nomen.

Figura.

Potestas.

Phatha	فَتْهَةٌ / فَتْهَةٌ	پ	Nunc <i>a</i> purum et clarum , ut in <i>amabam</i> ; nunc cum <i>e</i> mixtum , id est " graecum , ut multi id nunc pronunciant .
Dshamma	ضَمَّةٌ / ضَمَّةٌ	پ	Nunc <i>u</i> purum et clarum ; nunc cum <i>o</i> mixtum , id est <i>o</i> obscurum .
Kesre	كَسْرَةٌ / كَسْرَةٌ	پ	<i>i</i> simplex .

Litteram پ singulis adieci , ut una opera situm earum docerem , quo solo prima et ultima discernuntur : utraque enim lineola est , apud orientales quidem a dextra sinistram versus descendens , ut tabula eas exhibet ; apud occidentales vero prorsus iacens , hoc modo پ پ . Quare interdum perpendiculariter pingatur in hunc modum ' , post fiet manifestum .

Valet autem phatha *a* clarum , et dshamma *o* obscurum , cum ponuntur supra ultimas dictionum litteras , aut supra

خلق الله حَمْضٌ ظَفِيفٌ : ut in sequenti exemplo liquet , *Chalaka l,laho l,alema wakollama fhi wahsa la cholika min ahadin* , id est ; *Creavit Deus mundum et quidquid in eo est ; ipse autem non est creatus a quoquam* , alias illud nunc *a clarum* , nunc cum *e mistum* , id est *a Anglorum* , *ai Gallorum* , *ut in mate / faire* : hoc nunc *u clarum* , nunc cum *o mixtum* , id est *o obscurum Belgarum et Italorum* ; ut in *locht, dolce* : ان کان الله معنا من يكحون علينا  
In cana l,laho maana man jecno alaina . Si Deus est pro nobis , quis erit contra nos ?

Accidit his vocalibus productio et nunnatio .

Productio est soni simplicis roboratio , et quasi duplicatio ; ita quidem , ut

Phatha sonet *a circumflexum seu longum* , quomodo nostrates pronunciant *ae* , exempli gratia *maer / daer* : vel *a anglicum productum* , seu *ā* .

Dshamma *u longum* , ut Germani id pronuntiant , id est *æ Graecorum* , *oe Belgarum* , *ou Gallorum* : *v&c, boer, vous* .

Kesre *i circumflexum seu longum* , *ie nostrum* , *ut niet / riet* .

Quod tum iis accidit , cum habent post se litteras اوی vocalibus destitutas .

Phata quidem *!* , ut قَار , *Kār* .

Dshamma vero *و* , ut قُور , *Kūr* .

Kesre autem *ى* , ut قَيْر , *Kīr* .

Exunt enim in tali statu litterae istae potestates suas , ( unde vulgo dicuntur quiescere ) et naturam vocalium praecedentium induunt , cumque iis in unam longam coalescant .

Nunnatio est additio soni *nun* ad sonum earum , ita ut sonent *an* , *on* , *in* , sintque syllabae inversae potius quam vocales : quod accidit iis tantum ad extremas nominum lit-

teras ; eiusque in scriptura indicium est duplicatio figurae ,  
 hoc modo , بَعْدَ vel بَعْدَ ، بَعْدَ ، بَعْدَ vel بَعْدَ ; quae sonant بَنْ ، بَنْ ،  
 بَنْ ، ban , bon , bin . Unde et nun , quod in iis includitur  
 conditionibus illis mutationis subiectum est , quibus بَعْدَ subie-  
 ctum esse dictum est capite primo . \* autem nisi ponatur su-  
 pra ٍ ، aut ٍ pro ِ positum , assumit post se ِ ، hoc modo لَعْنَ ،  
 absque ullo soni augmento . Et \* compendii gratia non raro  
 sic pingitur ، ، ، ،

## CAPUT QUARTUM

De syllabis , ubi de gjezm et tesdid .

**E**x consonantibus et vocalibus consurgunt syllabae , ita  
 ut in pronuntiatione consonae vocales semper praecedant :  
 nulla enim syllaba arabica a vocali inchoatur , aut ea sola  
 constat : suntque purae vel mixtae .

Pura est , quae constat una sola consonante et vocali ,  
 eaque vel brevi : ut بَعْدَ بَعْدَ ، velut in تُصْرِفُ adiutus fuit ;  
 vel longa , ut بَعْدَ بَعْدَ ، velut in نَاصِرُونَ ، نَاصِرِيْنَ , iuvan-  
 tium , iuvantes .

Mixta , quae duabus consonantibus vocali una copulatis ,  
 ut بَلْ بَلْ ( quo pertinent litterae cum vocali nunnata , ut  
 بَلْ بَلْ ) ubi vides ultimam litteram hac nota ( ^ ) , quae ta-  
 men non raro imperfecte sic ( \* ) vel sic ( ^ ) pingitur , su-  
 perne insigniri ; cuius nomen est جَزْمٌ gjezmon , i. e. rese-  
 ctio : officium vero indicare eam cui superponitur litteram  
 syllabam mixtam constituere , et cum praecedente vocali co-  
 pulari . Invenies quidem eam etiam litteris اوی quiescenti-  
 bus subinde appositam , ut نَاصِرُونَ ، نَاصِرِيْنَ : sed minus

bene; ut praeter rationes, quae adferri queant, correctissima alcorani exemplaria, eam istis locis non habentia, abunde confirmant. Sed nec  $\text{ل}$  in fine dictionis post و quiescens id agnoscit: quia nullum sonum auribus exhibet, ut نَصَرُوا  
iuverunt, non vero نَصَرُوا.

Secunda syllabae mixtae littera compendii causa inter scribendum non exprimitur, cum immediate post se habet aliam sui similem, sed per figuram quandam sequenti appositam commode repraesentatur: cui figurae nomen est تَسْدِيدٌ *tesdid*, i. e. *roboratio*, *duplicatio*; forma, ista ( ) ; situs, supra litteram: occidentalibus tamen etiam hac forma ( ^ ) subiicitur; sicut hac ( v ), et haec quoque ( ^ ) subinde, superpo-

nitur: ut نَزَلَ, نَزَلَ, نَزَلَ, نَزَلَ, pro نَزَلَ. Duplicat itaque figura ista litteram suam; ac omnibus omnino consonantibus communis est; excepto ل, quod ut consonans vocali destinui nequit.

Est autem tesdid duplex: necessarium, et euphonicum.

Necessarium est, quod adscribitur litterae immediate ante se vocalem habenti: ut in exemplis allatis.

Euphonicum vero, cuius littera ante se habet consonam vocali destitutam, quae euphoniae causa in pronuntiatione periens sequenti similem in locum suum substituit.

Estque commune, vel initiale.

Illud est quod supra medianam vel ultimam dictionis litteram ponitur.

Estque deltale, vel lambdale.

Deltale adscribitur litterae و post د, ut وجدت wagjatto, inveni حَمَّدْتُمْ hamattum, laudastis.

Lambdale apponitur litteris solaribus post ل articuli و nominibus praefixi: ut أَلْرَبُ errabbo, وَخُوبُوكُونُ اللَّهُ eddino, وَخُوبُوكُونُ اللَّهُ allaho, وَخُوبُوكُونُ اللَّهُ: in quo tamen ultimo

littera in prioris locum supposita ab ea non differt. Sic Latini pro *adtollo* dicunt *attollo*, pro *conripio* *corripio*, pro *conligo* *colligo*, non pingentes litteram euphonice mutatam: alioqui scriberent *adtollo*, *conripio*, *colligo*: secus Arabes confusionis evitandae gratia. ل tamen articuli non raro omittitur, cum solaris eam sequens ل quoque est, ad compendium et scripturae elegantiam: ut حَلَّهُبْ pro الْهَبْ، نَلَّيْلْ pro الْلَّيْلْ، وَلَهَبْ، وَلَهَبْ. Quod ob frequentem usum perpetuum est in pronomine relativo الَّذِي, eiusque foeminino الَّتِي, et plurale masc. الَّذِينَ, (nunquam autem in reliquis casibus, quia rariores sunt) scribuntur enim pro الَّذِنِي الَّذِنِي: et semper quoque accidit cum articulo *praefigitur* ل dativi casus nota, ne tria *lam* concurrant; ut لَلَّيْلِ nocti pro لَلَّيْلِ لِلَّيْلِ، لِلَّهِ، لِلَّهِ Deo, pro لِلَّهِ.

Initiale est quod supra primam dictionis litteram ponitur, adeoque ultimam praecedentis supplet.

Estque primarium, aut secundarium.

Primarium est, quod apponitur litteris لومير immediate ante se habentibus *nun* giesmatum: expressum, ut مِنْ رَبِّي mir rabbihī, a domino suo; vel latens in vocali nunnata, ut قَلْبِي مُطَهَّرٌ qalbom mutahharron, cor mundum, seu mundatum.

Secundarium, quod apponitur cuvis non gutturali immediate positae post sui similem giezm affectam; ut من يَسْتَعْفِرُ رَبِّهِ man jastāgfir rabbāho, qui petit veniam a Domino suo. Ubi similis pro simili tantum ponitur, adeoque nulla soni mutatio inducitur: unde non video cur id fiat, nisi fortassis ut duas istae voces in unam coalescant. Invenies et interdum tale tesdid post similem vocali affectam, sed minio pictum,

quod notat quaedam exemplaria id non agnoscere ; et , me iudice , bene : nullam enim rationem video cur apponatur .

Caeterum tesdid initiale non in quibusvis codicibus reperitur : sed ex regulis positis facile est noscere ubi subintelligendum sit , si pictum non compareat .

### C A P U T Q U I N T U M

De reliquis notis orthographicis ; ubi de hamza , wesla , et medda .

#### Hamza .

<sup>ٌ</sup> ( pro quo Mauri punctum crassum flavo aut viridi colore usurpare solent ) *hamza* i. e. *punctio* vocatur , et servus est litterae *elif* mobilis ; eique cum vocali appositum , motum eius indicat actualem , ut أَنْ , أَنْ , أَنْ , ut sine ea , potentialem , id est , l natura sua radicale et mobile esse , ut يَامِنْ *securus est* : unde et nomen eius تَوْهُ l mobili saepe attribuitur : quin et pro eo usurpatur , idemque in pronuntiatione valet , cum positum in fine dictionis , habet ante se aliquam litterarum أُوى مَأْسَى سُوْشَى , pro شَيْئاً , aqua , malum , res ; aut in medio litteram aliam vocali carentem , ut يَسَّالُ pro يَسَّالٍ , rogabit , vel aliud l , ut انْتَرُ pro انْتَرُ , en terruit ? Litteris autem و et و superscriptum indicat eas pro l sua natura mobili ponit : ut يومنْ pro يُامِنْ , credet , اَيْزَرْ pro اَيْزَرْ , cinge .

#### Wesla .

<sup>ٌ</sup> *Wesla* vocatur , et soli quoque l adscribitur , in principio vocum , cum id , vocali sua abiecta , plane otiosum est , quaeque eam sequitur consonans cum praecedentis dictionis

ultima vocali uniri debet: ut قَلْبُ الْمَلِكِ *kalbo-lmaliki*, cor regis. Nihil itaque est aliud, quam unionis illius indicium.

## Annotatio.

Unioni autem huic subiectum *elif* initiale est triplex, verba, nominale, et articulare.

Verba est duplex; imperii et characteristicum.

Imperii, est quod format imperativum primae coniugationis, ut أَنْصَرْ اَنْصَرْ *onsor*, اِيْعَا *iuva*, اِدْرِبْ *idrib*, وَرْبَرَا *verbera*.

Characteristicum, quod initiale est in praeteritis activis, imperativis, et infinitivis coniugationum derivativarum secundae et tertiae classis: ut

أَنْصَرْ اَنْصَرْافَا	اِنْصَرَفْ	اِنْصَرَفْ	اِنْصَرَفْ <i>mutatus fuit</i> , <i>muta-</i>
اِسْتَطَعْ اِسْتَطَعْامَا	اِسْتَطَعْ	اِسْتَطَعْ	اِسْتَطَعْ <i>mutando</i> .

Nominale est in his decem nominibus.

اِمْرَأَةٌ	<i>vir.</i>	اِثْنَانِ	<i>duo.</i>
اِبْنَةٌ	<i>mulier.</i>	اِثْنَتَانِ	<i>duae.</i>
اِبْنَ	<i>filius.</i>	اِسْمُ	<i>nomen.</i>
اِبْنَةٌ	<i>filia.</i>	اِسْتَ	<i>nates.</i>
اِبْنَ	<i>filius.</i>	اِيمَنْ	<i>iuramentum.</i>

Articulare est articuli الْأَلْفَ وَالْمَدْ : quo pertinet id, quod est in relativo الْذِي ; et casibus eius.

In his omnibus ( nisi initio ponantur sententiarum, aut post articulum) initiale vocali sua privatur, et quae eam sequitur littera vocali destituta, unitur cum vocali terminan-

te dictionem praecedentem , aut servilis praefixa : ut يَدُ أَبْنَكَ *jado-bnica* , manus filii tui , بَابِنَكَ *bibnica* , in filio tuo .

Si dictio praecedens terminetur consonante , ea adsumit kesram : ut ضَرِبَتْ لَامٌ *darabati-lommo* , verberavit mater . منْ أَبْنَكَ *Mani-bnuca* , quis filius tuus ? ubi ضَرِبَتْ est pro منْ ، ضَرِبَتْ قَتَلُهُمُ الْعُدوُوْ *kataláhumo-ladouwo* , occidit eos hostis , غَزَوا الْعُدوُوْ *gaza-wo-ladouwa* , oppugnarunt hostem , et منْ à fatham : ut مِنْ الْمَلِكِ *mina-lmálikí* , a Rege .

Si autem praecedat nunnata , ea ante articulum الْ abicit *nun* : ut بَيْتُ الْمَقْدِسِ *Baito-lmukaddaso* , domus sanctificata , pro بَيْتِ . Alibi retinet , et l unionis licet vocalem suam adscriptam non habeat , in pronuntiatione tamen eam adsumit : ut مدِيْنَةً افْتَتَحَتْ *madinátón iftáhat* , urbs quae capta est .

Si praecedat aliqua litterarum اوی quiescens , ea non obstat unioni , ut غَزَّا الْمَدِيْنَةَ *gaza-lmadinata* , oppugnavit urbem , يَغْزُو الْمَدِيْنَةَ *jagzou-lmadinata* , oppugnabit urbem , تُصْرُوا الْمَلِكَ *nasarou-lmalica* , opem tulerunt regi , انصُرُوا الْمَلِكَ *onsori-lasha* , adiuva f. fratrem . Sed affixa هِيَ , meus , mea , meum , et نِسِي me , adsumunt fatham super هِيَ : ut ضَرِبَنِي كِتَابِي الْعَظِيْمِ *kitabia-ladimo* , liber meus magnus . ضَرِبَنِي الدَّارِبِي الْمَعْلُومِ *darabania-lmuállimo* , verberavit me präceptor .

Observa autem omnia *elif* unionis servilia esse , et omnia naturaliter kesram possidere : praeter imperativum , quod interdum habet damma , et articulare , quod fatham ; uti et nominale in solo أيمن .

Nota quoque hanc regulam :

*Elif* unionis , sequente immediate vocali , excidit : ut مـ pro مـ امـ extende .

Medda .

~ Medda vocatur , et apponitur † quiescenti ante , id- que producitur : ut سـ samـون , coelum . Superscribitur tamen quoque notis arithmeticis : et dictionum compendiis , seu litteris integras dictiones repraesentantibus , ut apud Hebraeos signum . hoc .

#### De accentibus .

Accentus hic nulla est nota : sed quae dictionis syllaba attollenda sit , facile cognoscitur . Nam dissyllaba attollunt penultimam : ut بـaitـون baiton , domus ، أـنـصـرـون onsor , adiuـvaـ . Polysyllaba antepenultimam : ut مـكـتبـةـ mactabon , schoـلاـ ، يـنـصـرـوـ jánsoro , adiuwabit . Nisi penultima producatur per أـوـيـ quiescens ; tunc enim ea accentum habet : ut الـلـاـ ilahon deus . غـفـورـ gafouron , condonans : رـحـيمـ rahimon , misericors .

## LIBRI PRIMI APPENDIX VERE AUREA

## SEU CANONES

de litterarum اوی natura et permutatione.

## CANONES GENERALES.

I. Litterae اوی frequenter inter se commutantur, sed in principio dictionis; itemque in medio, et fine, post gjez-mam, constanter manent.

II. Litterae اوی vocalibus destitutae, post vocales heterogeneas, iis fiunt homogeneae: ut

نُوی		نُلّی incile.
بِیْر		بَارُ puteus.
نَارُ		نُورُ ignis.
مِعَادٌ	pro	مُوعَادٌ dictus locus, vel dictum tempus.
دَارُ		دِيرُ domus.
مُوقِنٌ		مُيقَنٌ certum reddens.

## Exceptio.

و et ى post fatham non raro manent: et diphthonges-cunt, adscripta gjezma; aut quiescunt instar ل, sine gjezma: ut

يُومُ jaumon, dies. رَمَاهُ ramáho, iecit eum.

لَيْلَailon, nox. غَازَةً gazáton, oppugnatio.

III. Litterae اوی quiescentes, sequente gjezma, excidunt: ut

يَخْفِي		يَخْفَفُ	timeat .
يَقْمِي	pro	يَقْمُومُ	stet .
يَسِيرُ		يَسِيرُ	eat .

## Annotatio .

*Elif* unionis non fit quiescens , nec huic regulae subiicitur : ut فَانصَرْ itaque adiuva .

## C A N O N E S S P E C I A L E S .

*Elif* .

I. *Elif* in medio dictionis mobile per damma , in و ; per kesram , in ى mutatur : ut

أَوْبٌ		أَبٌ	pascua .
سَيْلٌ	pro	سَالٌ	rogatus fuit .

Etiam post *elif* quiescens : ut

قَائِلٌ		قَائِلٌ	dicens .
مَاوَةٌ	pro	مَاوَةٌ	aqua eius .

II. *Elif* in medio dictionis mobile per fatham , post damma , in و ; post kesram , in ى mutatur : ut

دَوْبٌ		دَابٌ	studia .
فَيْةٌ	pro	فَأَةٌ	agmen hominum .

III. *Elif* in fine dictionis , post damma , in و ; post kesram , in ى mutatur : ut

دَنْوٌ		دَنَّا	vilis fuit .
خَاطِئٌ	pro	خَاطِئًا	peccans .

IV. *Elif* in fine dictionis post fatham, mobile per damma, in و ; per kesram, in ى mutatur : ut

نَفْتُو	قَفْتَا	desinis .
سَبِي	سَنَا	foliorum sennae .

V. *Elif* quiescens post *elif* fathatum excidit, fatha perpendiculariter picta, vel adscripta medda : ut

أَمْنٌ أَمْنٌ pro أَمْنِ أَمْنِ credidit .

VI. *Elif* quiescens, sequente alio *elif* quiescente, in و fathatum mutatur : ut

نَاصِرٌ نَّوَاصِرٌ pro نَاصِرٌ adjutrices .

#### Annotatio I.

و et ى ex *elif* mobili descendentes hamzam perpetuo adscriptam habent, et ى punetis non raro suis tunc destituitur. Mobile autem *elif* et illud est, quod, licet actu vocalem non habeat, radicale tamen est, eamque habere aptum : ut بَيْرٌ .

#### Annotatio II.

Voculae inseparabiles ا ب ف ل non censemur *elif* in medium collocare : ut لَبِّيْضٌ *patri*, كَامِلٌ *instar matris* : nisi in particulis quibusdam : ut اَيْنٌ an si ? لَيْلَدٌ ut ne :

### C A N O N E S W A W .

I. و in medio dictionis mobile per fatham, post kesram, interdum in ى mutatur : ut

تَيَابٌ تَوَابٌ pro تَيَابٌ vestes .

II. و in medio dictionis, habens post se aliud و quiescens, saepe id expellit :

طَلُوْسٌ	طَلُوْسٌ	pavo.
رُوسٌ	رُوسٌ	capita.
pro		

III. و finale post fatham nequit moveri, sed abiecta sua vocali, et reiecto ad fatham *nun* vocali, si quod adsit, quiescit, in ا mutata; si sit tertia dictionis littera; aut in ي conversa, si quarta, aut ulterior: ut

غَزَا	غَزَوْ	oppugnavit.
عَصَا	عَصَوْ	baculus.
بَغَزَى	بَغَزَوْ	oppugnatus fuit.
مُعْطَى	مُعْطَوْ	datus.

IV. و finale post damma, non fert damma, vel kesram; se iis abiectis, quiescit: ut رَدْوٌ pro رد و et رَدْوٌ pro رد و periens, et pereuntis.

Si adsit *nun* vocale, id retrocedit, et و excidit: ut اَدْلُوْ اَدْلُوْ pro أَدْلُوْ situlae.

V. و finale post kesram, in ي mutatur: ut

رَضِيْ رَضِيْ pro gratum habuit, σύδενης.

VI. و servile in fine dictionis, ne eam terminet, adsciscit elif otiosum: ut

نَصْرَوْ	نَصْرَوْ	iuverunt.
رَمَوْ	رَمَوْ	iecerunt.
pro		

### C A N O N E S I E.

I. ي in medio dictionis, mobile per fatham, post damma, interdum in و mutatur: ut

وَرْمَانٌ رِّمْيَانٌ pro projectio , iaculatio .

II. ى in medio dictionis , habens post se aliud ى quiescens , saepe id expellit : ut

رِّبِيسٌ رِّيْبِيسٌ pro praefectus .

III. ى finale post fatham nequit moveri , sed abiecta sua vocali , et reiecto ad fatham nun vocali , si quod adsit , in star elif quiescit : ut

أُولیٰ	أُولیٰ	أُولیٰ	أُولیٰ	أُولیٰ أُولیٰ	أُولیٰ	أُولیٰ أُولیٰ	أُولیٰ	أُولیٰ أُولیٰ	أُولیٰ	أُولیٰ أُولیٰ	أُولیٰ	أُولیٰ أُولیٰ
فَتَنَّی	فَتَنَّی	فَتَنَّی	فَتَنَّی	فَتَنَّی فَتَنَّی								

Si aliud ى praecedat , mutatur in ١ : ut

هَدَابِيٌّ هَدَابِيٌّ pro res oblatae , munera .

Excipiuntur وَرِبِيٌّ يَحْبِيٌّ et nomina propria virorum .

IV. ى finale post kesram , non fert damma , vel kesram ; sed , iis abiectis , quiescit : ut

حَافِيٌّ حَافِيٌّ pro nudipes , is.

Si adsit nun vocalē , id retrocedit , et ى excidit : ut

رَامِيٌّ رَامِيٌّ pro iaculator , is.

V. ى finale post damma , id in kesram mutat ; ipsum non mutatur : ut

تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ تَمْنَنٌ	تَمْنَنٌ	تَمْنَنٌ تَمْنَنٌ
أَيْدِيٌّ	أَيْدِيٌّ	أَيْدِيٌّ	أَيْدِيٌّ	أَيْدِيٌّ أَيْدِيٌّ								

Etiam intercedente وَ : quod in ى vertitur : ut

مَرْمُوسٌ مَرْمُوسٌ pro iactus .

### CANONES WAW E T I E.

I. وَ et ى mobiles , ante وَ et ى quiescentes excidunt , vocali sua abiecta , si praecedat fatha ; ( cum qua quiescens di-

phthongescit, ) aut reiecta, in locum praecedentis vocalis, si ea sit damma vel kesra: ut

رَمْوَا		رَمِيُوا	iecerunt.
تَغْزِين		تَغْزُونِين	oppugnaberis faem.
أَغْزِي	pro	أَغْزُوي	tu faemina oppugna.
غَازُون		غَازُون	oppugnantes.
يَرْمُون		يَرْمِيُون	iacent.

II. و et ى mobiles, ante litteram mobilem, post fatham, saepe in *elif* quiescens mutantur: ut

قَام		قَوْم	stetit.
سَار	pro	سَيْر	profectus fuit.

III. و et ى ita concurrentibus, ut prior vocalem non habeat, mutatur in ى, duoque ى per tesdid coalescunt: ut

أَيْوَمْ أَيْوَمْ pro *dies plur.*

IV. و et ى finales, post *elif* servile, in hamzam mutantur: ut

رَدَاء		رَدَائِ	pallium.
سَمَاء	pro	سَمَاءُ	coelum.

#### Observatio I.

Cum in hisce canonibus, litterae vocali alicui postpositae dicuntur, immediata intelligitur postpositio, non intercedente scilicet gjezma, aut littera quiescente expressa, vel latente in tesdid: ut fit in

سُطُو *insultatio*, سُطُو *insultationis*.

عدوٰ	<i>inimicus</i> ,	عدوٰ	<i>inimici</i> .
اتىٰ	<i>perditio</i> ,	اتىٰ	<i>perditionis</i> .
رکيٰ	<i>putei</i> , vel <i>infirmus</i> .	رکيٰ	<i>puteorum</i> , vel <i>infirmi</i> .
تَحْوِيلٌ	<i>mutatio</i> .	مرميون	<i>iacti</i> , <i>petiti</i> . plur.

## Observatio II.

Affixa censemur *elif* in medium collocare, non و et ی: ut

مَاةٌ	مَاوَةٌ	مَاةٌ	<i>aqua eius</i> .
مَاةٌ	مَايَهٌ	مَاةٌ	<i>aquae eius</i> .
"	"	non	"
رميٰ	رميَهٌ	رميٰ	<i>iecit illum</i> .
غزاٰ	غزاَهٌ	غزوٰهٌ	<i>oppugnavit eum</i> .

Finis libri primi.

THOMAE ERPENII

## GRAMMATICAES ARABICAE

LIBER SECUNDUS

DE VERBO.

CAPUT PRIMUM

De verbo in genere.

**P**rima verbi vox seu thema apud Arabes vocatur **أَصْلٌ**, id est, *radix*; et litterae eius **أَصْلِيَّةٌ** id est, *radicale*: ad quas quae accedunt ad formationem coniugationis, temporis, personae, numeri, generis, et nominis, quales sunt septem, quas comprehendit vox **پِنْجُهْفِنْوَا** *pingueſtient*; vel ad consignificationem, quales insuper quatuor, contentae voce **بَقْلَكَ** *in navi*, accidentales seu serviles vocantur, ut dictum est cap. 2. lib. 1. Estque radix tertia praeteriti persona singularis masculina: quae paucioribus quam tribus, ut in **نَصْرٍ** *adiuvit*, **مَدِ** *extendit*, pluribus quam quatuor, ut in **ذَحْرٍ** *volvit*, **غَرْغَرٍ** *fefellit*, nequit constare litteris: quarum prima *fe* dicitur, penultima *ain*, et ultima *lam*: quod eum singulae obtineant locum, quem litterae istae in usitato paradigmate **فَعْلٍ** *fecit*.

In verbo autem consideranda sunt sex. 1. qualitas. 2. coniugatio. 3. tempus. 4. numerus. 5. persona. 6. genus.

I. Qualitate aliud est *ἀνάλογον* seu regulare, quod scilicet regulam communem seu typum coniugationum (qui est verbum **فَعْلٍ**) sequitur; qualia omnia illa sunt quae nec secun-



dam tertiae similem habent, nec aliquam litterarum اوی radicalem: vel ἀνώμαλον seu irregulare, quod ab ea regula recedit, qualia sunt reliqua fere omnia. Illud perfectum, hoc imperfectum vulgo solet appellari.

II. Coniugatio genus significationis activum aut passivum continet. Deducuntur autem trilittera per tredecim coniugationes, denominatas a forma quam in singulis habet paradigma فعل : in quibus omnibus observanda sunt character et significatio.

Prima nuda et simplex est, omnique charactere destituta: ut

### فعل ۱.

Reliquae certis litteris characteristicis affectae, et in tres classes divisae: quarum prima continet formata a radice adiectione unius, secunda duarum, tertia trium litterarum: hoc modo,

### III.

است فعل

۱۰

### II.

تفعل

۵

### I.

فعل

۲

افعال

۱۱

تفاعل

۶

فاعل

۳

افوعال

۱۲

انفعال

۷

افعل

۴

افعول

۱۳

افت فعل

۸

افعل

۹

Ubi quaecumque litterae accedunt ad فعل characteris vice funguntur.

Sed observandum est in octava افت فعل, ت epentheticon mutari interdum in ط vel د.

In ط quidem, cum prima radicis est una litterarum صنف اضطرم intigi, pro اضطرب accendi, pro اطبع imprimi, pro اطبع iniuria affici, pro اضرم اضرم

اطْتَلَمْ، ubi ط insuper in ط mutatur, et cum priori per tesdid coalescit .

In د vero, cum prima radicis est una litterarum د ذ ز : ut pro اذْتَرَا / دَرَا dicitur propelli , pro اذْكُرُ / دَكْرُ recordari , اذْكُرُ / دَكْرُ ut ذ radicale etiam in د mutetur, et cum sequenti contrahatur; vel اذْكُرُ / دَكْرُ , ut e contrario posterior priori assimiletur ; vel اذْدَكِرُ / دَدَكْرُ utraqne salva manente : pro اذْدَلْقُ / دَلْقُ prolabi ; et د interdum in ذ conversa اذْلَقُ .

At ipsum illud و mutat primam radicis in sui similem cum qua per tesdid unitur, cum ea est ل, ث, و, aut ي: اتَّبَعَ : اتَّبَعَ incipere , pro اتَّخَذَ / اتَّخَذَ firmari , pro اتَّخَذَ / اتَّخَذَ transfigi , pro اتَّسَرَ / اتَّسَرَ ludere aleis , pro اتَّسَرَ / اتَّسَرَ : si autem sit و , absque ulla mutatione cum illo coalescit .

In prima autem coniugatione verba significationem habent simplicem et activam , quam a prima sua origine possident ; eamque vel transitivam , ut كَتَبَ scripsit ; vel intransitivam , ut حَزَنَ tristatus est : in reliquis vero intentam , seu auctam , vel alio modo mutatam : etsi et in plerisque earum primitivam significationem obtinere possint , maxime ea quae in prima coniugatione sunt inusitata .

Secunda autem فَعَلْ , et quarta فَعَلْلَ , ex absolutis formant transitiva ; ut حَزَنَ et أحْزَنَ contristavit : ex transitivis transitiva in secundum ; ut ضَرَبَ et أضْرَبَ verberare fecit .

Tertia قَاعِلْ significat actionem in id a quo similis actio recipitur : بَطَرَسْ صَارَبْ بُولِسْ Petrus verberavit Paulum ; sed ita , ut a Paulo reverberatus fuerit , adeoque mutuo se verberaverint , at Petrus tamen prior Paulum . Et sic neu-

tra ; ut بَطْرُسْ قَاعِدٌ بُولُسْ Petrus sedet cum Paulo , consideret illi .

Sexta تَفَاعِلْ cooperationem et mutuam actionem , ut Latinorum composita per *con* et Graecorum per *σύν* : ut تَضَارِبْ alter alterum verberavit ; تَكَعُّبْ غَلْمَانْ colluserunt pueri : تَصَارَعْ بَطْرُسْ وَبُولُسْ Petrus et Paulus colluctati sunt .

Quinta اَفْتَعِلْ , septima اَنْفَعِلْ , et octava اَفْتَعِلْ formant absoluta et passiva : quinta quidem et septima a secunda , ut عَلِمْتُ docui eum et ipse doctus fuit , seu didicit . كَسَرْ آلَانَ فَانْكَسَرْ fregi vas et fractum est , id est , sivit se frangi nec restit actioni meae , octava vero a prima , ut قَصَرْ ذَلِكَ فَاقْتَصَرْ abbreviavi hoc et abbreviatum est .

Nona اَفْعَالْ et undecima اَفْعَالْ formant absoluta colorum cum intensione : mediocri quidem prior , vehementiori vero posterior ; ut اَصْفَرْ valde flavus fuit , اَصْفَارْ multo flavissimus fuit : et deformitatum verba ; ut اَضْجَمْ et اَضْجَمْ ore distorto fuit .

Decima اَسْتَغْفِرْ petitionem designat : ut veniam delicti petiit , a غَفَرْ remisit , اَسْتَطَعْ cibum petiit , a طَعْمَ gustavit , edit .

Duae ultimae , quae rarissimae sunt , significationem intendunt , ut اَخْشَوْشَنْ valde asper fuit , a خَشْنَ asper fuit , اَعْلَوْتَ fortiter adhaesit , ab عَلَّتَ adhaesit .

Non raro tamen coniugationes derivativae , maxime quar-

ta , quinta , octava , et decima aliter accipiuntur , quod usū discendum , et ex dictionariis : sicut et in quibus coniugationibus quodque verbum usitatum sit : non enim quaelibet radix in qualibet coniugatione occurrit : multae , ut apud Hebraeos , in una solum coniugatione usurpantur ; multae in pluribus ; nulla in omnibus .

Quadrilittera autem quatuor solum agnoscent coniugationes , quarum prima primae , secunda quintae , tertia septimae , quarta nonae trilitterorum respondet : suntque huiusmodi ,

افعَنْلَلْ	فَعَنْلَلْ
افْعَنْلَلْ	تَفَعَّلَلْ

ut *inclinavit caput* ، ترھوك *superbivit* ، أَحْرَنْجِم *tumultuatus fuit* ، اقْسَعَرْ *horripilavit* .

Ad tertiam افعَنْلَل malo cum nonnullis Arabum grammaticis reducere اقْعَنْسِن pectus egrediens habuit et اسْلَنْقَى pronus cubavit , quam cum aliis eorum causa particulares trilitterorum constituere coniugationes .

Est autem cuiusque coniugationis forma duplex , activa et passiva ; quarum eadem ratio quae in lingua hebraea et aliis : unde verba intransitiya cuiuscumque tandem sint coniugationis convenienter naturae suae passivam non agnoscent .

III. In coniugatione quinque sunt partes , quae tempora et modi vulgo dicuntur , praeteritum , 2. futurum , 3. imperativus , 4. participium , 5. infinitivus .

In quibus omnibus tria consideranda sunt . 1. significatio , 2. litterae serviles , 3. vocales litterarum radicalium .

1. Significationem quod attinet ,

Praeteritum respondet nostro praeterito perfecto indicatiui modi : ut طَقَ cecidit , مَاتَ e vita excessit .

Sed verbum substantivum كان fuit , itemque particu-

لَوْ si , اِذَا cum , ei praepositae hanc significacionem solent immutare .

Praeteritum enim eiusdem verbi كَانَ importat ei significationem praeteriti plusquam perfecti indicativi : ut كَانَ ضَرَبَ verberaverat , quasi dicas , fuit verberavit ; sic كَانُوا قَالُوا dixerant ; كَانَ قَدْ أَمْسَكَ iam prehenderat , etc.

لَوْ si id vertit in optativo praesens vel praeteritum perfectum ; et quod sequitur praeteritum , eodem tempore expoundendum est , habetque لـ in capite praefixum : ut لَوْ عَلِمْتُ si scirem hoc monerem te , vel si scivissem hoc , monuissem te . Sed si secunda enuntiationis pars neganda est , usurpatur futurum cum لم ( quod id in praet. vertit ; ut post dicetur ) nec لـ ullum adsciscitur : ut لَوْ كُنْتَ هَاهُنَا لَمْ يَمْتَ أُخْيِي si fuisses hic , non mortuus eset frater meus .

اِنْ si id vertit in subiunctivi futurum , cum aliud praeteritum ( aut huius loco futurum conversum ) ei subiungitur ; quo casu secundum vertendum est per futurum indicativi : ut اِنْ قُلْتُمْ لِي قُلْتُ لَكُمْ si dicatis mihi , dicam vobis ; اِنْ مَا قُلْتُمْ لِي مَأْفَلْ لَكُمْ si non dicatis mihi , non dicam vobis . Puto tamen hac etiam forma efferi praeteritum conditionatum : si dixistis mihi , dixi vobis ; si non dixistis mihi non dixi vobis . Vel in subiunctivi aut indicativi praesens , si aliud praeteritum non subiungitur : ut اِنْ كُنْتَ اَبْنَ اللَّهِ قُلْ si es filius Dei , dic , etc.

اِذَا et اِذْ cum id saepe vertit in subiunctivi futuro-praeteritum , seu futurum in ro : ut اِذَا كَتَبْتَ ذَلِكَ اَحْمَدْ Ubi scripseras illud , laudabo te .

Venit et aliis quibusdam casibus iam memoratorum temporum et modorum loco ; quin et interdum pro praesente , praeterito imperfecto , et futuro indicativi : quae usus docebit ; et ego alibi , ubi fusius de significatione et usu temporum disseram , prolixum enim ea res exigit sermonem , quem hic inserere molestum esset .

2. Futurum , indicativi nostri praesens et futurum complectitur ; quomodo autem exponendum sit , contextus ut plurimum indicat : restringitur tamen non raro ad futurum nostrum , praefixa littera س , aut praemissa vocula سُوفْ , vel huius loco سَفْ يَنْصُرْ ut سَفْ يَنْصُرْ adiuvat vel adiuvabit ; سَفْ يَنْصُرْ سُوفْ يَنْصُرْ سُوفْ يَنْصُرْ سُوفْ يَنْصُرْ at سَفْ يَنْصُرْ سُوفْ يَنْصُرْ etc. adiuvabit , tantum . Sic cum particula negativa لَّنْ nequaquam futurum quoque significat : ut لَّنْ يَنْصُرْ nequaquam iuvabit : et ut plurimum etiam cum لَّا non ; ut لَّا يَضْرِبْ non verberabit : sicuti cum مَا non frequentius praesens ; ut مَا أَعْلَمْ مَا non scio ; cum لَّيْسْ utrumque .

At praemissō لَّمْ non , et لَمَا nondum , praeteriti notio nem induit : ut لَمْ يَضْرِبْ non verberavit , لَمَا يَخْرُجْ nondum egressus est .

Praeposito autem praeterito verbi substantivi , exprimit imperfectum indicativi : ut كَانَ يَجْلِسْ sedebat , nisi praecedat لَوْ ; tunc enim optativi praesentis loco venit , ut et quod ei respondet futurum , cui verbum substantivum لَّوْ كُنْتَ تَعْرِفْ كَنْتَ تُحْبِبْ praefixum habens praeponitur : ut لَوْ كُنْتَ تَعْرِفْ كَنْتَ تُحْبِبْ si nosceres eum , amares eum .

Cum particula أَنْ ut , et aliis idem significantibus , per subiunctivum exponitur : ut أَرِيدْ أَنْ تَكْتُبْ volo ut scribas .

III. Imperativus respondet nostro imperativo : sed usurpatur solum in praeceptis affirmativis , deprecationibus , et hortationibus : nam praecpta negativa , deprecations , et dehortationes per fut. praeposito  $\lambda$  ne concipiuntur : ut  $\lambda$  نَصْرَبُ verbera ,  $\lambda$  نَصْرَبَتْ ne verbera .

Participium nostro respondet : ut صَارِبٌ verberans , مُضْرُوبٌ verberatus . At quia omissione temporis saepe fit nomen , futurum non raro pro eo usurpatur .

Infinitivus non aequipollit nostro , sed Hebraeorum ab soluto : adiungitur enim solum verbo suo significationis augendae gratia ; et per gerundum in do verti uteunque potest , ut  $\lambda$  נָרַג הַרְנוֹ قִתְלָהּ occidendo occidit eum .

Litterae autem serviles , et vocales radicalium manifestae fient in paradigmate .

IV. Numeri in tempore ( excepto infinitivo ) tres sunt : singularis , dualis , pluralis .

V. In numero tres personae ; quarum tertia secundam praecedit , secunda primam : sed haec ultima dualis destituitur .

VI. In persona duplex genus , masculinum et faemimum , quorum quodque suam habet terminationem : sed in singulari et plurali , prima ; in duali , secunda communis est generis .

## C A P U T S E C U N D U M

De prima trilitteri coniugatione .

**P**rimam trilitteri coniugationem reliquae per omnia fere sequuntur : quocirca paradigma eius perfectum distincte hic proponam ; deinde quatenus quadrilittera , et derivativa coniugationes , item verba imperfecta ab eo discedant , paucis ostendam . Paradigma nobis esto  $\lambda$  نَصَرَ adiuvit : cuius forma activa est huiusmodi .

## Praeteritum.

pluralis.	dualis.	singularis.	num.
faem. com. masc.	faem. com. masc.	faem. com. masc.	genus.
نَصْرُوا نَصْرَنِ	نَصْرًا نَصْرَتِا	نَصْرٌ نَصْرَتٌ	3. 3.
نَصْرَتُمْ نَصْرَتُنِ	نَصْرَتُمَا نَصْرَتُنِا	نَصْرَتٌ نَصْرَتٌ	3. 3.
نَصْرَنَا		نَصْرَتْ	I. persona.

## Futurum.

pluralis.	dualis.	singularis.
faem. com. masc.	faem. com. masc.	faem. com. masc.
يَنْصُرُونَ يَنْصُرُنِ	يَنْصُرَانِ يَنْصُرَانِ	يَنْصُرٌ تَنْصُرٌ
تَنْصُرُونَ تَنْصُرُنِ	تَنْصُرَانِ تَنْصُرَانِ	تَنْصُرٌ تَنْصُرِينِ
نَصْرٌ		أَنْصَرٌ

## Imperativus.

pluralis.	dualis.	singularis.
faem. masc.	faem. masc.	faem. masc.
أَنْصُرُونَ أَنْصُرُنِ	أَنْصَرَا أَنْصَرَتِا	أَنْصَرٌ أَنْصَرٌ

## Participium.

pluralis.	dualis.	singularis.
faem. masc.	faem. masc.	faem. masc.
نَاصِرُونَ نَاصِرَنِ	نَاصِرَانِ نَاصِرَتِانِ	نَاصِرٌ نَاصِرَةٌ

## Infinitivus.

نَصْرًا

## De praeterito.

Prima et ultima radicis perpetuo fatha habent : media saepissime quoque fatha , significatione vel intransitiva , ut قعد sedit , vel transitiva , nt حرب verberavit ; rarius kesre , significatione quoque vel intransitiva , ut فرج gavisus est , vel transitiva , ut علم scivit ; rarissime damma , significatione tantum intransitiva , ut حسن bonus fuit . Ac primae quidem duae vocales inter flectendum constanter manent , ultima excidit ; ut in pradigmate , in quo serviles , quae in fine ad formationem numerorum , personarum et generum assumuntur , satis sunt manifestae .

## De futuro.

Futurum formatur adscitis litteris أَتَيْنَ in principio , et يُونَا in fine , eodem fere modo quo apud Hebraeos serviens tibus : elif enim أَتَيْنَ format primam singularem , ut nun pluralem : te secundam ubique personam , et tertiam quoque faemininam in singulari et duali . Ie tertiam masculinam ; et faemininam quoque in plurali . In fine autem nun solum , plurale faemininum format ; ut cum و masculinum ; cum ا autem duale , et cum ie singul . faem . secundae personae .

Habent autem litterae أَتَيْنَ perpetuo fatha , et prima radicalis giezma : at secunda , si habet in praeterito damma , id hic retinet : ut قبْح turpis fuit , بِقْبَحْ . Si kesre , id in phatha mutat ; ut فرج gavisus est , يَفْرَجْ ; sed in نَعْمَ iucundus fuit , حَسْبَ putavit , بِهِسَ desperavit , بِهِسَ aruit , et secundum doctissimos grammaticos etiam in فَضْلَ excelluit ,

قِنْطَلْ desperavit , et عَرَضْ recessit , kesre non raro manet ,  
 diciturque يَخْسِبْ et يَنْعَمْ etc. reperies quo-  
 que يَقْضِلْ cum dsham ; sed ea sunt a praeteritis نَعْمَ  
 et فَضْلُ . Si autem secunda radicis in praeterito phata habeat ,  
 id hic mutatur in damma : ut كَتَبْ scripsit , يَكْتُبْ , vel in  
 kesre : ut ضَرَبْ verberavit , يَضْرِبْ ; nisi ipsa aut tertia radi-  
 cis sit gutturalis ; tunc enim etsi saepe quoque mutetur , ut  
 لَطَرَافَتْ latravit , يَدْخُلْ ; يَنْبَغِي فَبَعْ  
 manet , ut شَغَلْ laboravit , يَشْغُلْ منْعْ donavit , يَمْنَعْ . Sic  
 quoque a رَكْنِ associatus fuit , sine gutturali , est بِرَكْنِ  
 ( quamquam quidam volunt etiam رَكْنِ in praeterito dici ) et  
 ab أَبِي noluit , يَأْبَى : sed hoc imperfectum est .

Ultima radicalis habet dsham , quod accendentibus litteris  
 يُونَا cadit , ut patet in paradigmate . Sed naturalis ista futuri  
 terminatio variatur interdum apocope , antithesi , et paragoge .

Apocope tollit damma finale , et nun يُونَا , praeter id  
 quod format faeminina pluralis : ut haec sit futuri forma ,  
 prorsus hebraica :

plural.

dual.

singular.

يُنْصَرُوا	يُنْصَرَا	يُنْصُر
يُنْصَرُوا	يُنْصَرَا	يُنْصُر
يُنْصُر		يُنْصُر

Ubi vides in plurali masculino abiepto ن assumi l otiosum ,  
 secundum sextum canonem و .

Accidit autem futuro haec apocope ob influentiam parti-

cularium quarundam ei praepositarum, scilicet لَمْ non, لَمْ nondum, لَمْ ne, et لَمْ imperativum: ut لَمْ يَضْرِبْ non verberavit, لَمْ يَتَشَفْ لَمْ يَدْخُلْ nondum ingressus est, لَمْ ne abi, detegat. Item ان si, مَا id quod quidquid, من quicunque, ای idem, مهماً quotiescunque, كييفماً (et apud nonnullos etiam quomodo cunque, اني ubicunque, آين idem, idem, اذ ما quum, اذ ما idem, ايان idem, et in carmine quoque اذ ما, idem. Sed ea lege, ut aliud verbum in eodem orationis contextu tanquam retributive illis respondeat: ut si dicas: quidquid facies faciam, aut feci, quocunque ibis, ibo, quicunque me amabit, amabo illum. Ac tum, si utrumque futurum est, in utrumque influunt: ut مَا تَصْنَعْ مَعَكَ si egrediaris egrediar tecum, مَعَكَ quum se-debit sedebo cum illo, si prius tantum, in illud: ut مَا تَصْنَعْ مَعَنْكَ quidquid facies feci: si posterius, liber est influxus: ut si dicas: vel مَا صَنَعْتَ أَصْنَعْ quidquid fecisti faciam.

Accedit quoque haec apocope, cum praecedat imperativus, cui futurum respondet: ut انصري انصر adiuva me, adiu-vabo te id est, si adiuves me, adiuvabo te.

Antithesin similiter inducunt influentiae particularum quarundam, quae damma tertiae radicalis in fatha mutant, et nun يونا quoque tollunt: ut haec sit futuri forma,

plur.	dual.	sing.
يَنْصُرُونَ يَنْصُرُوا يَنْصُرُونَ	يَنْصُرُانَا يَنْصُرُانَا	يَنْصُرُ
يَنْصُرُوا يَنْصُرُوا يَنْصُرُونَ	يَنْصُرُانَا يَنْصُرُانَا	يَنْصُرُ
يَنْصُرُ		أَنْصُرُ

Particulae autem , quae hanc mutationem causant , sunt لَنْ nequaquam : ut لَنْ يَضْرِبْ nequaquam verberabit , لَنْ يَضْرِبُ nequaquam verberabunt .

لَ Ut , Coniunctio : e. g. جَيْتُ لَانْصَرٍ veni ut adiuuem .

أَنْ idem : ut أَحَبَّ أَنْ تَنْصُرَ cupio ut adiuves . Cum autem significat *quod* , nihil mutat : ut أَعْلَمَ أَنْ يَنْصُرَ scio quod adiu-  
vabit : nisi praecedat verbum opinandi ; qualia sunt ، طَنْ حَسْبٌ  
أَحَسْبُ زَعْمٌ ، etc. tunc enim antithesin inducit , sed libere : ut أَحَسْبُ ، أَحَسْبُ أَنْ يَنْصُرَ et أَنْ يَنْصُرَ ، puto quod iuvabit .

كَى idem : ut جَاءَ كَى يَضْرِبَكَ venit ut verberet te . Sic  
horum composita ، لَكَيَادَ كَيَادٍ et لَكَى ، لَانْ ne .

أَذْنُ ( quidam اذًا ) scribunt ) responsionis et retributionis par-  
ticula , *bene* , *age* , cum ponitur initio sententiae et immediate  
( vel intercedente solum iuramento , vocatione , aut negatione ,)  
ante futurum rem futuram significante : ut si quis dicenti ; النَّجْيَى  
أَذْنُ الْمَيْكَ confugiam ad te , respondeat ، أَذْنُ انصُرَكَ *bene* , *iuvabo*  
te ; vel أَذْنُ *bene* , *per Deum* , *iuvabo te* , vel أَذْنُ وَاللَّهُ أَنْصُرَكَ  
أَذْنُ لا أَنْصُرَكَ *bene* , *amice mi* , *iuvabo te* , vel يَا حَبِيبِي أَنْصُرَكَ  
*bene* , *non iuvabo te* . Si quid aliud intercedit , non influit :  
ut أَذْنُ أَنَا أَنْصُرَكَ *bene* , *ego iuvabo te* . Ut nec si futurum pro  
praesenti ponitur , nec si initio sententiae non collocetur : ut  
يَا حَبِيبِي أَنْصُرَكَ o *amice mi* , *bene* , *iuvabo te* . Si tamen  
solum و vel ف copulativum ei praefigitur , libere influit : ut

وَادْنٌ أَنْصُرُكَ وَادْنٌ et bene , ( et bien Gall. ) adiuabo te , et وَادْنٌ أَنْصُرُكَ ; quanquam hoc rarius .

جَاءَ حَتَّى يَنْصُرَكَ ، cum significat ut : e. g. venit ut adiuvet te , vel donec : أَسْيِرْ حَتَّى تَغْيِبَ الْشَّمْسُ ibo donec occidat sol .

أَرْغِبُ اللَّهُ أَوْ يَغْفِرُ لِيrogabo eadem significatione : ut دِعَةً وَدِعَةً Deum ut parcat mihi , et انتظرةً وَانتظرةً expectabo eum donec egrediatur .

فَ ، cum praefigitur futuro , quod dependet a praecedente enuntiationis parte , includente imperium , petitionem , optationem , interrogationem , aut negationem ; adeoque causalis potius quam copulativa coniunctio est : ut أَنْصُرِي فَانْصُرُكَ adiuva me , et ( vel equidem ) adiuabo te ; لا تُصْرِبْ بَطْرَسْ فيغضبني ne verbera Petrum et irascetur , id est , ne irascatur ، أَيْنَ بِيْتُكَ فَازُوكَ ubi est domus tua ? et invisam te , id est , ut invisam te .

وَ ، cum futuro praepositum , iungit illud cum praecedente enuntiationis parte , includente similiter imperium , petitionem , optationem , interrogationem , aut negationem , significatque et simul : ut هل تَأْكُلُ السَّمْكَ وَتَشْرِبُ الْلَّبْنَ an pisces edes simulq; lac bibes ? ne co mede pisces et simul bibe lac , alio sensu acceptum nihil mutat ; ut هل تَأْكُلُ السَّمْكَ وَتَشْرِبُ الْلَّبْنَ an comedes pisces , et bibes lac ? Idem de praecedentibus particulis habendum .

Paragoge adiicit futuro nun phathatum cum tesdid ; hoc modo .

plural.	dual.	sing.
يُنْصَرُونَ يُنْصَرَانِ	يُنْصَرَانِ تُنْصَرَانِ	تُنْصَرَنِ
تُنْصَرَنِ تُنْصَرَتَانِ	تُنْصَرَانِ	تُنْصَرَنِ
تُنْصَرَنِ		أَنْصَرَنِ

aut giezmatum sine tesdid : sed in singulari solum , ac pluri-  
rali masculino et communi ; in hunc modum ,

plur.		sing.
يُنْصَرُونَ		تُنْصَرَنِ
تُنْصَرَنِ		تُنْصَرَنِ
تُنْصَرَنِ		أَنْصَرَنِ

Illud *nun* paragogicum grave , hoc leve vocatur .

Vides autem , ut ante *nun* damma tertiae radicalis in phatha mutetur ; itemque و et ه serviles in fine excidant ; et in plurali faeminino ا inseratur , ne tria *nun* concurrant .

Adhibetur autem fere solum haec utraq; paragoge , cum futurum rem futura quodammodo petit ut sit interrogando , imperando , vel optando : ut تُنْصَرَنِ هل تُنْصَرَنِ et هل تُنْصَرَنِ an adiu-  
vabis ? لا تُنْصَرَنِ et لا تُنْصَرَنِ adiuvet : لَيْتَ يُنْصَرَنِ لَيْتَ يُنْصَرَنِ ne  
adiuva , لَيْتَ يُنْصَرَنِ utinam adiuvet , etc. Et cum praecedit iuramentum : ut per الله يُنْصَرَنِ per Deum , iuvabit .

### De imperativo .

Imperativus formatur praeposito *elif* unionis cum kesra : ut اعْلَمْ scito , اصْرِبْ verbera , nisi penultimae vocalis , quae talis semper est qualis in futuro , sit damma : tunc enim et

*elīf* damnia habet , ut أَنْصَرْ *iuvā* . Prima radicis giezma possidet ; ut et ultima , quamdui augmenti vocalem nullam recipit . Excuditque interdum ل imperativum post و et ف . Formationi autem generum et numerorum hic inserviunt litterae يُوْلَا , ut in futuro ; cuius *nun* paragogicum hic locum quoque habet : sic ,

plural.	dual.	singul.
أَنْصَرِنَانْ	أَنْصَرَانْ	أَنْصَرِنْ
أَنْصَرِنْ	et sine tesdid .	
أَنْصَرِنْ	أَنْصَرِنْ	أَنْصَرِنْ

Secundam autem personam tantum agnoscit imperativus : reliquae per futurum giezmatum exprimuntur , praefixo ل cum kesra : ut لَيَنْصُرْ *adiuvet* , لَنْدَنْصُرْ *adiuveremus* ; quod et secundae interdum contingit , ut لَتَنْصُرْ *adiuva* . Sed excidit kesra ل , cum praesigitur و vel ف ; ut قَلِيلَنْصُرْ et وَلِيَنْصُرْ *adiuvet* : quin et tum ل etiam interdum omittitur , sed influit tamen .

Prohibitiones quoque per futurum , praeposita giezmantre particula ل ne concipi , iam supra dictum est .

#### De participio .

Huius prima radicalis habet fatha , in quo *elīf* quiescit ; secunda kesra ; ultima damma nunnatum , ut in nominibus , quorum more etiam faemininum et numeros format .

#### De infinitivo .

Verborum transitivorum infinitivus regularis est نَصَرًا , ut ضَرَبَ فَهِمَ verberando verberavit , فَهِمْ intelligendo intellexit : intransitivorum autem , si media radicalis in praeterito

habet fatha, قُعْدٌ قُعُودًا ut نُصُورًا ; sedit : si damma , نُصُورة ; ut جَزْلُ جَزَالَةً facilis fuit : vel نَصَارَةً سُهُولَةً abundavit ; si kesra , فَرَحًا gavisus est . Sed innumera excipiuntur , quae aliter infinitivum formant : adduntque grammatici hisce quinque formis alias 28 ; ut 33 sint in universum ; nempe ,

1 نُصُراً	9 نَصَارَأً	17 نَصَرَى	25 نَصِيرًا
2 نُصُراً	10 نَصَرَةً	18 نَصَرَى	26 نَصِيرًا
3 نُصُراً	11 نَصَرَةً	19 نَصَرَى	27 نَصِيرًا
4 نُصُراً	12 نَصَرَةً	20 نَصَارَانَا	28 نُصُورَاً
5 نُصُراً	13 نَصَرَةً	21 نَصَارَانَا	29 نُصُورَةً
6 نُصُراً	14 نَصَارَةً	22 نَصَارَانَا	30 مَنْصِرَاً
7 نَصَارَاً	15 نَصَارَةً	23 نَصَارَانَا	31 مَنْصُرَةً
8 نَصَارَاً	16 نَصَارَةً	24 نُصُورَاً	32 مَنْصِرَاً
33 مَنْصُرَةً			

## Paradigma passivi .

## Praeteritum .

plur.	dual.	sing.
نُصُرَا	نُصَرَتْا	3 نُصُرَتْ
نُصُرَتْمُ	نُصَرَتْمَا	2 نُصَرَتْ
نُصَرَنَا		نُصَرَتْ

## Futurum.

pluralis.	dualis.	singularis.
faem.com.masc.	faem.com.masc.	faem.com.masc.
يُنْصَرُونَ يُنْصَرُونَ	يُنْصَرَانِ تُنْصَرَانِ	يُنْصَرٌ تُنْصَرٌ
تُنْصَرُونَ تُنْصَرُونَ	تُنْصَرَانِ	تُنْصَرٌ تُنْصَرِينَ
أَنْصَرٌ		أَنْصَرٌ

## Participium.

pluralis.	dualis.	singularis.
faem. masc.	faem. masc.	faem. masc.
مَنْصُورُ مَنْصُورَةٍ مَنْصُورَانِ مَنْصُورَاتٍ	مَنْصُورٌ مَنْصُورَةٌ مَنْصُورَانِ	مَنْصُورٌ مَنْصُورَةٌ

Praeteritum et futurum vocalibus tantum ab activis diffèrent: habetque praeteriti prima perpetuo damma, et secunda kesre. Futuri similiter damma, et secunda radicis fatha. In reliquis cum activo convenient. Participium initio assumit م cum fatha, et quiescens post damma ante ultimam.

Sunt et participia quaedam formae نَصِيرٌ et نَصِيرٌ : quae nunc activa sunt; nunc passiva.

Imperativus hic nullus est; sed pro eo venit futurum cum ل imperativo giezmente: ut لَيُنْصَر adiuvetur, لَتُنْصَر adiuvare, لَتُنْصَر adiuvemur.

## C A P U T T E R T I U M.

De quadrilitteris et coniugationibus derivativis  
prima classis.

Quadrilittera, et verba derivativa primae classis eodem modo flectuntur; et in eo solum a praecedenti diffèrent, quod,

1. Penultima radicalis in activi praeterito perpetuo fatha, in futuro vero kesra habet: أَتَيْنَ autem non minus in activo quam in passivo damma afficiuntur: ut دَحْرَجٌ volvit يُدَحِّرُجْ , فَرِحٌ volutus est دَحْرَجٌ fregit يُدَحِّرُ كَسْرٌ يُفْرِحْ .

2. Imperativus formatur a futuro, sola abiectione أَتَيْنَ, et ultimae vocalis; ut دَحْرَجٌ volve كَسْرٌ frange.

3. Participium utrumque a suo formatur futuro, pro أَتَيْنَ posito, et nunnata vocali ultima; ut مُدَحِّرٌ volvens, مُكَسِّرٌ frangens: et in passivo مُدَحِّرٌ volutus, مُفْرِحٌ exilaratus.

4. Infinitivos habent speciales; دَحْرَجٌ scilicet et دَحْرَجَةٌ.

تَفْعِيلٌ , فَعْلٌ فَعَالاً , تَفْعِيلَةٌ , فَعَالَةٌ فَعَالاً , فَعَالٌ vel فَعَالاً مُفَاعِلَةً , فَاعِلٌ فَعِيلٌ .

فَعَالَةٌ فَعَالاً , فَاعِلٌ فَعِيلٌ .

5. accendentibus أَتَيْنَ abiicit |, secundum regulam: ( | initiale formans verba derivativa, characteristica temporis praefixa, cum sua vocali abiicitur.) ut يَأْنَصُرُ pro يُنَصِّرُ , ab أَنْصَرٌ : unde in imperativo, ubi أَتَيْنَ recedunt, elif cum vocali sua reddit, ut أَنْصَرٌ ; ubi non est putandum formare imperativum, et unionis esse.

6. فَاعِلٌ mutat in in praeterito passivo : ut نُوصِرُ pro نُاصِرٍ ; iuxta secundum canonem generalem .

Quae omnia initialibus paradigmatis vocibus breviter hoc modo visum est proponere .

### Activum .

infin.	part.	imp.	fut.	praet.
فَعَالًا	مُفْعِلٌ	فَعَلَلٌ	يُفَعِّلُ	فَعَلَلٌ
نَفْعِيلًا	مُفْعِلٌ	فَعَلٌ	يُفَعِّلٌ	فَعَلٌ 2
مُفَاعِلًا	مُفَاعِلٌ	فَاعِلٌ	يُفَاعِلٌ	فَاعِلٌ 3
أَفْعَالًا	مُفْعِلٌ	أَفَعِلٌ	يُفَعِّلٌ	أَفَعِلٌ 4

### Passivum .

part.	fut.	praet.
مُفْعِلٌ	يُفَعِّلُ	فَعَلَلٌ
مُفَعَّلٌ	يُفَعِّلٌ	فَعَلٌ 2
مُفَاعِلٌ	يُفَاعِلٌ	فُوَعِلٌ 3
مُفْعِلٌ	يُفَعِّلٌ	أَفَعِلٌ 4

### C A P U T Q U A R T U M

#### De reliquis derivativis .

In reliquis coniugationibus derivativis activi praeteriti penultima semper quoque fatha habet .

Futurum autem fit a praeterito , praefixis أَتَيْنٍ cum fatha ; elif initiali , si quod sit , cadente , secundum regulam abiection-

nis : et fatha ultimo in regulare damma mutato ; penultimō autem in kesra , praeterquam in تَفْعُل ، et تَفَاعُل ، quae id re- tinent : ut congregatus est , يَجْتَمِعُ usurpavit . اسْتَعْمَلْ يَجْتَمِعُ يَعْصِمُ يَنْبَاعِدُ يَنْكَسِرُ يَنْكُسِرُ يَسْتَعْمَلْ يَنْبَاعِدُ يَنْكَسِرُ يَنْكُسِرُ يَسْتَعْمَلْ .

Ac formae istae duae a تَسْتَأْتِي inchoatae id compendii causa interdum abiiciunt , cum أَتَيْنَ تَسْتَأْتِي praefigitur : ut يَنْكَسِرُ pro تَنْبَاعِدُ pro تَنْكَسِرُ : quae ne arbitreris esse futura a فَاعُلْ et فَاعُلْ , facile impudent vocales ; nam eorum futura activa , sunt يَفْعَلْ et يَفْعَلْ ; passiva ; يَفَاعُلْ et يَفَاعُلْ .

Imperativus fit sicut in quadrilitteris ; ut يَنْكَسِرُ frange- tur , يَنْكَسِرُ frangitor : abieco , si quod est , redeunte , sed cum kesra ; ut يَسْتَعْمَلْ usurpabit , اسْتَعْمَلْ usurpa .

Participium assumit et cum damma , et penultimam vocalēm kesra perpetuo habet : ut يَسْتَعْمَلْ usurpans , مَتَبَاعِدٌ re- cedens .

Infinitivus autem cuiusque coniugationis , mox patebit .

Passivum nona et undecima non agnoscunt : reliquae for- mant praeteritum ab activo , primis duabus vocalibus in dam- ma mutatis , et penultima in kesra , ut تَفْعُل a تَفْعُل : et fu- turum quoque a futuro activo , fatha litterarum أَتَيْنَ in dam- ma , et kesra penultimo in fatha converso ; ut يَسْتَفْعِل يَسْتَفْعِل يَسْتَفْعِل يَسْتَفْعِل .

Participium autem a futuro fit , et pro أَتَيْنَ posito : ut مَسْتَفْعِل . Itaque huiusque est paradigmā :

## Activum.

infin.	part.	imp.	fut.	praet.
تَفْعَلَ	مُتَفَعِّلٌ	تَفَعَّلٌ	يَتَفَعَّلُ	5 تَفَعَّلٌ
تَفَاعَلَ	مُتَفَاعِلٌ	تَفَاعَلٌ	يَتَفَاعَلُ	6 تَفَاعَلٌ
أَنْفَعَالَاً	مُنْفَعِلٌ	أَنْفَعَلٌ	يَنْفَعَلُ	7 أَنْفَعَلٌ
أَفْتَعَالَاً	مُفَتَّعِلٌ	أَفْتَعَلٌ	يَفْتَعَلُ	8 أَفْتَعَلٌ
أَفْعَادَلَا	مُفَعَّلٌ	أَفْعَلَلٌ	يَفْعَلُ	9 أَفْعَلٌ
أَسْتَفَعَالَاً	مُسْتَفَعِلٌ	أَسْتَفَعَلٌ	يَسْتَفَعَلُ	10 أَسْتَفَعَلٌ
أَفْعَيَادَلَا	مُفَعَّلٌ	أَفْعَالَلٌ	يَفْعَالٌ	11 أَفْعَالٌ
أَفْعَيَاعَالَا	مُفَعَّولٌ	أَفْعَوَلٌ	يَفْعَوَلٌ	12 أَفْعَوَلٌ
أَفْعَواَدٍ	مُفَعَّولٌ	أَفْعَوَلٌ	يَفْعَوَلٌ	13 أَفْعَوَلٌ

## Passivum.

part.	fut.	praet.
مُتَفَعِّلٌ	يَتَفَعَّلُ	5 تَفَعَّلٌ
مُتَفَاعِلٌ	يَتَفَاعَلُ	6 تَفَاعَلٌ
مُنْفَعِلٌ	يَنْفَعَلُ	7 أَنْفَعَلٌ
مُفَتَّعِلٌ	يَفْتَعَلُ	8 أَفْتَعَلٌ
مُسْتَفَعِلٌ	يَسْتَفَعَلُ	10 أَسْتَفَعَلٌ
مُفَعَّولٌ	يَفْعَوَلٌ	12 أَفْعَوَلٌ
مِفَعَوْلٌ	يَفْعَوَلٌ	13 أَفْعَوَلٌ

Et sic quoque quadrilittera .

Activum .

infin.	part.	imp.	fut.	praet.
تَفْعِلَةً	مُتَفَعِّلٌ	تَفَعِّلٌ	يَتَفَعِّلُ	تَفَعِّلٌ
أَفْعَنَدَلَا	مُفْعَنَلٌ	أَفْعَنَلٌ	يَفْعَنَلُ	أَفْعَنَلٌ
أَفْعَلَلَا	مُفْعَلٌ	أَفْعَلَلٌ	يَفْعَلَلُ	أَفْعَلَلٌ

Passivum .

مُتَفَعِّلٌ	يَتَفَعِّلُ	تَفَعِّلٌ
مُفْعَنَلٌ	يَفْعَنَلُ	أَفْعَنَلٌ
مُفْعَلٌ	يَفْعَلَلُ	أَفْعَلَلٌ

C A P U T Q U I N T U M .

De verbo surdo , seu geminante secundam radicalem .

Hactenus , de verbo perfecto : imperfectum est triplex : surdum , hamzatum , et quiescens .

Surdum est quod ultimam radicalem penultimae similem habet , quarum prior posteriori vocalem habenti per tēsdid inseritur , propria vocali vel abiecta , si praecedens vocalē habeat , ut م pro م extendit , م pro م extensus est ; vel in praecedentem reiecta , si ea giezma habeat , ut بـمـ pro بـمـ extendet , بـمـ pro بـمـ extendetur . Dixi posteriori vocalē habenti : nam cum ea giezma habeat nequit fieri contractio , ut مـدـتـ مـدـتـ extendisti . Itaque huiusmodi est eius coniugatio .

## Praeteritum.

plural.	dual.	singul.
مَدَّوْنَ مَدَّوْنَا مَدَّوْنَ	مَدَّتَانِ مَدَّتَانِ مَدَّتَ	مَدَّتَ مَدَّتَ مَدَّتَ
مَدَّتَمِ مَدَّتَمِ مَدَّتَمِ	مَدَّتَمِ مَدَّتَمِ مَدَّتَمِ	مَدَّتَمِ مَدَّتَمِ مَدَّتَمِ
مَدَّدَنِ مَدَّدَنِ مَدَّدَنِ		مَدَّدَنِ مَدَّدَنِ مَدَّدَنِ

## Futurum.

plural.	dual.	singul.
يَمَدُونَ يَمَدُونَ يَمَدُونَ	يَمَدَانِ يَمَدَانِ يَمَدَانِ	يَمَدَ يَمَدَ يَمَدَ
تَمَدُونَ تَمَدُونَ تَمَدُونَ	تَمَدَانِ تَمَدَانِ تَمَدَانِ	تَمَدَ تَمَدَ تَمَدَ
أَمَدُونَ أَمَدُونَ أَمَدُونَ		أَمَدَ أَمَدَ أَمَدَ

## Imperativus.

plur.	dual.	sing.
أَمَدَّوْنَ أَمَدَّوْنَأَمَدَّوْنَ	أَمَدَّا أَمَدَّا أَمَدَّا	أَمَدَدِي أَمَدَدِي أَمَدَدِي

## Participium.

plural.	dual.	sing.
مَادَّوْنَ مَادَّوْنَ مَادَّوْنَ	مَادَّتَانِ مَادَّتَانِ مَادَّتَانِ	مَادَّةٌ مَادَّةٌ مَادَّةٌ

## Infinitivus.

مَدَا

## De Praeterito.

Similis ratio est eorum, quorum media radicalis habet  
damma vel kesra, ut مَسَسَ tetigit pro مَسَسَ tetigisti,  
etc.

## De futuro.

Sic cum penultima radicalis habet fatha vel kesra, ut يعْصِي <sup>يُعْصِي</sup> mordebit, pro يَفْرُرْ يَعْصِي fugiet pro يَفْرُرْ يَعْصِي. Si particula giezmans seu apocopen inducens praeponitur, ultimaque radicis giezma recipit, omnia regularia sunt: ut لَمْ يَمْدَدْ non exten-dit, لَمْ يَفْرُرْ non momordit, لَمْ يَفْرُرْ non fugit: vel, ut contractio fieri possit, loco giezmae inducitur fatha vel kesra, ut لَمْ يَعْصِي vel لَمْ يَمْدَدْ etc. Interdum etiam manet damma, cum penultima radicalis damma quoque habet: ut لَمْ يَمْدَدْ.

## De imperativo.

Imperativus ut vides, regulariter flectitur, sed et (excepto plur. faem.) non raro contractionem patitur, hoc modo:

plural.	dual.	sing.
مَدُوا مَدَدُنْ	مَدَا	مَدَى

Ubi ! imperativum omititur secundum regulam: *elīf* imperativum non praefigitur litterae vocalem habenti. In singul. masc. tertia, quo tesdid recipere possit, accipit fatha ut مَدَدْ vel kesra; ut مَدَدْ extende.

## De participio et infinitivo.

Participium et infinitivus perpetuo contrahuntur, eo modo, quo in paradigmate.

Similis est ratio passivi ut

## Praeteritum.

	dual.	sing.
&c.	مُدَّتَا مُدَّا	مُدَّت مُدَّ
	مُدَّتَمَا	مُدَّت مُدَّ
		مُدَّت مُدَّ
		مُدَّت مُدَّ

## Futurum.

	dual.	sing.
&c.	يَمْدَانٌ تَمْدَانٌ	يَمْدَنٌ تَمْدَنٌ
	تَمْدَانٌ	يَمْدَنٌ قَمْدَنٌ
		قَمْدَنٌ أَمْدَنٌ

## Participium.

	dual.	sing.
&c.	مَمْدُودَانٌ مَمْدُودَانٌ	مَمْدُودٌ

مد est pro مُد : abiiciturque kesra, quia littera praecedens habet vocalem. يَمْدَنٌ autem pro يَمْدَنٌ retrocedente fatha, quia praecedit giezma. Participium regulare est, ob illoid quiescens insertum.

Derivativarum coniugationum eadem est ratio : ut

## Activum.

Praeteritum .	Futurum .
أَمْدَنٌ	يَمْدَنٌ
أَنْمَدٌ	يَنْمَدٌ
أَسْنَمَدٌ	يَسْنَمَدٌ

et sic caeterae , exceptis iis quae tesdid habent : eae enim perfecte flectuntur ; ( quia unum tesdid duas compensare litteras nequit , aut una littera duo sustinere tesdid : ut

&c.	تمددت تمددت تمددت	تمدد تمددت تمددت	مددت مددت مددت	مدد مدد مدد
		تمددت		مددت

## Observatio I.

Observandum autem est verba perfecta trilittera nonae et undecimae coniugationis , et quadrilittera quartae , id est , quae ultimam radicis afficiunt tesdid , eandem hanc rationem sequi : dicitur enim

in praeterito .			in futuro .
اَصْفَرُ	اَصْفَرَرُ	يَصْفَرُ	يَصْفَرِرُ
اَصْفَارُ	اَصْفَارَرُ	يَصْفَارُ	يَصْفَارِرُ
اَقْمَطْرُ	اَقْمَطَرَرُ	يَقْمَطِرُ	يَقْمَطِرِرُ

unde cum secunda germinatorum requirit giezma , separatim utraque scribitur , ut اَصْفَرَرُتْ اَصْفَارَرُتْ اَقْمَطَرَرُتْ اَقْمَطْرَرُتْ : et sic in futuro giezmato , et imperativo : ubi tamen et contratio adhiberi potest fatata vel kesrata vocali ultima , quemadmodum in surdis , hoc modo .

## Futurum giezmatum .

يَصْفَرِرُ	يَصْفَرُ	يَصْفَرِرُ
يَصْفَارِرُ	يَصْفَارُ	يَصْفَارِرُ
يَقْمَطِرِرُ	يَقْمَطِرُ	يَقْمَطِرِرُ

## Imperativus.

أصْفَرُ		أصْفَرُ		أصْفَرُ
أصْفَارُ	&	أصْفَارُ		أصْفَارُ
أقْمَطْرُ		أقْمَطْرُ		أقْمَطْرُ

Ubi vides, in nona et undecima penultimam futuri kesra quoque habere; etsi id in contractione excidit, quia littera antecedens vocalem possidet.

## Observatio II.

Verba terminata litteris ن et و hic quoque, ut apud Hebraeos, illas, cum giezma habent ante ن vel و servile, sequenti inserunt, secundum canonem de secunda syllabae mixtae littera, ut زَيْنَنا ornavimus pro سَكَّتَ tacuisti pro سَكَّتَتْ. Sed non videntur propterea imperfectis annumeranda esse: sicut nec quae a ن vel و inchoantur, quod ن et و characteristicae coniugationum in iis delitescant; ut أَنْقَبْ possus est, pro أَنْجَرْ; أَنْقَبْ negotiatus est, pro أَنْجَرْ. Vide caput primum huius libri.

## C A P U T S E X T U M .

## De verbo hamzato.

V erbum hamzatum est cuius radicalium aliqua est hamza, seu *elif* mobile: ut أَثْرَ maluit, أَلَّا interrogavit, هَنَا concoxit: flectiturque eodem modo quo verbum perfectum, observatis solum canonibus de *elif*.

Itaque huiusmodi est flexio hamzati *phe* sive prima radicali.

## Activum.

Praet. أَثْرٌ, regulariter. Fut. يَاشِرٌ, regulariter.

Imp. أَثْرٌ pro أَثْرٌ, iuxta can. 2. generalem.

Part. أَثْرٌ pro أَثْرٌ, iuxta can. 5. elif.

Inf. أَثْرًا, regulariter.

Cum ḥ imperativum damma habet, mutatur hamza in و, iuxta can. secund. generalem: ut أَمْلُ pro أَمْلٌ: sed أَخْدُ accepit, أَكْلُ comedit, أَمْرُ praecepit, abiiciunt hamza cum ḥ imperativo habentque خد accipe, كُلُّ ede et مُرُ iube: reperias tamen etiam, quanquam rarissime, أَوْكُلُ, ac أَوْمُرُ, et ab hoc, cum و copulativo, وَمُرُ فَامُرُ; sic فَامُرُ; excidente ḥ imperativo et redeunte radicali.

## Passivum.

Praet. أَثْرٌ, regulariter.

Fut. يَاشِرٌ pro يَاشِرٌ, iuxta can. sec. de ḥ quiescente.

Part. مَايَاشِرٌ, regulariter.

Sic in secunda coniugatione.

بُونَر		يَاشِرٌ		يَنْصُرٌ	
مُونَر		مَايَاشِرٌ		مَنْصُرٌ	
بُونَر	pro	يَاشِرٌ	instar	يَنْصُرٌ	iuxta canon. 2. elif.
مُونَر		مَايَاشِرٌ		مَنْصُرٌ	
يَاشِرٌ		يَاشِرٌ		يَنْصُرٌ	

مُواثرٌ	مَا ثَرٌ		مُناصرٌ	
يُواثرٌ	يَا ثَرٌ	instar	يُنَاصِرٌ	iuxta canon. 2. elif.
مُواثرٌ	مَا ثَرٌ		مُناصرٌ	
مُواثرٌ	مَا ثَرٌ		مُناصِرٌ	

In tertia et quarta,  
 يُواثرٌ pro مُواثرٌ instar مُناصرٌ iuxta canon.  
 مُواثرٌ vel مُواثرٌ et مُناصرٌ، iuxta canon.  
 مُواثرٌ 5. elif.

يُونُورٌ	يَا ثَرٌ		يُنَاصِرٌ	
مُونُورٌ	مَا ثَرٌ		مُنَاصِرٌ	
يُونُورٌ	يَا ثَرٌ	instar	يُنَاصِرٌ	iuxta secun- dum canon. 2. gener.
مُونُورٌ	مَا ثَرٌ		مُنَاصِرٌ	
إِبْنَارًا	الثَّارًا		إِنْصَارًا	

Ita et in caeteris eoniugationibus hamza ob damma , kesra , aut aliud hamza mutatur , aut excidit , secundum canones memoratos : reliqua omnia perfecta sunt .

Hamzata aut *ain* et *lam* eandem quoque rationem sequuntur : ut ,

سَائِلٌ	سَالٌ		iuxta canon. 1. elif.
سَيْلٌ	سُالٌ		
هَانِي	هَانًا		iuxta canon. 3. elif.
هَنِي	هَنًا		

Sed observandum est , hamzata *ain* interdum etiam , etsi rarius , coniugari more quiescentium ; ita ut hamza vocali sua

abiecta , vel ad litteram praecedentem giezma habentem re-  
iecta , quiescat : ut **لَّا** pro **لَّا** يَسْأَلُ pro **لَّا** سَلْ : يَسْأَلُ pro  
**أَسْأَلُ** , ubi utrumque *elif* exedit : radicale quidem , secundum  
tertium can generalem ; imperativum vero , secundum cano-  
nem imperii .

## C A P U T S E P T I M U M.

De verbo quiescente *phe* و et ى.

**V**erba quiescentia sunt , quae radicalem aliquam habent  
و vel ى ; sive prima ea sit , ut **جَدَّ** invenit , يَسْرُّ **الْأَلْهَانِ** ;  
sive secunda , ut **قَوْلَ** dixit , سَبَرَ **يَقِنَّ** ; sive ultima , ut **وَمَىٰ**  
iecit , هَزَّ **أَوْلَادَ** oppugnavit .

Quiescentia *phe* , hoc est , quae primam radicalem و vel  
ى habent , similia proprie Arabibus dicuntur . Quiescentia و  
exiguam habent anomaliam ; quae in eo potissimum consistit ,  
quod و excidit in futuro activo primae coniugationis , cum pe-  
nultima eius littera habet kesra ( quod hic plerisque etiam il-  
lis verbis contingit , quorum secunda radicalis in praeterito  
kesra habet : ) ut ,

وَعَدَ assignavit .		يَعْدُ	يَوْعَدُ	
وَرَتَ haereditavit .	fut.	يَرْتُ	يَوْرَتُ	يَضْرِبُ ut
وَمَقَ amavit .		يَمْقُ	يَوْمَقُ	

Quod etiam imperativo tunc accidit : ut **عَدْ** pro **أَعْدَنْ** ,  
أَوْمَقْ pro **مَقْ** : et infinitivo , cum est formae **فَعْلَةً** : ut **عَدَةً** pro  
**مَقَّةً** , وَعَدَةً **مَقَّةً** : si vero alias formae est , regulariter for-  
matur ; ut **وَعَدًا** , instar **نَصْرًا**.

Cum autem penultima rad. in futuro kesra non habet, regulare est; ut <sup>وَجْه</sup> <sup>تَدِيدٌ</sup> tendit وَجْه timuit ( quidam tamen tunc euphoniae causa وَ in لـ mutant, dicuntque يَاجْلُ: alii in لـ mobile, يَبِحَّلُ; alii in لـ quiescens post kesra, quod ponitur loco fatha litterarum اتَيْنَ ( يَبِحَّلُ : sic et imperativus, ut أَوْجَهْ; at si لـ habet kesra, وَ mutatur in لـ secundum canon. 2. gen. ut اَوْجَلْ pro اَيْجَلْ instar اَعْلَمْ.

Sed وَطَى pro وَطَى subiecit, وَسَعَ amplius fuit, وَقَعَ cecidit, وَدَعَ sivit, وَفَبَ donavit, et وَضَعَ posuit; etsi forment futurum cum fatha ad penultimam; وَ tamen, non secus ac si penultimam kesra haberet, abiiciunt: quia fatha illud habent pro kesra, ob ultimam vel penultimam gutturalem, diciturque, يَطَأْ وَسَعَ يَقْعَ, يَسْعَ etc. et in imp. قَعَ, سَعَ, طَأْ, etc.

Sic et sine gutturali يَذْرَ sinit, ab insinuato in praeterito et participio وَذْرَ.

Quiescentia autem phe لـ, mutant illud in وَ, cum giezma habet post damma, iuxta canon. 2. generalem: ut اَيْسَرْ <sup>دِيْنَسْ</sup> di-nes fuit, habet in Futuro يَوْسَرْ pro يَوْسَرْ, instar يَنْصَرْ: et in participio مُؤْسَرْ pro مَيْسَرْ, ut مَنْصَرْ.

In reliquis omnibus utraque perfecta sunt; nisi quod in coniugatione octava اَفْتَعل وَ et لـ in لـ mutant, idque ت characteristico per tesdid inserunt; ut dictum est huius libri cap. primo, ut

أَتَعْدُ		أَوْتَعْدُ	أَيْسِرٌ	أَبِنْسِرٌ
يَتَعْدُ	pro	يَوْتَعْدُ	يَيْسِرٌ	يَبِنْسِرٌ
مَتَعْدُ		مَوْتَعْدُ	مَيْسِرٌ	مَبِنْسِرٌ
أَتَعَادَا		أَوْتَعَادَا	أَتَسْلَارًا	أَبِنْسَارًا

Manent tamen interdum, et accommodant sese vocali praecedenti; cui, si non sunt, fiunt homogeneae, ut

أَيْتَعْدُ		أَوْتَعْدُ	أَيْسِرٌ	أَبِنْسِرٌ
يَاتَعْدُ	pro	يَوْتَعْدُ	يَيْسِرٌ	يَبِنْسِرٌ
مَوْتَعْدُ			مَيْسِرٌ	مَبِنْسِرٌ
أَيْتَعَادَا	pro	أَوْتَعَادَا	أَتَسْلَارًا	أَبِنْسَارًا

## C A P U T O C T A V U M

De quiescente *ain*.

Quiescentia *ain* ab arabibus vacantur concava: suntque ea quae habent medium radicalem و vel ئ; quae in litterae prima, quarta, septima, octava et decima coniugatione aut excidunt, aut vocali sua amissa quiescunt; unde maximam in iis haec verba habent irregularitatem.

Paradigmata primae coniugationis sunt huiusmodi:

Concavum و.		
Praeteritum .		
plural.	dual.	singul.
قُلْنَا	قَالُنَا	قَالَ
قُلْتُمْ	قُلْتُمَا	قُلْتُ
قُلْنَا		قُلْتُ

3

2

1

## Futurum.

plural.	dual.	singular.	
يَقُولُونَ يَقُولُنَّ	يَقُولَانِ تَقُولَانِ	يَقُولُ تَقُولُ	3
تَقُولُونَ تَقُولُنَّ	تَقُولَانِ	تَقُولُ تَقُولِينَ	2
نَقُولُ		أَقُولُ	1

## Imperativus.

plural.	dual.	sing.
قُولُوا قُلْدَنْ	قُولَا	فُولِي

## Participium.

plural.	dual.	singul.
قَائِيلُونَ	قَائِيلَدَنْ	قَائِيلٌ
قَائِيدَتْ	قَائِيلَتَانِ	قَائِيلَةٌ

## Infinitivus.

قَوْلًا.

## Concavum ى.

## Præteritum.

pluralis.	dualis.	singularis.
faem. com. masc.	faem. com. masc.	faem. com. masc.
سَرَنْ	سَارُوا	سَارَتْ
سِرَنْ	سِرْتَمْ	سِرَتْ
سِرَنَا	سِرْتَمَا	سِرَتْ

## Futurum .

plural.	dual.	singul.
faem.com.masc.	faem.com.masc.	faem. com. masc.
يَسِيرُونَ	يَسِيرَانِ	يَسِيرٌ
تَسِيرُونَ	تَسِيرَانِ	تَسِيرٌ
تَسِيرَنَ	تَسِيرَانِ	تَسِيرٌ
تَسِيرٌ		أَسِيرٌ

## Imperativus .

plur.	dual.	singul.		
faem.	masc.	com.	faem.	masc.
سِيرُوا	سِيرَا	سِيرِي	سِيرٌ	سِيرٌ

## Participium .

سَايِرٌ	سَايِرَةٌ	سَايِرَانِ	سَايِرُونَ	سَايِرَاتٍ
---------	-----------	------------	------------	------------

## Infinitivus .

سِيرًا

## De Praeterito .

In tertii personis ( excepta plurali faem.) و et vocali sua abiecta mutantur in ل quiescens post fatha primae radicalis , ut sint pro

قُولُوا	قُولَّنَا	قُولًا	قُولَتْ	قُولٌ
سِيرُوا	سِيرَنَا	سِيرًا	سِيرَتْ	سِيرٌ

et sic quoque cum media habet kesra vel damma ; ut خَافَ timuit pro طَالَ longus fuit , pro حَوْفَ هَابَ pavit pro هَيْبَ .

In reliquis ipsae excidentes (iuxta canonem tertium general.) vocalem suam ad litteram praecedentem , cuius vocalis perit , reiiciunt , immutatam quidem si est kesra vel damma , ut

&c.	خَفْتُ	خَفْتُ	خَفْتُ	خَفْتُ	خَوْفَتُ	خَوْفَتُ	خَوْفَتُ
&c.	طُلْتُ	طُلْتُ	طُلْتُ	طُلْتُ	طُولْتُ	طُولْتُ	طُولْتُ
&c.	هَبْتُ	هَبْتُ	هَبْتُ	هَبْتُ	هَيْبَتُ	هَيْبَتُ	هَيْبَتُ

at mutatam , si est fatha , in damma quidem cum quiescens est و , ut

&c.	قُلْتُ	قُلْتُ	قُلْتُ	قُلْتُ	قَوْلَتُ	قَوْلَتُ	قَوْلَتُ
-----	--------	--------	--------	--------	----------	----------	----------

in kesra vero cum est ى , ut

&c.	سِرْتُ	سِرْتُ	سِرْتُ	سِرْتُ	سِيرْتُ	سِيرْتُ	سِيرْتُ
-----	--------	--------	--------	--------	---------	---------	---------

Itaque prima radicalis concavorum ى in istis personis kesra perpetuo habet : nam formam فَعْلَ inveniri in iis non puto : at in concavis و , damma , a formis فَعَلْ et فَعْلَ ; vel kesra a فَعْلَ .

#### De futuro .

Penultima radicis si in praeterito fatha habet , id hic quiescentia و in damma , quiescentia ى in kesra mutant , ut يَقُولُ ; يَقُولُ ، si kesra , in fatha , يَهَابُ ، يَخَافُ ; si damma , id regulariter manet , ut يَطُولُ . Reiciuntur autem ea vocalis ad primam radicalem , ut secunda in ea quiescat : quod fit absque ulla mutatione , si sit damma vel kesra ; at conversione quiescentis in ى , si fatha ; ut in exemplis allatis ; ponuntur enim pro يَطُولُ ، يَهَبُ ، يَخَافُ ، يَقُولُ ، يَسِيرُ ، يَهِبُ ، et يَقُولُ . At in plurali faem. ob giezma litterae sequentis ( iuxta can. 3. general.)

quiescens excidit , diciturque يَخْفِنُ , يَسْرُنُ , يَقْلُنُ pro يَخْفَنُ , يَسْرَنُ , يَقْلَنُ quod et eadem de causa in apocope iis personis accidit , quarum tertia radicalis giezma recipit : ut

نُقلٌ	أَقْلٌ	تُقلٌ	يَقْلٌ	لِمْ
تَسْرٌ	أَسْرٌ	تَسْرٌ	يَسْرٌ	
تَخْفٌ	أَخْفٌ	تَخْفٌ	يَخْفٌ	

De imperativo .

*Elif* hic non praesigitur ob canonem imperii ; accipit enim prima vocalem secundae , quae quiescit expressa ; praeterquam in singulari masculino et plurali faem. ubi excidit ob giezma tertiae radicalis . Unde in singul. mascul. cum ن paragogico , quod tertiae dat fatha , redit : ut قُولَن dic , مِيرَن vendē , خَافَن time .

De participio .

Hic secunda ob *elif* quiescens , quod primae post ponitur , cogitur ad motum ( duae enim quiescentes concurrere nequeunt ) a quo abhorrens in locum suum substituit hamza seu *elif* mobile ; quod secundum canonem primum *elif* in ۲ mutatur : itaque فَائِلٌ est pro قَائِلٍ , et hoc pro فَاعِلٌ سَاعِرٌ ; فَاعِلٌ سَاعِرٌ , et hoc pro سَاعِرٌ سَاعِرٌ .

De infinitivo .

Infinitivus regularis est .

Passivum concavi و.

Praeteritum .

plural.	dual.	sing.
قِيلُوا قَلْنَ	قِيَادٌ قِيلَتْ	قِيلٌ قِيلَتْ
قِلْتُمْ قَلْتَنْ	قِلَّتْ	قَلْتَ قِلْتَ
قِلْتَنَا		قِلْتُ

Futurum .

plural.	dual.	sing.
يُقالُونْ يُقلَّنْ	يُقالَانِ تُقالَانِ	يُقالُ تُقالُ
تُقالُونْ تُقلَّنْ	تُقالَانِ	تُقالُ تُقالَينْ
نُقالْ		أَقَالْ

Participium .

مُقُولٌ مُقُولةٌ مُقُولَانِ مُقُولَاتِ

Passivum concavi ى.

plural.	dual.	sing.
سِيرُوا سِرَنْ	سِيرَا سِيرَتْ	سِيرٌ سِيرَتْ
سِرْتُمْ سِرَتَنْ	سِرْتَمَا	سِرَتْ سِرَتْ
سِرَنَا		سِرَتْ

Futurum .

plural.	dual.	sing.
يُسَارُونْ يُسَرَنْ	يُسَارَانِ تُسَارَانِ	يُسَارُ تُسَارُ
تُسَارُونْ تُسَرَنْ	تُسَارَانِ	تُسَارُ تُسَارَينْ
نُسَارْ		أَسَارُ

## Participium.

plural.	dual.	sing.
مسيراتٌ	مسيرانٌ	مسيرةٌ

## De praeterito.

Kesra mediae radicalis reicitur ad primam , cuius vocalis perit ; ut pro سير sit قيل , et pro قول waw in ie mutato , iuxta can. 2. generalem . Secundae et primae personae concavorum ie coincidunt cum activo , sed sensu orationis facile distinguuntur .

## De futuro.

Fatha mediae radicalis ad primam retrocedente ، و et ي mutantur in ل quiescens , iuxta can. 2. gen. quo ل regulariter in plur. faem. excidit : est itaque يقال pro يقال ، يقال pro يقال .

## De participio .

Damma secundae radicalis ad primam reiecto ، و particiale ( etsi quidam malunt radicale ) excidit ; quia duae litterae simul in una vocali nequeunt quiescere : estque مقولٌ pro مقولٍ : et ي quiescens non accommodat se more solito vocali praecedenti damma ; sed contra , discriminis ergo , eam sibi accommodat , vertitque in kesra , ut dicatur مسیر ، non مسیر ، pro مسیر .

Reperies tamen etiam apud auctores probatos , maxime apud poetas , participia haec regulariter formata , potissimum in concavis مصوون custoditus , مخبوط consutus , مكحول mensuratus .

Similis est ratio coniugationum quartae , septimae , octavae , et decimae : in his enim و et ي moveri quoque nolunt ,

sed abiecta vocali sua vel ad praecedentem reiecta quiescunt,  
expressae ante vocalem, abiectae ante giezma, hoc modo:

## Activa.

infin.	part.	imp.	fut.	praet.	
أَفَالَةُ	مُقْبِلٌ	أَقْلٌ	يُقْبِلُ	أَفَالٌ	4
أَسَارَةُ	مُسْبِرٌ	أَسْرٌ	يُسْبِرُ	أَسَارٌ	
أَنْقِيَالَا	مُنْقَالٌ	أَنْقَلٌ	يُنْقَالُ	أَنْقَالٌ	7
أَنْسِيَارَا	مُنْسَارٌ	أَنْسَرٌ	يُنْسَارُ	أَنْسَارٌ	
أَفْتِيَالَا	مُقْتَالٌ	أَفْتَلٌ	يُقْتَالُ	أَفْتَالٌ	8
أَسْتِيَارَا	مُسْتَارٌ	أَسْتَرٌ	يُسْتَارُ	أَسْتَارٌ	
أَسْتَقَالَةُ	مُسْتَقِيلٌ	أَسْتَقْلٌ	يُسْتَقِيلُ	أَسْتَقَالٌ	
أَسْتِسَارَةُ	مُسْتَسِيرٌ	أَسْتَسِرٌ	يُسْتَسِيرُ	أَسْتَسَارٌ	10

## Passiva.

مسار	أسير	بسار	مقال	يقال	أقييل	4
منسار	أنسيير	ينسار	منقال	يُنقال	أنقييل	7
مستار	استير	بستان	مقتال	يُقتَالُ	افتيل	8
مستسار	استسير	يُستسار	مستقال	يُسْتَقَالٌ	أستقيل	10

Vides hic non differre concava و a concavis ی: et participia quoque passiva septimae et octavae coniugat. coincidere cum activis: sed usus et circumstantia textus ea discernunt. In infinitivis quartae et decimae coniugationis و et fatha suo ad praecedentem giezmatam reiecto, in *elif* quiescens mutau-

tur; post quod illud quiescens quod ad formationem infinitivi ultimae praeponitur in اِنْصَارًا et استنصاراً، excidit, ob causam in participio allatam; sed ad compensationem eius in fine accedit, diciturque اِسْتَقْوَالَةُ، اِقْوَالًا pro اِسْتَقْالَةٍ.

Septimae et octavae coniugationis infinitivi medium regulariter movent; sed concaya و eam insuper in ى mutant, ut patet in paradigmate.

Reliquae coniugationes perfectae inflectuntur; ut

	فَوْلٌ	يُقُولُ	قُولٌ	مُقْوَلٌ	نَقْوِيَّاً	
	فَأَوْلٌ	يُقَائِولُ	قَائِولٌ	مُقَائِولٌ	مَقْأَوْلَةً	
	سَيِّرٌ	يُسَيِّرُ	سَيِّرٌ	مَسَيِّرٌ	تَسْبِيرًا	
	سَابِرٌ	يُسَابِرُ	سَابِرٌ	مَسَابِرٌ	مُسَابِرَةً	
et sic quoque	تَقَوْلٌ	تَقَوْلٌ	تَقَوْلٌ	تَقَوْلٌ	تَقَوْلٌ	

Quin et verba quaedam medium vel ى habentia in primis illis coniugationibus regulariter etiam inflecti reperies: ut

عَاوَرٌ	عَوْرٌ	بَعْوَرٌ	عَوْرٌ	عَوْرٌ	عَاوَرٌ
صَابِدٌ	صَبِيدٌ	بَصِيدٌ	صَبِيدٌ	صَبِيدٌ	صَابِدٌ

اعْتَوْرٌ	انْعَوْرٌ	اعْتَوْرٌ	اعْتَوْرٌ	اعْتَوْرٌ	اعْتَوْرٌ
اَسْتَصِيدٌ	اَصْتَبِيدٌ	اَصْتَبِيدٌ	اَصْتَبِيدٌ	اَصْتَبِيدٌ	اَصْتَبِيدٌ

quaedam etiam in prima coniugatione imperfecta esse; in quarta vero, modo perfecta, modo imperfecta: ut,

رَاحَ quievit.	أَرَاحَ et اَرَاحَ
غَامَ exhalavit.	أَغَامَ et اَغَامَ

Sic concaya و in decima coniug. saepissime perfecte etiam

coniugantur : ut استَجْهَابٌ exaudivit , et  
استَصْبَابٌ approbavit , quin non nemo grammaticorum id per-  
petuo ait liberum esse ; quod non probo .

## C A P U T N O N U M .

De verbo quiescente لـ.

Quiescentia لـ , hoc est , quae ultimam radicalem habent  
وـ vel لـ defectiva proprie vocantur ab Arabum grammaticis ;  
et hoc modo flectuntur in prima coniugatione .

Activum defectivi وـ.

Praeteritum .

plural.	dual.	singul.
غَزُونٌ	غَزْتَانِ	غَزْتَ
غَزُوتُمْ	غَزْوتَمَا	غَزْوتُ
غَزُونَةً		غَزْوتُ

Futurum .

plur.	dual.	sing.
يَغْزُونُ	يَغْزُونَانِ	تَغْزُونُ
تَغْزُونُ	تَغْزُونَانِ	تَغْزِيْنُ
نَغْزُونُ		أَغْزُونُ

Imperativus .

plural.	dual.	singul.
أَغْزُونُ	أَغْزَوا	أَغْزِزُ

## Participium.

plural.	dual.	singul.
غَازُونَ	غَازِيَانِ	غَازِيَّةٌ
غَازِيَاتٌ	غَازِيَتَانِ	غَازِيَّةٌ

Infinitivus.

فَزْوًا

## Activum defectivi.

## Praeteritum.

plur.	dual.	sing.
رَمِيَّا	رَمِيَّا	رَمِيَّ
رَمِيَّتَانِ	رَمِيَّتَانِ	رَمِيَّتَ
رَمِيَّتَنِ		رَمِيَّتِ

## Futurum.

plural.	dual.	singul.
بِرْمُونَ	بِرْمِيَانِ	بِرْمِيٌّ
بِرْمُونَ	بِرْمِيَانِ	بِرْمِيٌّ
نَسْرِمِيٌّ		أَرْمِيٌّ

## Imperativus.

plural.	dual.	sing.
أَرْمِيَّنَ	أَرْمِيَا	أَرْمِيٌّ
أَرْمِيَّنَ	أَرْمِيَا	أَرْمِيٌّ

## Participium.

plural.	dual.	singul.
رَامِيَّةٌ	رَامِيَانِ	رَامِيَّةٌ
رَامِيَّاتٌ	رَامِيَتَانِ	رَامِيَّاتٌ

## Infinitivus.

رمیا

## De praeterito.

غزا oppugnavit est pro غزو in elif quiescens converso, iuxta canonem tertium و ; et رمی proiecit , pro رمی , abiecta vocali رمی ، quod quiescit instar elif , iuxta canonem tertium رمی : et excidit , utraque cum vocali sua in tertia persona faemin. singularis ac dualis , et masc. pluralis . Dicitur enim

غزت	pro	غزتنا	غزوتنا	غزوا	غزووا
رمی		رمتنا	رميتنا	رموا	رميوا

Cum media radicis habet damma , non mutatur و radicale , ut سرو potitus fuit : cum vero kesra possidet , convertitur ubique in رمی , pro رضو , iuxta canon. quintum و ; ut رضوت رضوت pro رضوت رضيت رضيت , iuxta can. 2. gen. At tunc etiam in tertia faem. sing. et dualis non excidit ; ut رضيت رضيتنا سروت سروت : secus in plurali masculino , ubi dicitur سروا ، رضوا ، juxta canon. 1. و et رمی .

## De futuro.

Ultima radicalis , abiecto damma suo : quiescit . Penultima , si in praet. fatha habet , id hic ( ut in concavis ) quiescentia و in damma , quiescentia رمی in kesra mutant ut بجز و بجزی ، يجز و يجزی sed et ob gutturalem manet , sicut in perfectis , ut بجزی pavit paseet ; si damma , id regulariter manet , ut يسرى noctu ibit , quod flectitur ut يجز و ، si kesra , id in fatha muta-

tur, ut *gratum habebit*: ubi et pro est ى instar *elif* quiescens, iuxta posterius membrum canonis tertii و ; ponitur enim *pro* يرضو : flectiturque hoc modo ,

يُرضي برضون	يُرضيَان ترضيَان	تُرضي ترضيَن
تُرضي ترضيَن	تُرضيَان ترضيَان	تُرضي ترضيَن
أرضي		

In plurali masculino , et singulari secundae personae faemino , iuxta canonem primum و et ى , fit contractio , quae aufert differentiam pluralis mascul. a plur. faem. cum penultima futuri habet damma , ut patet in تغزوون و يغزوون ; et singularis faem. secundae personae , a plur. faem. secundae personae , cum penultima possidet kesra vel fatha ; ut in قرميَن و قرميَن et ترسيَن .

Praepositis particulis giezmantibus , ultima radicalis non recipit giezma , sed excidit , et ن regulariter abicietur hoc modo ,

plural.	dual.	singul.	
يغزوون	يغزوا تغزوا	تغز	يغز
تغزوون	تغزوا	تغزى	تغز
تغز		أغز	لم

Et sic quoque لـم يـرم et لـم يـرم : sed interdum licet rarissime , manere ultimam reperies , dicique لـم يـغزو ، لـم يـرم ، لـم يـرم .

At cum particulae fathantes praemittuntur , ultima regulariter recipit fatha ; ut

	بِوْمِيٍّ	تَرْمِيٍّ	يُغَزُّوُ	تَغْزُوُ	
etc.	تَرْمِيٍّ	تَرْمِيٍّ	لَنْ	تَغْزُوُ	تَغْزِيُّ
	أَرْمِيٍّ	-	-	-	أَعْزُوُ

Nisi penultima habeat fatha; tunc enim obstat canon tertius ى; ut لَنْ بِرْضِيٌّ تَرْضِيٌّ etc. Sic et interdum manet quiescens post damma, sed rarissime; ut لَنْ تَغْفِفُ neutiquam condonabimus.

#### De imperativo.

Imperativus, ut in perfectis, fit a futuro giezmato, praefixo l imperativo, ut أَرْمَنْ , أَغْزَنْ : creditque cum nun paragogico tertia radicalis abiecta in singulari masc. ut أَغْزُونْ , أَغْزُونْ ، اِرْضِينْ ، اِرْمِينْ . In singul. faeminino et plur. masculino adhibetur contractio, eo prorsus modo quo in futuro.

#### De participio.

In singulari masc. و finale post kesra mutatur in ى, iuxta canonem quintum و, fitque غَازِيٌّ pro غَازِيٌّ: et quia je finale post kesra nequit habere damma, iuxta quartum canonem ى, id abiicit, eiusque nun ad praecedentem reiecto, ipsa etiam excidit, ut غَازِيٌّ pro غَازِيٌّ: sicut eo amissio redit, ut الْغَازِيُّ pro الْغَازِيُّ (nam articulum tollere nun ultimae vocalis post disces:) eadem est ratio defectivi ى, ut رَامِيٌّ pro رَامِيٌّ: et quia ى finale post kesra etiam respuit kesra, iuxta eundem canonem quartum, dicitur etiam in genitivo

غَازِيًّا . رَامِيٌّ et غَازِيٌّ pro رَامٍ et غَازِيٌّ pugnantem , In رَامِيَّةٌ et غَازِيَّةٌ redit abiectum ; quia extra finem dictionis collocatur , et in غَازُونَ fit contractio , ut in futuro .

## De infinitivo .

Infinitivus est regularis .

## De passivo .

Passivi similis est ratio : ut ,

## Praeteritum .

## Defectivum ى.

رَمِيْتُ  
رُمِيْتُ  
رُمِيْتُ  
رُمِيْتُ  
etc.

## Defectivum و.

غُزِيْتُ  
غُزِيْتُ  
غُزِيْتُ  
غُزِيْتُ  
etc.

## Futurum .

قَرْمَى  
قَرْمَى  
قَرْمَى  
أَرْمَى  
etc.

تَغْزِيٌ  
تَغْزِيٌ  
تَغْزِيٌ  
أَغْزِيٌ  
etc.

## Participium .

مَرْمِيَّةٌ  
مَرْمِيَّةٌ  
etc.

مَعْزُوَّةٌ  
مَعْزُوَّةٌ  
etc.

يُغْزِي est pro iuxta canonem quintum و. in غُزوٍ mu-tatur و in quiescens instar *elis*; iuxta tertium canonem و. يَرْمِي autem est pro ، secundum tertium canonem و. مَرْمُوٰ est pro مَغْزُوٰ per contractionem : et مَرْمُوٰ pro مَغْزُوٰ iuxta quintum canonem و. Atque huius coniugationis normam derivativa omnes sequuntur , ut ،

## Passivum .

futur.	praet.
يُغْزِي	غُزوٍ
يُغَازِي	غُزوٍ
يَغْزِي	أَغْزِي
يَنْغَزِي	تَغْزِي
يُغَنْزِي	أَغْنَزِي
يَسْتَغْزِي	أَسْتَغْزِي

## Activum .

futur.	praet.
يُغْزِي	غُزوٍ
يُغَازِي	غَازِي
يَغْزِي	أَغْزِي
يَنْغَزِي	تَغْزِي
يُغَنْزِي	أَغْنَزِي
يَسْتَغْزِي	أَسْتَغْزِي

## Passivum .

futur.	praet.
يَرْمِي	رَمِيٍ
بِرَامِي	رَوْمِي
يَرْمِي	أَرْمِي
يَنْتَرْمِي	تَرْمِي
بِرْتَمِي	أَرْتَمِي
يَسْتَرْمِي	أَسْتَرْمِي

## Activum .

futur.	praet.
يُرْمِي	رَمِيٍ
بِرَامِي	رَوْمِي
يُرْمِي	أَرْمِي
يَنْتَرْمِي	تَرْمِي
بِرْتَمِي	أَرْتَمِي
يَسْتَرْمِي	أَسْتَرْمِي

Et sic in caeteris coniugationibus et temporibus primae coniugationis regulae observantur : solumque notandum est , ـ illud quod in praeteritis defectivi و ponitur loco و , iuxta posterius membrum canonis tertii و , in primis et secundis personis manere , et diptongescere cum fatha , dicique , أَغْزِيْتُ و أَغْزِيْتَ و etc. secus atque in prima coniugatione , ubi redit و .

## C A P U T D E C I M U M.

De verbo dupliciter imperfecto .

**V**erba dupliciter imperfecta , simpliciter imperfecta per omnia sequuntur . Classes autem eorum duae sunt ; quarum prima continet ea quae hamzata sunt et simul quiescentia : quorum quatuor sunt species .

1. Hamzatum *fe* et quiescens *ain* : ut أَبْ <sup>ـ</sup> *reversus est* ;  
quod coniugatur sicuti أَنْ و قَالَ <sup>ـ</sup> et : ut

infin.	part.	imp.	fut.	praet.
أَوْبَا	أَيْبَ	أَبْ	بُووبْ	أَبْ

2. Hamzatum *lam* et quiescens *ain* : ut سَاءٌ <sup>ـ</sup> *contristavit* ,  
ـ <sup>ـ</sup> *venit* , quorum illud coniugatur ut قَالَ <sup>ـ</sup> et هَنَا <sup>ـ</sup> ; hoc ut  
ـ <sup>ـ</sup> هَنَا <sup>ـ</sup> et سَارَ <sup>ـ</sup> : exempli gratia ,

infin.	part.	imp.	fut.	praet.
سَوَا	سَائِ	سُو	بِسْوَ	سَاءٌ
مَحْيَا	جَائِ	جَى	يَبْخَىٰ	جَاءٌ

3. Hamzatum *fe* et quiescens *lam* : ut أَتَى <sup>ـ</sup> *venit* ; quod  
coniugatur sicut أَنْ و رَمَى <sup>ـ</sup> et رَمَى <sup>ـ</sup> , ut

infin.	part.	imp.	fut.	praet.
--------	-------	------	------	--------

أَتِيَّا	أَتِيَّ	أَتِيَّ	أَتِيَّ	أَتِيَّ
----------	---------	---------	---------	---------

Dicitur tamen et <sup>ه</sup> in imperativi sing. masculino .

4. Hamzatum *ain* et quiescens *lam* : ut نَائِي recessit ; quod coniugatur sicut شَالُ et رَمَى , ut

part.	imp.	fut.	praet.
-------	------	------	--------

نَائِ	نَائِ	نَائِي	نَائِي
-------	-------	--------	--------

Fatha penultimae manet in futuro et imperativo , quia *elif* est littera gutturalis . Et sic quoque regulariter coniugaretur رَأَيَ *vidit* : sed ob frequentem usum hamza abiicit , vocali eius ad praecedentem reiecta quoties ر *giezma* habet ; ideoque in futuro et imperativo primae coniugationis sic habet :

#### Futurum .

plural.	dual.	singul.
---------	-------	---------

بِرِينْ	بِرِيَانْ	بِرِي
تِرِينْ	تِرِيَانْ	تِرِي
نِرِينْ	نِرِيَانْ	نِرِي
فِرِي		أَرِي

pro رَأَيَ , etc. ; sicuti et apud poetas interdum , versu id exigente , occurrit .

#### Imperativus .

plural.	dual.	singul.
---------	-------	---------

رُوا	رِيَا	رِيَ
------	-------	------

vel cum *nun* paragogico ,

رُونْ	رِيَانْ	رِيَنْ
-------	---------	--------

Invenitur tamen etiam non raro regulariter formatus , ut  
أَرَى أَرَى , etc.

Et in tota coniugatione quarta أَفْعُل , ut

Praeteritum .

أَرَى أَرَتِ أَرَيْتِ أَرَيْتِ

Futurum .

بُرِيٌّ تُرِيٌّ تُرِيٌّ تُرِيٌّ أَرِيٌّ  
etc.

Imperativus .

plural. dual. singul.

أَرِيٌّ أَرِيٌّ أَرِيٌّ أَرِيٌّ أَرِيٌّ

et cum *nun.* paragogico ,

أَرِيَنَّ أَرِيَنَّ أَرِيَنَّ أَرِيَنَّ

Participium .

مُرِيَةٌ مُرِيَةٌ مُرِيَةٌ مُرِيَةٌ

Infinitivus .

أَرِيَةٌ أَرِيَةٌ vel أَرِيَةٌ

Quin reliqua etiam verba omnia huius ordinis in coniugatione hac quarta hamza etiam posse abiicere doctissimi tradunt grammatici ; ac proinde dici non solum مُنَا ,

انَّى يُنَى مُنٍّ .

Gum و giezma non habet , regulariter coniugatur رَأَيْ , nec amittit hamza ; ut

## Praeteritum.

رَأَيْتُ رَأَيْتَ رَأَيْتَ رَأَيْتَ

## Participium.

رَأِيْتَ رَأِيْتَ رَأِيْتَ رَأِيْتَ &c.

## Infinitivus.

رَأِيْا

Et sic quoque in participio passivi est مَرْمَى ut مَرْمَى ; licet , habeat giezma .

Secunda verborum dupliciter imperfectorum classis continet dupliciter quiescentia , quae ab arabibus vocantur involuta ; suntque duum generum , separata et coniuncta . Involutum separatum est quod quiescit prima et ultima , ut وَقْيَ custodivit , وَجْيَ ungulam attritam habuit ( equus scilicet ) quorum illud flectitur , ut وَعْدَ وَرْمَى , hoc vero ut وَجْلَ وَرْضَى ; exempli gratia ,

part.	imp.	fut.	praet.	part.	imp.	fut.	praet.	
وَقْيَ	بِقْيَ	قِ	وَقْهَ	وَاقِ	وَجْيَ	يُوْجَى	إِيجَ	وَاجِ

Imperativus قِ in reliquis personis resumit ى , adhibita tamen contractione in sing. et plur. masc. ut

plural.	dual.	sing.
---------	-------	-------

قِ	فِي	قِيَا	قُوا	قِيَنِ
----	-----	-------	------	--------

Sic cum قِ paragogico in singul. masc. قِيَنِ dicitur .

Involutum coniunctum , quod quiescit media et ultima , ut شُوْرَى assavit , قُويَّ valuit , حَبِيَّ vixit : quae perfecte con-

ingantur quoad medium, at imperfecte quoad ultimam; شُوْي  
quidem sicut قُوَى, وَمِى vero et حَيَى sicut رَضِى; ut

infin.	part.	imp.	fut.	praet.
شَيْئاً	شَارٍ	أَشَوْ	يَشُوْي	شُوْي
قُوَّةً	قَارٍ	أَفَوْ	يَقُوْي	قُوْي
حَيَاةً	حَالٍ	أَحَى	يَحِيَا	حَيَى

Infinitivus شَيْئاً est pro شَوْي secundum canonem tertium و et قُوَّةً pro قُوْي iuxta canonem de secunda syllabae mixtae littera; est autem قُوَّى pro قُوى ultimo iuxta canonem quintum و ob kesra praecedens in ى converso; unde desinit ultimam penultimae similem habere, et surdum esse. Sicuti contra, حَيِى convertens و finale in ى iuxta eundem canonem, accipit ultimam penultimae similem, unde et more surdi contractionem non raro patitur: dicitur enim in praeterito حَيِى et حَى; quanquam nonnulli kesra penultimo ad primam reiecto malunt حَى dicere: et in futuro يَحِيَا (ubi ى instar *elif* quiescens, in quod و conversum erat iuxta canonem tertium و, in ى quiescens mutatur ob ى praecedens, iuxta canonem tertium ى) et يَحِى. Pro participio حَالٍ usitatus est adiectivum حَى vivus. In infinitivo و radicale sua vocali abiecta quiescit instar *elif*: quod particulare est, et de eo can. secun. و et ى vide.

Sic in reliquis quoque coniugationibus haec verba analogiam quiescentium ultima sequuntur. Sed in decima coniungat. ى prius interdum abiicit, vocali eius ad praecedentem reiecta: dicitur enim,

استَّهْجِيَّةَ  
بِسْتَهْجِيَّةَ  
مُسْتَهْجِيَّةَ  
استَّهْجِيَّةَ  
& بِسْتَهْجِيَّةَ  
مُسْتَهْجِيَّةَ

Verba tripliciter imperfecta paucissima reperiuntur : suntque hamzata *fe* et involuta coniuncta : ut أُوْيِ recepit ; vel hamzata *ain* et involuta separata , ut وَأَيِ stetit promissis : quorum illud coniugatur ut اثْرِ et شَوِيْ وَقَى et سَلِل : ut

infin.	part.	imp.	fut.	praet.
أَيَا	أَوِ	أَيُو	يَأْوِي	أُوْيِ
وَأَيَا	وَأَهِ	أَكَاهِ	يَأِي	وَأَيِ

Verba tribus radicalibus aut primis duabus quiescentia nulla dantur . Itaque haec de imperfectis , et de verbis in universum sufficient .

Finis libri secundi .

THOMAE ERPENII

## GRAMMATICAE ARABICAE

LIBER TERTIUS

## DE NOMINE.

In nomine consideranda sunt qualitas , species , forma ,  
 genus , motio , numerus , casus , declinatio ,  
 et comparatio .

## CAPUT PRIMUM.

## De qualitate .

**Q**ualitate nomen aliud est substantivum , idque proprium , ut مُحَمَّدٌ Muhammad , مَكَّةٌ Mecca , جَيْهَكُون Oxus fluv. aut appellativum ; ut نَبِيٌّ propheta , مَدِينَةٌ civitas , نَهْرٌ fluvius : vel adiectivum , ut صَغِيرٌ parvus , أَبْيَضٌ albus . Quorum proprium natura sua restrictum et determinatum est : appellativum vero et adiectiva late patentia et vaga ; sed restringuntur praefixo articulo الْ أَلْ أَنْبِيَةُ الْ مَدِينَةُ الْ نَهْرُ الْ صَغِيرُ الْ أَبْيَضُ . Cuius articuli litteram J ante solarem inter pronunciandum perire , solari in compensationem eius duplicata , dictum est cap. 4. libri primi : autem eius unionis esse , vocalemque suam fatha in fluxu sententiae abiicere , et consonam sequentem cum praecedentis dictionis aut litterae servilis vocali unire , constat ex eiusdem libri capite quinto .

Appellativum autem restringitur quoque constructione , seu

regimine genitivi ; separati quidem , ut in عبد الله servus Dei ; conjuncti vero , ut عبد servus eius , unde articulum tunc non admittit : sicut nec unquam proprium , quippe natura sua determinatum . Multa tamen virorum nomina ex appellativis facta possident articulum , sed ut essentialem , non ut accessoriū ; ex. gr. الْخَلِيلُ , الْقَالِمُ : quae tamen et brevitatis causa interdum eum amittunt . Sic et particularum quadruplicem compositionem articulus post dicetur ingredi .

## CAPUT SECUNDUM.

## De specie .

**S**pecies duplex est , primitiva et derivativa : nomen primitivum est quod non derivatur aliunde ; ut رأس caput , لحم caro : derivativum vero quod ab alio derivatur ; estque verbale vel nominale . Verbale est quod derivatur a verbo : qualia fere sunt adiectiva , ut عظيم magnus , ab عظم magnus fuit , صغير parvus , a صغر parvus fuit ; أصغر flavus , a صغر flavus fuit ; طيب bonus , a طاب bonus fuit ; ناشر adiuvans , a نصر adiuvit , atque sic reliqua participia adiective accepta : et substantiva significantia actorem , locum vel tempus actionis , instrumentum actionis , aut denique actionem ipsam .

## Nomen actoris .

Actorem significant participia activa , substantive accepta : ut مالك adiutor , rex , dominator , قاعد sessore , etc.

## Nomen loci et temporis .

Locus et tempus actionis eadem nominis voce significantur : ut مكتبه locus et tempus scriptionis , مجلس locus et

*tempus sessionis* : siuntque in prima trilitteri coniugatione a futuro activo , م pro اتىين posito , et vocali penultima manente , cum est fatha , ut مشغل locus et tempus laboris , a يشغل ; vel kesra , ut مضرب locus et tempus verberationis , a يضرب : at in fatha converso , cum est damma , ut مدخل locus et tempus introitus , a يدخل locus et tempus stationis , a يقوم . Duodecim tamen haec nomina damma in kesra mutant ,

مشرق	<i>locus ortus oriens</i>	منخر	<i>locus spirationis</i> , id est , <i>nares</i> .
مغرب	<i>locus occasus, occidens.</i>	منسك	<i>locus sacrificandi</i> .
مرفق	<i>locus innitendi cubitui.</i>	مطلع	<i>locus ascensus</i> .
منبت	<i>locus cretionis herbarum.</i>	مفرق	<i>locus separationis cancellorum</i> .
مسقط	<i>locus casus.</i>	مسكن	<i>locus habitationis</i> .
مجزر	<i>locus iugulaudi camelum.</i>	مسجد	<i>locus adorationis</i> .

quorum postrema quinque etiam regulariter cum fatha scribuntur : quod et , ex sententia quorundam , primis etiam sex accidere potest . Septimum quoque interdum irregulariter kesra sub و habet , et منخر effertur .

Si autem verbum est simile و , penultima perpetuo kesra habet , et si abiectum est redit : ut موضع locus et tempus positionis , a يوضع ; موعده locus , et tempus promissionis , a موجودة locus et tempus eundi , a يوجد , si vero est defetivum , penultima perpetuo habet fatha : ut مرمى ( pro مرمى secundum can. tertium ) locus et tempus projectionis , a

locus et tempus vocationis , a مَدْعَى / يَدْعُو : بِرْهَى مرضى ; يَدْعُو locus et tempus complacentiae , a يَأْوِي / يَرْضَى : a tam en reperitur مَأْوَى , et cum kesra مَأْوَى pro ماُ ( iuxta canonem quintum ) locus et tempus mansionis .

Assumitur interdum in locorum nominibus ۚ in fine ut مقبرة / مَقْبَرَة locus sepelitionis , coemiterium , a يَقْبَرُ مشرفة / مَشْرَفَة locus ortus , oriens , a يَشْرِقُ , ac tum penultima radicalis subinde damma habet ; ut مقبرة / مَقْبَرَة , يَظْنُنَّ a يَظْنُنَّ autem , existimat , fit مَطْنَةً cum kesra , locus existimationis .

In verbis autem quadrilitteris et coniugationibus omnibus derivativis , formatur nomen loci et temporis a futur. passivo , posito ۖ pro اتىين ; ita ut omnino conveniat cum participio passivo : ut مُسْكَنٌ locus et tempus contristationis , a مُقْامٌ locus et tempus constitutionis , a يُقْامُ : sic منقطع / مَنْقُطَعْ مُدْحَرِجٌ locus et tempus abscissionis , locus et tempus volutationis , مُخْرَجٌ locus et tempus tumultuationis .

#### Nomen instrumenti .

Nomen instrumenti fit praeposito ۖ cum kesra ; estque forma مُنْصَارٌ vel منصرة / مُنْصَرَةٌ aut منصر / مُنْصَرَ ، quo quid aperitur , clavis , a فَتْحٌ aperuit ; مَخْلُبٌ mulcitra , ab حَلْبٍ mulsit ; verriculum , a كَسْحَنَ verrit . Sed منخل / مَنْخَلَ cribrum , a نَخْلَ cribravit , habet damma super ۖ et media radicali ; ut et مَدْقَقٌ ( contracte pro مَدْقَقَنْ ) instrumentum quo contunduntur vestes , a دق / دَقَّ contudit . Dicitur tamen etiam regulariter

et مَدْقَنٌ مَدْقَنٌ . His adiungunt etiam مدْقَنٌ *vasculum in quo asservatur unguentum*, مَسْعِطٌ *vasculum in quo asservatur medicina caput purgans*, مَكْحُلٌ *vasculum in quo asservatur stibium*, et nonnulli etiam مَحْرَضٌ (pro quo tamen doctissimi grammatici مَحْرَضٌ scribunt) *clavae theca*. Sed haec mihi non videntur actionum significare instrumenta: nulla certe ratione hoc postremum, quod ne verbale quidem est.

## Nomen actionis.

Actionem ipsam significat infinitivus, reliquorum nominum more casibus variabilis: ut ضَرْبٌ *verberatio*, احْزَانٌ *contristatio*, تَصْارَعٌ *collectatio*, اسْتَخْرَاجٌ *eductio*, etc. quin propri nihil aliud est infinitivus quam nomen verbale adverbiascens, quod elegantiae, et significationis intendendae causa verbo apponitur.

## Nomen vicis.

Ab infinitivo autem non terminato ی formatur etiam nomen ی terminatum significans actionem unam et solitariam, ac repudiens proinde adiectivum وَاحِدَةً *una*; vocaturque ab Arabibus nomen vicis. Et est a trilitteris primae coniug. perpetuo formae ضَرْبَةٌ *una sola verberatio*, قَعْدَةٌ *una sola sessio*, قَوْمَةٌ *una sola statio*; quorum infinitivi sunt ضَرْبًا, قَوْمًا, قُعُودًا: a quadrilitteris vero et coniugationibus derivatis, eiusdem formae cum infinitivo apposito solum ی, ut دَحْرَاجَةٌ *una sola volutatio*, احْزَانَةٌ *una sola contristatio*; اسْتَخْرَاجَةٌ *una sola eductio*, ab infinitivis دَحْرَاجَا, احْزَانَا, دَحْرَاجَا, et اسْتَخْرَاجَا.

sic quoque a duobus hisce infinitivis primae coniugationis trilitterae اتیانًا لقائے اتیانے *unus solus accessus*, et لقائے ضربة *unus solus occursus*; non أتیة لقیة. Ex. gr. ضربة *verberavi cum verberatione una*, seu *verberando semel*, vel ضربة *semel eum verberavi*: قعده *sedi sessione una*, *semel sedi*: at قعده ضربة *est verberavi eum verberando*, قعده *sedi sedendo*, indeterminate. Cum autem infinitivus terminatur ة، non formatur ab eo nomen vicis; sed ut unitas actionis significetur, adiicitur ei adiectivum واحده، ut رحمة *una sola miserescentia*, واحده *una sola constitutio*.

Simili prorsus modo formatur nomen specificationis, ut aiunt Arabes, id est, quo specificatur seu determinatur actio generalis; (ut cum dicimus, hic excellit scriptio, seu in scriptura, vel cum scribit, ubi excellere determinatur et specificatur vocabulo actionis, scriptio scilicet) fit enim additione litterae ة ad infinitivum destitutum ة, nec in quadrilateris et coniugationibus derivativis differt a nomine vicis; ut هو حسن استخراجة *ipse bonus est eductione*, seu *ineductione*: sed in trilitteris primae coniugationis prima radicalis perpetuo habet kesra, et est formae نصرة، ut هو حسن ضربة *ipse bonus est verberatione*; هو حسن قعده *ipse bonus est sessione*, seu *in sessione*. Apud poetas tamen hanc formam interdum cum praecedente نصرة confundi videoas, ut منصر *formam instrumenti cum منصر forma loci et temporis*.

Derativum nominale est quod derivatur ab alio nomine: estque possessivum, diminutivum, augmentativum, et locale-

## Possessivum .

Possessivum est nomen adiectivum significans possessio-  
nem , et formatur a quovis substantivo adiectione ى ; ut انسانٌ انسانٌ ى ; ut homo ، انسانٌ ى humanus ; ارضٌ ارضٌ ى terra ، ارضٌ ارضٌ ى terrenus : sed ٍ  
terminata id abiiciunt , ut مائدةٌ مائدةٌ ى mensa ، مائدةٌ مائدةٌ ى mensalis :  
ى حبلىٌ حبلىٌ ى gravida mulier ، حبلىٌ حبلىٌ ى ad gravidam pertinens ;  
tamen interdum in و mutatur , ut dicatur حبلويٌ حبلويٌ . A propriis  
regionum nominibus formata saepe fiunt substantiva , et gen-  
tilia vocantur ; ut الشام Syria ، الشامي Syriacus , et Syrus ;  
افريقية مصرى ى Aegyptus ، مصرى مصرى ى Aegyptiacus et Aegyptius :  
افريقيا افريقيا ى Africa ، افريقيا افريقيا ى Africanus et Afer ; ubi et ى cum ى perit ,  
quod in terminatis per ية , perpetuum est .

## Diminutivum .

Diminutivum significat diminutionem sui primitivi ; estque  
in trilitteris formae نصير قميطر قميطر قميطر : ut عبيد عبيد عبيد ى  
servulus , ab servus ; قمر lunula , a luna : ضریب ضریب ضریب ى  
lente et perfunctorie verberans , a ضارب verberans ; جعیفر جعیفر جعیفر ى  
vulus ; a عصیفیر rivus , عصیفیر passerculus , ab عصغور passer

## Augmentativum .

Augmentativum intendit significationem sui primitivi ; est-  
que participiale ut plurimum , formae que variae , scilicet منصار نصار نصار نصار  
، نصار نصار نصار نصار ، et نصار نصار نصار نصار ; quae si immediate a verbis de-  
rivari dicantur , verbalia erunt actorem significantia : ut ضرائب ضرائب ضرائب ضرائب

صَرْبٌ bene et diligenter seu vehementer verberans , vel vehemens verborator . De نَصِيرٍ vide ad particip. passivum primae coniug. ubi videbis id interdum passivum esse ; quod et نَصُورٌ interdum accidit , sed in faeminino tantum .

## Locale .

Locale denotat locum sui primitivi : estque collectivum vel singulare . Collectivum significat locum in quo res copiosae sunt et abundanter , estque formae مَنْصُرَةٌ ; ut مَسَدَّلٌ locus leonibus refertus , ab اَسَدٌ leo ; مَبْطَحَةٌ locus melonibus refertus , a طَيْخٌ melo . Nec formari potest a nominibus quatuor litteras radicibus habentibus , ut sunt ضَفْدَعٌ rana , تَعْكِبٌ vulpes . Singulare significat locum seu instrumentum in quo quid reponitur , aut asservatur vel asservari solet ; estque eiusdem formae cum verbali significantia instrumentum actionis , id est مَنْصَارٌ vel مَنْصُرٌ : ut مَقْلِمٌ calamarium , a قَلْمَنْ calamus ; مَبْوَالٌ et مَبْوَلٌ urinarium , a بَوْلٌ urina ; مَشْعَةٌ vasculum in quo ponitur cera , a شَمْعٌ cera ; et مَبْيَرٌ et مَبْيَرَةٌ theca in qua asservantur acus , ab اَبْرَةٌ acus . Huc enim referenda sunt haec et similia , non ad verbalia significantia instrumentum actionis , ut supra monui : ubi quatuor attuli per duplex damma scripta , huc quoque transferenda .

## CAPUT TERTIUM.

## De forma nominum .

**F**orma nominum duplex est , nuda et aucta . Nuda est quae solis radicalibus litteris constat , ut عبدٌ servus , رَجُلٌ vir ,

خُرْبَقْ ڪِتابْ *liber*, بُطْوَلْ *inanitas*, otiūm; عَظِيمْ *magnus*; خَرْنَقْ *helleborus*, صَرَافْ *aranea*, خَرْنَقْ *nummularius*: ancta, quae praeter radicales habet unam aut plures ex litteris servilibus يَتَسْمَى, quae formationi nominum inserviunt.

سَمَاوِيٌّ ىَ قَدِيمٍ in fine; ut فَرْسَى *Persa* et Persicus, سَمَاوِيٌّ *caelestis*; ذَكْرِي recordatio: vel in medio; ut حَبْجِير *lapillus*: aut in principio; ut يَنْبُوُعْ *fons*.

تَ تَكْبِرْ in principio; ut تَطْوِيلْ *prolongatio*, تَكْبِرْ *superbia*: vel in medio; ut in octava coniugatione, اعْتَرَافْ *confessio*: aut in fine, sed per ٰ scriptum; ut رَحْمَة *misericordia*. هَنْدْ solum hic non servit, sed cum aliis duabus, sicut in decima coniugatione; ut اسْتَغْفَارْ *petitio veniae*, مَسْتَخْرَجْ *eductor*.

مَ مَوْضِعْ *fustis*, مَيْقَالْ *pondus*, مَيْضَرَبْ *locus*, مَمْلَكَة *regnum*: raro in fine; ut ابْنَمْ *filius*, دَرْدَمْ *camela edentula*.

انْقِطَاعْ نَفْرَانْ in principio: sicuti in septima coniugatione; ut abstinencia, finis: et in fine; ut غُفرَانْ *remissio*.

الْزَّمْ لَمْ in principio; ut اسْوَدْ *niger*, اغْفَالْ *negligentia*, لَمْ breves habens digitos: et in fine; quo casu elif aliud, sed quiescens, ante se habet, ut كَبْرِيَاء *superbia*, عَلَشُورَاء *dies decimus mensis ramadan*.

De genere nominum.

**G**enus duplex est, masculinum et faemininum. Faemina sunt ex significatione,

1. Nomina mulierum, et quae mulieribus tantum convenient; ut هند Hinda, مريم Maria; أم mater, عروبة mulier amans maritum suum.

2. Nomina regionum et urbium; ut مصر Aegyptus, قبرص Cyprus; مكة Mecca, عدن Aden.

3. Nomina geminorum membrorum; ut يد manus, كتف humerus, عين oculus.

Ex terminatione vero,

1. Terminata ة; ut قصعة scutella, خاللة amicitia, حننة hortus, ظلمة tenebrae, صغيرة parva, طيبة bona.

2. Terminata ل servili; ut مشيخة multitudo senum, senes, كبرية superbia, حمراء rubra.

3. Terminata ي servili quiescente instar elif; ut ذكري recordatio, أولي prior, prima, طولى longissima.

His addenda ارض terra, بير puteus, نار ignis, خمر vinum, ارمني puteus, ريح ventus, نفس anima, شمس sol; et alia quaedam usu discenda.

Reliqua masculina sunt; ut محمد Mahommad, رجل vir, أبو pater, طيب parvus, صغير domus, نهر fluvius, بيت bonus, et sic in paucissima in ة terminata; ut خليفة summus imperator, عالم vir valde doctus.

Sed utrumque genus habent, et dubia sunt litterarum nomina : ut <sup>أَلْفٌ بَاءٌ</sup>, etc. quae saepius tamen faeminina sunt : communia vero, adiectiva quaedam sunt in sequentibus indicanda.

### C A P U T Q U I N T U M .

De motione nominum.

**M**otio est nominis masculini in faemininum conversio : fitq; additione terminationis faemininae ; ut <sup>عَمَّا</sup> *patruus*, <sup>عَمَّة</sup> *amita*; <sup>كَرِيمٌ</sup> *honorandus*, *liberalis*, <sup>كَرِيمَةٌ</sup> *honoranda*, *liberalis*.

Accidit autem motio substantiis quibusdam masculinis res potissimum sexum habentes significantibus ; ut <sup>رَجُلٌ</sup> *vir*, <sup>رَجُلَةٌ</sup> *mulier*; <sup>مَالِكٌ</sup> *puellus*, <sup>فَتَنَةٌ</sup> *puella*; <sup>مَالِكَةٌ</sup> *Rex*, <sup>رَجِيلٌ</sup> *Regina*; <sup>جَدٌ</sup> *avus*, <sup>جَدَةٌ</sup> *avia* etc. et adiectivis, ut <sup>كَبِيرٌ</sup> *magnus*, <sup>ضَارِبٌ</sup> *magna*, <sup>فَرِحَةٌ</sup> *laetus*, <sup>فَرِحَةٌ</sup> *laeta*; <sup>كَبِيرَةٌ</sup> *verberans* masc. <sup>ضَارِبةٌ</sup> *verberans* faem. Assumiturque ut plurimum prima terminatio faeminina ፩, absque ulteriori mutatione ; ut apparet in exemplis allatis. Excipiuntur adiectiva formae <sup>فَعَلَةٌ</sup>; quae cum sunt positiva, secundam assumere solent terminacionem, nempe *elif* servile, et faemininum habere : ut <sup>هَذِبَةٌ</sup> *flavus*, <sup>صَفَرَةٌ</sup> *flava*; <sup>أَهْدَبَةٌ</sup> *longa habens cilia*, <sup>أَصْفَرَةٌ</sup> faem. cum vero comparativa sunt aut superlativa, tertiam adsciscunt terminacionem, ى scilicet servile quiescens post fatha, habentq. faemininum ut <sup>فَعَلَىٰ</sup>: sic <sup>أَطْوَلُ</sup> *longior* vel *lon-*

gissimus, طولی longior f. vel longissima; أکبر maior vel maximus, کبیری maior f. vel maxima.

Hanc quoque terminationem tertiam assumunt adiectiva non pauca formae نصیر ebrius, سکری ebria, quo pertinent اول primus, اولی prima, et sic آخر aliis, habet آخری.

Eandem terminationem adsciscunt, sed forma نصری, adiectiva quaedam formae نصران iratus, غضبی غضبان ut احده unus habet احدهی cum kesra.

Quinque tamen adiectivorum formae communis fere sunt generis, et sub eadem terminatione nunc masculine nunc faemina usurpantur: suntque نصیر active sumpta, ut صبور hic et haec patiens. 2. منصار معطار، ut hic et haec condiens aromatibus. 3. منصیر مسکین hic et haec pauper. 4. منصر مغشم temerarius, temeraria. 5. نصیر passive sumpta, ut قتيل hic occisus, et haec occisa. Invenies tamen etiam has formas in faeminino interdum assumere ۸، ut علو inimicus، عدوة inimica; مسکین pauper masc. منكينة faem. et sic perpetuo ultima, cum substantiae usurpatur: ut قتيلة ea quae occisa est.

Neutrum genus Arabes non agnoscunt: unde adiectiva neutra substantiae usurpata exprimunt per faeminina, ut واحد تعاونك unum deest tibi.

Caeterum observatu quoque dignum est, a nominibus substantiis masculinis significantibus res habentes partes homogeneas, formari saepe faeminina primae terminationis significantia partem aliquam illarum: ut تبن stramen, تبة par-

*ticula straminis*; ذهبٌ *aurum*, ذهبٌ *particula auri*, mas-  
sa *aurea*.

## C A P U T S E X T U M.

De numero.

**N**umeri nominum tres sunt: singularis, ut شَارِقٌ *fur*, شَارِقٌ *vir*; dualis, ut شَارِقَانِ *duo fures*, رَجُلَانِ *duo viri*; et pluralis, ut شَارِقُونِ *complures fures*, رَجَالٌ *complures viri*.

Formatur autem dualis a singulari, adiecto أَنْ absque ultima mutatione, ut patet in exemplis allatis, & tamen faemimum in ةَ mutatur, ut مَدِينَتَانِ *civitas*, مَدِينَتَانِ *duae civitates*, كَبِيرَاتِانِ *magna*, وَ اَنْ autem finales in singulari post fatha quiescentes, iuxta canonem suum tertium, hic fiunt mobiles: ut فَتَّيَانِ *puer*, duo *pueri*; ذَكَرِيَانِ *commemoratio*, ذَكَرِيَانِ *duac commemorationes*; هَصَوَانِ *nominatus*, عَصَانِ *fustes*, مَسْمِيَانِ *duo nominati*; صَفَرَاوَانِ *flavae*, at radicale ل manet, ut جَزِّا *pars*, جَزَانِ *duae partes*: nisi ponatur pro و vel ئى; iuxta ultimum canonem و et ئى; tunc enim libere manet, vel mutatur in و, ut دَائِيَانِ *vestis*, دَائِيَانِ *duae vestes*.

Pluralis fit a singulari dupliciter, perfecte scilicet aut imperfecte: unde plurale aliud est perfectum, quod sanum vocant Arabes, aliud imperfectum, quod fractum appellant. Sanum formant potissimum nomina propria rationalium, et adiectiva formantia faemimum adiecto ةَ, cum de rationalibus

praedicantur : masculina quidem adiecto وُنْ , ut مُحَمَّدٌ *Mohammad* ; مُهَمَّدٌ *Mohamedes* ; نَاصِرٌ *adjuvans* , مُهَمَّدُونَ *adiuvantes* نَبِيُّونَ *laetus* فَرِحُونَ *propheta* نَبِيٌّ *prophetae* فِرْجٌ ; مَرِيمٌ *Maria* مَرِيمَاتٌ *faeminina* vero adiecto أُتْ , ut مَرِيمٌ *Maria* مَارِيَاتٌ *Mariae* فَرِحةٌ *adjuvantes* نَاصِرَاتٌ *laeta* فَرِحَاتٌ *laetae* نَبِيَّةٌ *prophetissa* نَبِيَّاتٌ *prophetissae* .

Nulla quoque adhibita singularis mutatione , nisi quod ۖ faeminina excidit ; ut manifestum est in exemplis allatis . Sed masculina terminata ۚ quiescente post kesra id una cum kesra abiiciunt : ut أَلْقَاضِيُّونَ *iudex* , non أَلْقَاضِيُّ *iudices* , مُوْسَى *Moses* , in plur. habet مُوسَوْنَ , iuxta can. primum و et ۚ , at finita ۚ quiescente post fatha , solum ۚ amittunt , manente in eius indicium fatha , cum quo و plurale diptongescit : ut مُصْطَفَى *Mustapha* , مُصْطَفَيُونَ *Mustapha* , non مُصْطَفَيُونَ *Mustapha* , iuxta eundem canonem . Substantiva autem faeminina perfecta ( id est , non derivata a verbis imperfectis ) nuda , vel sola ۖ aucta ; quorum media radicalis habet giezma , illud in plurali mutant in vocalem talem , qualem possidet prima radicalis : ut دَعْدَةٌ *Daado* , nomen mulieris , جُمْرَةٌ *Gjumra* , nomen mulieris quoque , جُمْرَاتٌ *Hinda* , nomen mulieris , سَدْرَةٌ *scutella* , قَصْعَةٌ *lotus arbor* , جُلْبَةٌ *ventus* , جُلْبَاتٌ *ventus* , ea tamen quorum prima habet damma vel kesra , giezma etiam retinere possunt , vel in fatha mutare : ut , جُمْرَاتٌ *Gjumra* , جُمْرَانٌ , جُمْرَاتٌ *Gjumra* .

هند هندات هندات *Hinda*, هندات هندات هندات.

جُلْبَات جُلْبَات جُلْبَات *ventus*, جُلْبَات جُلْبَات جُلْبَات.

سُدَرَات سُدَرَات سُدَرَات سُدَرَات *lot. arb.* سُدَرَات سُدَرَات سُدَرَات.

Plurale fractum est quod formatur imperfecte, seu non adiectis وُنْ اتْ et fit a plerisque singularibus tam rationalibus, quam irrationalibus. Formae autem eius praecipuae: a nudis trilitteris et faemininis eorum potissimum ortae, sunt viginti duo: videlicet,

١ نُصْرٌ	٧ نُصْرٌ	١٣ نَصَارَاءُ	١٩ نَصَارَاءُ
٢ نُصْرٌ	٨ نَصْرَةٌ	١٤ نَصَرَاءُ	٢٠ نَصَرَاءُ
٣ نُصْرٌ	٩ نَصْرَةٌ	١٥ نَوَاصِرٌ	٢١ نَصْرَى
٤ نُصْرٌ	١٠ نَصَارِيٌّ	١٦ نَصَارِيٌّ	٢٢ نَصَارِيٌّ
٥ نَصَارٌ	١١ نَصْرَانٌ	١٧ نَصْرَانٌ	
٦ نَصَرٌ	١٢ نَصَارٌ	١٨ نَصْرَانٌ	

Quarum rationem analytice, evidentioris doctrinae ergo, visum est proponere, in hunc modum.

### Prima نُصْرٌ

fit a singularibus نَصْرٌ غُرفةٌ *coenaculum*, نَصْرٌ غُرفةٌ *coenacula*; ut نَصْرٌ كبرىٌ *maxima*, نَصْرٌ كبرىٌ *maximae*, raro a نَصْرٌ نَصْرَةٌ et نَصْرَةٌ *pagus*; ut قُرْيٌ *pagi*; لحْيَةٌ *barba*, نَصْرَةٌ *maxilla*, نَصْرَةٌ *barbae*, نَصْرَةٌ *maxillae*.

### Secunda نُصْرٌ

fit a substantivis quatuor litterarum, quarum ultima non est و vel ى, penultima autem quiescens: ut چدار *paries*, چدار *paries*, چدار *paries*.

*parietes*; *columna*, عمودٌ; *columnae*; قصبةٌ *virga*, قصبةٌ; *os superciliu*, حجاجٌ *obsequens iumentum*, ذللٌ; ذللٌ *lectica*, سريرٌ *sorri*, *solium*, سريرٌ *sed duplantia secundam interposito* | *quiescente*, ut حجاجٌ, *saepius decimam quartam formam obtinent*.

### نصر تertia

fit ab adiectivis masculinis formae أنصر، et faemininis eorum نصراء: *ut ruber*, أحمرٌ *rubra*, حمراءٌ *rubri*, حمرٌ *rubrae*.

### نصر Quarta

fit a singulari قرينةٌ *uter*, ut قربٌ *utris*, قربٌ *annus*, حيجنةٌ *moneta*, مكّةٌ; حجاجٌ *hasta*, رحالٌ.

### نصر Quinta

fit 1. *a* قديحٌ *telum absque cuspide*, قديحٌ *ut نصر* et قديحٌ *ut نصر نصر*: قديحٌ *vir*, رحالٌ; قديحٌ *hasta*, رحالٌ.

2. *a* قصعةٌ *calcaneus*, كعبٌ *ut نصر* et قصعةٌ *ut نصر نصر*: ثيابٌ *vestis*, ثوبٌ: صعابٌ *difficilis*, صعبٌ; قصاعٌ *scutella*, قصاعٌ *mutato* و *post kesra in فيف* *ى* *desertum*, فيفٌ *ى* فيفٌ .

3. *a substantivis* نصر et نصرة non habentibus tertiam radicalem secundae similem, aut و vel *ى*: *ut جبل* *mons*, جبالٌ *montes*; *ut رقاب* *collum*, رقابٌ *رقبة*.

4. *ab activis* شريفةٌ *شريف* et نصيرةٌ *nobilis*, نصيرةٌ *nobilis*,

شَرَافٌ، non tamen a participiis formae نَصِيرٌ passive sumptis، ut قَتِيلٌ *occisus*.

5. ab adiectivis نَدْمَانٌ et نَدْمَانٌ ut: نَصْرَانٌ et نَصْرَانٌ *pae-*  
nitens، نَدْمَانٌ.

6. ab adiectivis خُمْصَانٌ et خُمْصَانٌ ut: نَصْرَانٌ et نَصْرَانٌ خَمَاوْنٌ  
esuriens، خَمَاوْنٌ.

### نُصُورٌ

fit a substantivis بَزْرٌ ut نَصْرٌ *se-*  
men؛ ضَرُوسٌ *dens*؛ جُنْدٌ *exercitus*؛ جُنْدٌ بَزْرٌ، اَسْدٌ؛ اَسْدٌ  
*leo*؛ كُبُودٌ *iecur*، اَسْوَدٌ، شَهَادَةٌ *testis*، شَهَادَةٌ.

### نُصْرٌ

fit ab adiectivo نَاصِرٌ et نَاصِرٌ، cuius ultima radicalis non est و  
vel ى: ut ضَارِبٌ *verberans*، ضَارِبُونٌ *verberantes*، ma-  
scul. et faem. Sed differentiae causa masculinum interdum as-  
sumit ١ ante ultimam radicalem, hoc modo; ضَرَابٌ *verberan-*  
*tes*, masc.

### نُصْرَةٌ

fit ab adiectivo rationali (seu quod de rationali praedicatur,) formae نَاصِرٌ non habentis ultimam و vel ى: ut كَامِلٌ *perfectus*، و حَارِثٌ *haereditans*، قَائِمٌ *stans*، و لِرٌ *stans*; بَلَّرٌ؛ قَوْمٌ *iustus*، بَرَّةٌ.

Nona نونا

fit ab adiectivo rationali formae نَاصِرٌ quiescentis ultima : ut رَامٌ *proiiciens*, دُمَّةٌ *oppugnans*, غَازٌ *quiescens* convertitur iuxta secundum can. وَ et ۚ

## Decima فصلٌ

fit a substantivo نُصْر : ut كُوْز *urceus*, دب ; كَوْزَةُ *ursus*, زوجة زوج *maritus*, زبنة دببة ; et a paucis formae نُصْر et نُصْر : ut قردة simia, قرد *simia*.

## Undecima نصرة

نَصِيرٌ : ut fit a nominibus نُصَارَ, نُصَارٌ, نَصْرٌ, نَصْرٌ, نَصْرٌ et نَصِيرٌ  
 وَفْتَى ubi أخٌ senex شِيَخٌ ; فَتَّى frater أخٌ في puer  
 غصن ramus , in sing. abiectum redit , est enim أخٌ pro أخٌ  
 غَزَّالٌ infans , صَبَّى puer , غَلَمٌ : غَزَّلٌ dorcas , صَبَّى

## النحو الثاني

fit a substantivo نصر<sup>۱</sup> non habente medium و vél ی: ut وحدہ<sup>۲</sup> *fa-*  
*cies*, آنکہ<sup>۳</sup> *item situla*, آدل<sup>۴</sup>; *mamma mulieris*, آند<sup>۵</sup>،  
 ubi و et ی excidunt, nun vocali eorum retrocedente: sic یہ<sup>۶</sup>  
 pro یہ<sup>۷</sup> *manus*, آید<sup>۸</sup>.

et a substantivis saeminiis quae non terminantur & saemino, et quatuor constant litteris quarum penultima est اوی quiescens: ut دراع *brachium*, يَمِينٌ *iuramentum*, آیمن،

Decima tertia <sup>أنصار</sup>

fit a substantivis trium litterarum, cuiusvis formae (praeter نَصْرَ, non habentis medium vel ى aut ultimam penultimae similem): ut أَمْرَاضٌ pluvia, مَرْضٌ morbus; أمطارٌ مَطَرٌ humerus, أَبْلٌ camelus, أَبْلٌ ubi ۖ radicale excidit, iuxta can. quintum elif: عَيْنٌ oculus, عَيْنٌ عَيْنٌ dies, أَيْوَامٌ pro أيامٍ, iuxta can. tertium طَرْبٌ ى et وَ اَعْيَانٌ gaudium, اَطْرَابٌ, ab hac tamen forma نَصْرٌ saepius venit plurale decimum septimum خَتْنٌ; أَرْحَادٌ fimus bovis, نَصْرَانٌ رَحَا: in quibus ultima radicalis mutatur in hamza, secundum can. quartum إِسْمٌ ابنٌ; أَسْمَاءٌ filius, إِبْنَاءٌ: ubi redit ultima radicalis quae in singulari exciderat, mutaturque in hamza, iuxta eundem canonem.

Decima quarta <sup>أنصَار</sup>

fit a multis substantivis masculinis quatuor constantibus literis, quarum penultima est اوی quiescens: ut قَلَادٌ torques, الْهُدَى, Deus, (quod compendii causa sic scribitur pro الْهُدَى); ubi ۖ radicale excidit, iuxta canonem quintum elif: الْأَرْغَفَةُ column, رَغِيفٌ libum, et sic fere perpetuo surda, et quiescentia ل, formarum نَصَارٌ et نَصَارٌ: ut supellex, أَبْنَاءٌ; أَبْنَاءٌ antistes, أَيْمَمٌ, elif rad. in ى mu-tato iuxta primum can. elif: فَنَاءٌ قَبْنَاءٌ tunica; فَنَاءٌ فَنَاءٌ aula, أَفْنَاءٌ.

## نَوَاصِرٌ

fit a singulari نَاصِرٌ: ut طَابِقٌ *sartago*, et ab adiectivo نَاصِرٌ ac faeminino eius نَاصِرَةٌ ut ضَارِبٌ *verberans* masc. ضَارِبَةٌ *verberans* faem. ضَارِبَةٌ *verberantes* masc. et faem. a masculino tamen rationali نَاصِرٌ rarius haec forma venit.

## نَصَابِرٌ

fit a faemininis harum decem formarum:

نَصَارٌ	نُصَارٌ	نُصَارٌ	نُصُورٌ	نُصِيرٌ
نُصَارَةٌ	نُصَارَةٌ	نُصَارَةٌ	نُصُورَةٌ	نُصِيرَةٌ
ut سَحَابَةٌ	nubes	شَمَالٌ	شَمَائِلٌ	سَحَابِيْبُ
aquila	عقابٌ	ذَوَابٌ	ذَوَابَةٌ	دَوَابِيْبُ
sinistra	شمَالٌ	شَمَائِلٌ	رسَائِلٌ	سَحَابَيْفُ
vetula	عَجْوُزٌ	حَمْوَةٌ	iumentum	حَمَائِلٌ
tempus ante vesperam,	صَحِيفَةٌ	عَجَابِيْزٌ	onerarium	صَحَافِيْفُ
felix faem.	سعَادٌ	حَرِيمٌ	nobilis faem.	حَرَامِيْمُ

## نَصْرَانٌ

fit a singulari صَرَدٌ: غَلْمَانٌ *puer*, et نُصَارٌ نُصَارٌ et نُصُورٌ *aesalo*, et نُصِيرٌ نُصِيرٌ et نُصَارَةٌ نُصَارَةٌ و formarum قِيعَانٌ *ager*, قَاعٌ عِيدَانٌ *lignum*, عُودٌ حِيتَانٌ *piscis*, حُوتٌ ut *corona*, et a pance aliis: ut ظَلِيمٌ *struthio-*  
melus mas, ظَلْمَانٌ *infans*, صَبِيٌّ صَبِيَانٌ .

## نُصْرَانٌ Decima octava

fit a substantivis نَصِيرٌ، نَصْرٌ، et نَصِيرٌ، quorum media radicalis non est و vel : ut سَقْفٌ tectum, سَقْفَانٌ regio, provincia, رُغْفَانٌ libum, بُلْدَانٌ رُغْيفٌ ; بُلْدَانٌ.

## نُصْرَانٌ Decima nona

fit ab adiectivo rationali نَصِيرٌ، cuius tertia radicalis non est secundae similis, aut و vel : ut شُرِيفٌ nobilis, شُرِيفٌ كَرِيمٌ ; شُرِيفٌ honorabilis, بُخَالٌ avarus, بُخَالٌ كَرِيمٌ.

## أَنْصَارٌ Vigesima

fit ab adiectivo rationali formae نَصِيرٌ، cuius tertia radicalis est secundae similis, aut و vel : ut

dilectus,	حَبِيبٌ	أَحْبَابٌ	contracte pro	أَحْبَابٌ
vehemens,	شَدِيدٌ	أَشَدٌ		أَشَدٌ

et in paucissimis perfectis : ut أَصْدِيقٌ verax, أَصْدِيقٌ صَدِيقٌ sicut contra imperfecta quandam habent تَقْوَىٰ, تَقْوَىٰ pius, تَقْوَىٰ نُصْرَانٌ : نُصْرَانٌ.

## نُصْرَى Vigesima prima

fit ab adiectivis formae نَصِيرٌ ; et interdum quoque نَاصِرٌ vel نَصِيرٌ significantibus dolorem aut destructionem مُهْلَكٌ vul- neratus, هَالَّكُ occisus, قَتِيلٌ periens, جَرْحٌ هَالَّكُ : قَتِيلٌ.

Vigesima secunda نَصَارَى

fit a singularis عَنْدَهُ اَسْعَادٌ ; صَحْلَارِي ager , نَصْرَاءَ virgo , عَذْدَارِي .

Si quae autem harum formarum ab aliis etiam singularibus trilitteris et nudis aut faeminitis eorum veniunt, id speciale est et notandum, sicuti et observanda sunt illiusmodi singularia, quorum pluralia diversa habent formas a nominatis: qualia non usque adeo multa occurrent.

Ea autem singularia quarum formae in diversis hic com-  
parent classibus, diversa quoque ut plurimum habent plura-  
lia: sic a نَفْسٌ anima, fit نَفْسٌ animae; غُلَامٌ puer,  
وَغِيفٌ oculi; عَيْنٌ عَيْنٌ oculus, et غُلَمَانٌ غُلَمَةٌ  
libum, سِيرَانٌ اسْوَارٌ murus; سُورٌ liba; أَرْغَفَةٌ رُغْفَانٌ  
palpebrae; جُفُونٌ servus, عَبَادٌ عبد; عَبَادٌ عبدانٌ, عَبُودٌ  
بَحْرٌ, بَحْلَارٌ بَحْرٌ servi; بَحْرٌ mare, عَبِيدٌ عبدٌ et quoque  
et شَاهِدٌ شَاهِدٌ شَاهِدُونَ شَاهِدٌ testes. maria; أَبْحَرٌ  
Non tamen perpetuo omnia illa quae a talibus formis derivari  
possunt: sic a نَفْسٌ non dicitur نَفَاسٌ, نَفَسٌ نَفَسٌ;  
nec ab عَبَدٌ عَبَدٌ عَبَدٌ عَبَدٌ dicuntur, etc. interdum vero  
unum tantum; ut a رَجُلٌ vir, solum fit رَجُلٌ nego-  
tium, solum أَمْرٌ Amor: quod usus docebit.

Observandum autem est formas undecimam , duodecimam , decimam tertiam et decimam quartam , pluralia paucitatis vocari et usurpari cum numeralibus tantum , si videlicet aliud eiusdem singularis plurale extet ; si minus , etiam has generanter usurpari , ut solent reliquae .

Atque haec quidem de nudis trilitteris dicta sunt: quadrilittera autem nuda omnia, et aucta pleraque, cum femininis suis formant plurale fractum assumptum quiescente post secundam litteram, quae, ut et prima, fatha possidet, sicut tertia kesra; ut sit formae قَمَاطِرٌ ضَفْدِعٌ: *rana*, ضَفَادُعٌ ; مَذَبَّلَةٌ vestibulum, مَدَّاخِلٌ مَدَّاخِلٌ, & autem finale excidit: ut مَزَبَّلَةٌ *zibala*, مَزَابِلٌ *zabila*, et ultimam radicalem si praecedat aliqua litterarum quiescens, ea manet; ut قَنَادِيلٌ *qandil*, أَوْيٌ *ayi*: قَنَادِيلٌ *lampas*, سُلْطَانٌ وَّ *sultani*, ut sed ob praecedens kesra in ي mutata, si sit ل vel; ut princeps, عَرَاقِيبٌ *calcaneus*, سَلَطِينٌ *sultani*: interdum tamen ea excidit, & in fine accidente ad eius compensationem; ut اِسْكَانٌ *iscanus*; أَبَالِسَةٌ *abalis*, et اَبَالِيْسٌ *abaliyis*, اَسَاكِفَةٌ *asakifa* et اَسَاكِيفٌ *asakif*: sicuti et alias interdum accedit &; ut تَلَمِيدٌ *discipulus*; اَسَاقِفَةٌ *episcopus*, اَسَاقِفٌ *asqaf*, اَسْقُفٌ *ascuf*: تَلَمِيدَةٌ *discipula* et تَلَمِيدَةٌ *talimida*. Hanc etiam pluralis formam adsciscunt adiectiva formae اَنْصَرٌ *anṣar*, de quibus supra نُصْرٌ dictum est; ut أَسْوَدٌ *niger*, لَسَّاوْدٌ *lasawd*, et comparativa, ut أَصْغَرٌ *minor*, أَصْغَرُ *minimus*, أَكْبَرٌ *maior*, أَكْبَرُ *maximus*, et pluralia quaedam aucta trilitterorum (formatur enim interdum ab uno plurali aliud ad copiam sermonis; ) ut ظُفَرٌ *unguis*, in plur. habet اَظْفَارٌ *zafar*, unde formatur secundum plurale: sic ab اَسْوَرَةٌ *vena*, fit سَوَارٌ *a*; عَرَيقٌ *armilla*, اَسْوَرَةٌ *aswara*, et ab hoc اَسْأَوْرٌ *aswara*.

Ad hanc quoque pluralis formam reduci commode pos-

sunt formae نواصر نصایر supra positae , ut insipienti satis fit manifestum .

Caeterum quaedam ultimam litteram habentia quiescentem kesra penultimum in fatha mutant : ut عَدْرَى pro عَنْرَى , ab عَدْرَى virgo .

Quae autem quinque vel pluribus constant litteris ( non annumeratis و et اوی quiescentibus ) eandem quidem formam assumunt , sed abiecta tamen littera una aut pluribus : nuda enim pentagrammata abiiciunt ultimam radicalem ; ut سَفِرْجَلْ cydonium malum , عَنَاكِبْ aranea , et interdum quoque penultimam , manente ultima ; ut خَزْرَنْقْ aranea , فَرْزَدْقْ collect. frustum libi decidiuum , mica , فَرْازْقْ et فَرْازْدْ . Si tamen penultima est و vel diptongescens post fatha , utraque manet , ultima scilicet et penultima , sed و in و mutatur ob kesra praecedens , ut فَرْعَونْ crocodilus , فَرْاعِينْ . Aucta vero abiiciunt serviles ; ut مدحراج locus volutationis , حَارِجْ : manet tamen م , si serviat cum ن ; ut مُسْتَخْرِجْ solutus , مُطَالِقْ : vel cum سَهْتْ ; ut مُسْتَخْرِجْ educator , مُخَارِجْ .

#### Observatio de pluralibus anomalis .

Notandum est singularia quaedam , pluralia sua aliunde mutuari : ut ام mater habet امهاتْ , tanquam ab فُمْ os , ماءْ ; عَائِشْ عَاشْ , ut ab فُوَّةْ : a افواهْ aqua , نَسْوَةْ , نَسَاءْ امرأةْ ; مَاءْ mulier , habet مَيَاهْ , et امْواهْ ; انسَى homo , ab انسَانْ : نَسْوانْ ; انسَى pro انسَى , ponitur enim انسَانْ :

sed ob frequentem usum ى excidit : quidam tamen putant poni pro plurali regulariter formato ab أَنْسَانٌ , nempe أَنْسَيْنُ , abiepto يَنْ ; et sic pauca alia , de quibus alias . Atque haec de pluralibus nunc sufficient .

## C A P U T S E P T I M U M.

## De casu .

**I**n numero tres sunt casus , nominativus , genitivus ( sub quo dativus etiam noster et ab ablative continetur ) et accusativus . Horum ratione nomina alia sunt triptota ; alia dipotta . Triptota sunt , in quibus casus isti tres tribus distinctis terminationibus discernuntur . Diptota ; in quibus casus obliqui una terminatione continentur , atque adeo quae duas tantum terminaciones agnoscunt .

Triptota autem sunt ,

Omnia fere singularia , et pluralia fracta , terminantque nominativum per " *on* , genitivum per " *en* , accusativum per " *an* : ut nominat. رَجُلٌ *vir* , genit. رَجُلٍ *viri* vel *viro* , accus. رَجُلٌ *virum* ; رَجُلٌ *viri* , رَجُلٌ *virorum* , et *viris* , رَجُلٌ *viros* .

Diptota sunt ,

1. Dualia omnia , habentq; nominativum in ان , genitivum et accusat. in يَنْ : ut رَجُلَيْنِ *duo viri* , duorum virorum , duobus viris , duos viros : مَدِينَتَيْنِ *duae urbes* , مَدِينَتَيْنِ *duarum urbium* , duabus urbibus , duas urbes .

2. Pluralia sana masculina , habentque nominativum in وَنْ . genitivum et accusat. in يَنْ : ut مُوْمِنُونَ *credentes* , مُوْمِنُونَ *credentium* , credentibus , credentes .

3. Pluralia sana faeminina , habentque nominativum in

أَتْ', genitivum et accusativum أَتْ': ut أَمْهَاتْ matres, أمهات matrum, matribus, matres.

4. Nomina invariabilia quae vocant Arabes, seu quorum ultima vocalis non admittit nummationem: habetque nominativum in '، genitivum et accusativum '، ut عُثمانُ Othmanus, عُثمانُ Othmani, Othmano, Othmanum: مساجِدٌ templas, templorum, templis, templos; أَسْوَدٌ niger, أَسْوَدٌ nigri, nigro, nigrum.

Sunt autem nomina invariabilia.

1. Adiectiva posita et comparativa formae أَفْعَلٌ: ut أحمر ruber, أَكْبَرٌ maior, maximus, nisi quod rarius accidit, fae-minimum per ة forment; sicuti أَرْمَلٌ viduus, أَرْمَلَةٌ vidua.

2. Adiectiva terminata اَنْ servili, quae non formant fae-min. addito ة ut غَضِيبَانٌ iratus, cuius faemin. est غَضِيبَى; sic enim etiam huius formae quaedam adiectiva moventur.

3. Terminata elif servili, ut صَفَرًا flava: vel ة servili quiescente instar elif; ut ذَكْرِي recordatio, pro ذَكْرِي iuxta can. tertium ة; sic etiam غَضِيبَى irata, قَتْلَى occisi.

4. Pluralia fracta formae قَمَاطِيرُ vel قَمَاطِرُ نَوَاصِرُ: ut مَدَارِلُ verberantes, قَنَادِيلُ lucernae, صَفَاعُ vestibula, خَزَارُ vel خَزَارَهُ araneae. Sed ea quarum ultima radicalis est littera quiescens, triptota sunt, ut reliqua pluralia fracta: quaedam tamen kesra penultimam in fatha mutant, et ea huius quoque loci sunt; ut عَذَارِي virgines, pro عَذَارِي in nominativo, عَذَارِي in genit. et accus. sic نَصَارِي

christiani , pro نصارىٰ et نصارىٰ . Caeterum vox سُرُوايْلُ fe-  
moralia , aliis est plur. a سُرُوالٌ , et regulariter diptoton ; ali-  
is singulare per se , et diptoton ob similitudinem quam ha-  
bet cum plurali formae نصارىٰ .

5. Regionum , insularum , urbium , pagorum , artium ,  
montium , fluviorum , et locorum quaelibet nomina : ut مصر  
Aegyptus , Cyprus مَكَّةٌ Mecca , جِيزَةٌ Gjize عَكَارٌ  
Acára , دَرْنٌ Atlas mons , دَحْلَةٌ Tygris , غُوطَةٌ Gota .

6. Pleraque hominum propria ; et inter caetera masculina  
omnia terminata اً : ut عمرانٌ Imran , عَتَمَانٌ Othman , et  
barbara pluribus quam tribus litteris constantia ; ut إِبْرَهِيمُ  
Abraham , إِسَاعُ Isaac , يَعْقُوبُ Jacob , آدَمُ Adam , جَهَنَّمٌ  
Gehenna , فَرْدُوسٌ Paradisus , etc. nec non faeminina termina-  
ta ፩ faeminino , ut عِيشَةٌ Aisja ; et constantia litteris quatuor,  
زَينَبٌ Zainab ; vel tribus quarum media movetur , ut سَقْرٌ Sa-  
kar , aut damma ante se habet , ut جُورٌ Gjoero , quae au-  
tem tribus constant litteris nec terminantur ፩ , nisi barbara  
sint , ( nam haec sunt diptota ) modo triptota sunt , modo di-  
ptota , ut nom. سَقْرٌ genit. سَقْرًا acc. , et nom. سَقْرٌ gen.  
et accus. سَقْرٌ , sic nom. دَعْدَى , genit. دَعْدَى acc. ; et nom.  
دَعْدَى genit. et accus. دَعْدَى , quod et reliquis nominibus invaria-  
bilibus ( in poesi potissimum ) interdum contingit ; sicut con-  
tra , variabilia seu triptota quaedam , invariabilia seu diptota  
subinde fiunt : sed utrumque rarum est .

Bene autem hic meminisse oportet canonis tertii و , nec  
non tertii et quarti ى : nam iuxta canonem tertium و dicitur ,

عَصْوٌ، عَصْوٌ، عَصْوٌ pro عَصْوٌ *baculum*, *baculi* vel *baculo*, *baculum*: et iuxta tertium can. رَحْيٌ، رَحْيٌ، رَحْيٌ pro رَحْيٌ *mola*, *molae*, *molam*; iuxta quartum vero eiusdem canonem دَارٌ، دَارٌ، دَارٌ pro دَارٌ *proiiciens*, *proiicientis*; pro جَوَارِيٍّ، جَوَارِيٍّ، جَوَارِيٍّ *puellae*, *puellarum*.

Consideranda autem in hisce casibus sunt apocope et permutatio.

Apocope est & *nun* casualis: vocalis quidem, in nominibus triptotis, et diptotis pluralibus faemininis perfectis: consoni vero in diptotis dualibus, et pluralibus masculinis perfectis, amittunt enim haec omnia *nun* ob constructionem, tum regiminis, seu cum sequitur genitivus: ut كُتَابٌ *liber*, كُتَابٌ مُوسَى *liber Mosis*, كُتَابٌ مُوسَى *libri* vel *libro Mosis*, كُتَابٌ مُوسَى *librum Mosis*: كُتَابٌ مُوسَى *libri duo*, كُتَابٌ مُوسَى *libri* *duo Mosis*, كُتَابٌ مُوسَى *librorum duorum*, *libris duobus*, vel *libros duos Mosis*: كُتُبٌ مُوسَى *libri Mosis*, كُتُبٌ مُوسَى *librorum*, vel *libris Mosis*, كُتُبٌ مُوسَى *libros Mosis*: بَنْيَ اللَّهِ *filii Dei*, بَنْوَ اللَّهِ *filii Dei*, بَنْوَ اللَّهِ *filiorum*, *filii* vel *filios Dei*, tum affixi, seu cum annexetur pronomen possessivum: ut كُتابَةٌ *liber eius*, كُتابَةٌ *libri* vel *libro eius*, كُتابَةٌ *librum eius*; كُتابَةٌ *libri duo eius*; كُتابَةٌ *librorum duorum*, *libris duobus*, vel *libros duos eius*; كُتابَةٌ، كُتابَةٌ، *libri*, *librorum*, et *libros eius*. Et *nun* vocale etiam excidit ob articulum الْ *tum* praecedentem, ut الْكُتابُ

*liber*, الكتاب *الكتاب* *libri*, *librum*; *tum sequentem*, ut  
كتاب الذي *liber qui*, كتاب الذي *librum qui*, etc. رأي *sagittarius*, رامي الملك *sagittarius regis*: *excidente enim nun*  
redit ى abiectum.

Sed أب *pater*, أخ *frater*, حم *socer*, et interdum quoque  
هـ *res*, *muliebria*, *nun ob constructionem abiicientes* ( nisi  
accedat ى affixum,) assumunt eius loco litteram quiescentem:  
in nominativo, in gen., in acc. ٍ: *is est* هو أبو داود  
*pater Davidis*, *a patre Davidis*, من أبي داود، رأيت أبي داود،  
*vidi patrem Davidis*; أبيك *pater tuus*, أبوك *patris tui*,  
*patrem tuum*. Sic ذو *possessor*, in regimine ( nec aliter usur-  
patur ) habet genitivum ذي, accusativum ذا, et فم *os*, *oris*,  
in gen. constructio فى *habet*, ( etiam cum affixo ى ) et in ac-  
cusativo فـ.

Permutatio est nominativi cum accusativo: accipit enim ille  
huius terminationem in subiecto enuntiationis, cum praecedunt  
particulae subiecti, quae sunt

أن *etenim*, *utique*: كان *quod*: *sicuti*, *ac si*:  
لـ *utinam*: لـ *fortassis*:  
أن الله غفور *utique Mohammad stat*: *etenim*  
Deus est clemens علموا أن الملك قدير; *sciunt quod rex est*  
الملك الله *pro* محمد *est pro* الله *الله*, *محمد* *الملك* .

Sed necesse est ut nihil intercedat; nisi forte praepositio

eum suo casu: ut أَنْ فِي الْدَّارِ رَجُلٌ utique in domo est homo, quoque et لَيْتَ assumunt interdum مَا in fine; et tune أَنْ semper, لَيْتَ ut plurimum, virtutem illam amittit.

Sic لَا non est, immediate praepositum appellativo ei influxu suo pro nominativi dat accusativi terminationem, sed sine nun vocali; ut لَرِبِّ فِيهِ non est dubium in eo; sed iteratum libere influit in alterutrum, et utrumque; ut

	لَا حَوْلَ وَلَا قُوَّةَ	
أَلَا بِاللَّهِ	لَا حَوْلَ وَلَا قُوَّةَ	non est virtus nec potentia nisi in Deo.
	لَا حَوْلَ وَلَا قُوَّةَ	
	لَا حَوْلَ وَلَا قُوَّةَ	

### De vocativo.

Vocativus per accusativum concipitur: ut يَا رَجُلٌ o vir, يَا عَبْدَ اللَّهِ o serve Dei: nisi sit nominis proprii aut appellativi possidentis articulum: vel absolute positi, quod significat rem quam vocans intuetur; tum enim concipitur per nominat. sed absque nun vocali: ut يَا أَدَمُ o Adam, يَا مُحَمَّدٌ o Mohammad, يَا رَجُلٌ o homines, يَا إِلَيْهَا النَّاسُ o tu vir, (quem scilicet aspicio) يَا نَبِيُّونَ o vos duo viri, يَا رَجُلَانِ o vos prophetae. Si quis ad opem invocetur, adhibetur non raro genitivus praefixo لـ: ut يَا لَزِيدِ لـ o Zaide, (adiuva scilicet) vel accusat. cum اـ, ut يَا زَيْدَ اـ. Adiectivum vocativo appositorum aut substantivum per copulativam coniunctionem ei adiunctum, indifferenter nominativi terminationem habet vel

accusativi; nisi adsit affixum, tunc enim accusativi tantum. Cum autem vocativo addendum est *mi*, vel *mei*, id regulatius sit per affixum *ى*: ut يَا غُلَامِي *o puer mi*; et fathato يَا غُلَامِي *raro per l'*, ut يَا غُلَامِاً *غُلَام*; rariissime per simplex damma, ut يَا غُلَامْ *ابي* autem *pater mi*, et أمِي *mater mea*, interdum dicitur, أَبْتَ *أبٌت*, et أَمْتَ *أمت*, vel أَبْتَ *أبٌت*, et أَمْتَ *أمت*: quod speciale est.

## C A P U T O C T A V U M.

## De declinatione.

**E**x numerorum et casum supra memoratorum varietate declinationes exsurgunt quatuor.

Prima triptota est in singulari et plurali, (nam dualis ubique eadem est ratio:) ut

sing. nom. بَيْتٌ, gen. بَيْتٌ, accus. بَيْتَنا.

plur. nom. بَيْوَاتٌ, gen. بَيْوَاتٌ, accus. بَيْوَاتَنَا.

Secunda triptota in singulari et diptota in plurali: ut

sing. nom. نَاصِرٌ, gen. نَاصِرٌ, accus. نَاصِرًا.

plur. nom. نَاصِرُونَ, gen. et acc. نَاصِرِينَ.

sing. nom. نَاصِرَةٌ, gen. نَاصِرَةٌ, acc. نَاصِرَةً.

plur. nom. نَاصِرَاتٌ, gen. et acc. نَاصِرَاتٍ.

sing. nom. مَسْجِدٌ, gen. مَسْجِدٌ, acc. مَسْجِدًا.

plur. nom. مَسَاجِدٌ, gen. et acc. مَسَاجِدٍ.

Tertia diptota in sing. et triptota in plurali, ut

sing.	nom.	أَحْمَرٌ	gen. et acc.	أَحْمَرٌ
-------	------	----------	--------------	----------

plur.	nom.	حُمَرٌ	gen. حُمَرٌ	acc. حُمَرًا
-------	------	--------	-------------	--------------

Quarta diptota in sing. et plurali, ut

sing.	nom.	أَصْغَرٌ	gen. et acc.	أَصْغَرٌ
-------	------	----------	--------------	----------

plur.	nom.	أَصْغَارٌ	gen. et acc.	أَصْغَارٌ
-------	------	-----------	--------------	-----------

### C A P U T N O N U M .

#### De comparatione .

**C**omparativus fit a positivo praefixo أ ; estque formae أَفْعَلٌ ut جَسَنْ bonus , أَحْسَنْ melior ; صَغِيرٌ parvus , أَصْغَرٌ minor ; حَبِيبٌ charus , أَحْبَبْ ( pro حَبِيبٍ ) charior , habetq; post se منْ أَعْظَمْ مِنَ الْمَلِكِ maior rege , si absolute ponatur aut in regimine , superlativus est ; ut الله أَعْلَمْ Deus est scientissimus ; أَحْسَنُ النَّاسِ optimus hominum .

### C A P U T D E C I M U M .

#### De numeralibus .

**N**ominum numeralium , quia peculiaria quaedam habent , tractatum hic lubet adiicere : sunt autem duplia : cardinalia , et ordinalia . Cardinalia sunt

faem.	masc.	faem.	masc.
سَتٌ	سَتٌ	6	وَاحِدَةٌ وَاحِدٌ
سَبْعٌ	سَبْعٌ	7	أَحَدُ أَحَدٌ

اثنان	اثنتان	ثمانية	ثمانتان	اثنتان	اثنتان
تسعة	نادن	تسعة	نادن	تسعة	تسعة
عشر	أربع	عشر	أربع	عشر	أربع
مأيتان	خمسون	مأيتان	خمسون	مأيتان	عشرون
الف	ستون	تسعون	ستون	تسعون	ثلاثون
اللسان	سبعون	مائة	سبعون	سبعون	أربعون

Quorum prima duo regulariter formant faemininum : sequentia octo masculina sunt sub terminatione faeminina , et viceversa : reliqua communia . Ea autem quae terminantur ن , diptota sunt , ut reliqua dualia , et perfecta ; caetera vero triptota .

Reliqua ex his componuntur , minori numero perpetuo praemisso , idque sine coniunctione copulativa usque ad vingt : ut

faem.

masc.

faem.

masc.

١١ أحد عشر	احدى عشرة	١٣ ثالث عشر	ثالثة عشرة
١٢ اثنتا عشر	اثنتا عشرة	١٤ أربع عشر	أربع عشرة

et sic de caeteris : ita ut in hac compositione regulariter sit masculinum , et عشرة faem. et utrumque terminetur nuda vocali fatha , idque in omni casu ; praeterquam اثنتا عشرين et اثنتا عشرة , quorum casus obliquus اثنتا عشرين et اثنتا عشرة .

In reliquis accedit coniunctio absque ulla mutatione : ut أحد عشرين , أحد عشرة , أحد وعشرين , أحد وعشرون ,

Ordinalia sunt,

faem.	masc.	faem.	masc.
سَادِةٌ	سَادِسٌ 6	أُولَى	أَوْلَى ۱. usq.
سَابِعَةٌ	سَابِعٌ 7	ثَانِيَةٌ	ثَانِيٌّ 2
تَامِيَةٌ	تَامِنٌ 8	ثَالِثَةٌ	ثَالِثٌ 3
تَاسِعَةٌ	تَاسِعٌ 9	رَابِعَةٌ	رَابِعٌ 4
عَاصِرَةٌ	عَاصِرٌ 10	خَامِسَةٌ	خَامِسٌ 5

عِشْرُونَ *vigesimus, ma;* شَلْتُونَ *trigesimus, ma:* et sic de caeteris denariis : nam in his non differunt ordinalia a cardinalibus .

Reliqua ex his componuntur eodem fere modo , quo cardinalia : ut

faem.	masc.
حَادِيَةٌ عَشْرَةٌ	حَادِيَ عَشْرٌ ۱۱
ثَانِيَةٌ عَشْرَةٌ	ثَانِيَ عَشْرٌ ۱۲
ثَالِثَةٌ عَشْرَةٌ	ثَالِثٌ عَشْرٌ ۱۳

et sic caetera , ut aptota quoque sint per fatha :

حَادِيَ وَعِشْرُونَ ۲۱

et ita reliqua .

Usurpatur autem pro ordinali numerus cardinalis , cum numeratum non est restrictum .

### C A P U T U N D E C I M U M .

De pronomine .

**N**ominis vicem subeunt pronomina ; quae sunt separata , vel aliis vocibus affixa . Separata sunt triplicia , personalia ,

demonstrativa, et relativa: quae generibus et numeris variantur ut nomina: sed casus non agnoscunt; nisi dualia demonstrativa et relativa, quae more nominum diptota sunt.

Personalia autem sunt haec;

plural.		dual.		singul.
illi هُمْ	vos أَنْتُمْ	nos أَنْتُمْ	illi duo, vos duo هُمَا	ille tu ego أَنْتُ هُوَ
			أَنْتَمَا	masc. أَنَا
illae هُنْ				illa أَنْتَ هُيَّ
				com. faem.

Quorum ea quae tertiae personae sunt pro verbo substantivo cuiusvis personae saepissime usurpantur.

Demonstrativum autem propinquum est **هـ hic**; quod sic selectitur:

plur.		dual.		sing.
أَلَّا		ذَيْنِينَ	ذَانِ	ذَا masc.
أَلَّى				com.
		قَيْنِينَ	تَانِ	ذَهِيْ تَيْ com.
				faem.
			تَاهِيْ تَيْ	

sitque demonstrativum remoti addito **كـ**, in hunc modum;

plural.		dual.		sing.
أَلَّا يَكُونُ		ذَيْنِيكَ	ذَانِيكَ	ذَاكَ ille
أَلَّى يَكُونُ		قَيْنِيكَ	تَانِيكَ	تَيَاكَ illa

ante quod **كـ** in singul. et plur. non raro assumitur **لـ**, ut dicitur **ذَالِكـ**, et cum **مـ** paragogico **ذَالِكُمْ**, **أَلَّالِكـ**, **تَالِكـ**, **أَلَّالِكُمْ**, utri-

que autem , nisi ل illud assumatur , crebro praefigitur ها : eius tamen ل compendii causa non solet pingi ; sed per satha perpendicularē aut medda repraesentari , ( quod et تا ante ل , et aliis vocibus ل quiescens habentibus creberrime accidit ) hoc modo :

هولاء	هذين	هذا
	هذين	هذا

Relativum est الَّذِي qui , compositum ex articulo et لَدِي ؛ flectiturque hoc modo :

الَّذِينَ الَّذِي الَّذِي	الَّذِينَ الَّذِينَ الَّذِي	الَّذِي
الَّذِي الَّذِينَ الَّذِي	الَّذِي الَّذِينَ الَّذِي	الَّذِي

Nun duale hic et in demonstrativis interdum habet tesdid , in compensationem ultimae singularis excidentis .

Caeterum relativum hoc non patitur ante se litteras ser-  
viles praeter فَكُلُوا , ac rarissime usurpatur in easu obliquo ,  
sed defectus hi supplementur per affixa vocum sequentium : sic

pro مِنْ الَّذِي in quo , dicitur بِالَّذِي a quo ,  
وَالَّذِي مِنْهُ quem vidi , الَّذِي رَأَيْتُ .

Relativa quoque sunt sed antecedens includentia من is qui ,  
et ii qui , quicunque ; ما id quod , quodcunque , ea quae , quae-  
cunque : illud de personis , hoc de rebus dicitur : et utrum-  
que non raro interrogat .

أى autem quis , qualis , nomen est interrogativum et sub-  
stantivum ; unde aliud substantivum regit in genitivo : ut أى  
qualis liber , من أى كتاب ex quo vel quali libro ?

Affixa cum nominibus significant possessionem , referunt-

que pronomina nostra possessiva : cum verbis ut plurimum casum patientem ; non raro tamen dativum , maxime cum accusativus alius sequitur : suntque

plural.	dual.	singul.	
3 2 1 كُم هُم	3 2 كُما هُما	3 2 1 pers. كُنْ هَنْ	masc.
نَا		يِ	com.
كُنْ هَنْ		كُهَا	faem.

Pro يِ , cum verbis et particulis terminatis نِ , est نِي .

Nunquam autem mutantur : nisi quod هُمْ هَنْ ; damma in kesra mutant , cum immediate praecedit kesra , ut من رَبِّي ; vel يِ vocali destitutum , ut فيه in eo , et عَلَيْهِ super eo : et quod يِ loco kesra ante se , habet fatha super se , cum annexitur dictioni terminatae aliqua litterarum اوی vocali de-stituta : ut غُلَمَانِي peccata , خَطَايَايِي peccata mea , duo pueri , غُلَمَيْنِي duorum puerorum , مُسْلِمَيْنِي duorum puerorum meorum ; fidelium , مُسْلِمَيْنِي fidelium , مُسْلِمَوْنِي iuxta canon. 5.

ie : حَصَّا baculus , عَصَّا baculus meus ; رَأِمٌ sagittarius , رَأِمٌ sagittarius meus , et quod post kesra interdum excidit , quod frequens est in vocativo : ut رَبِّي domine mi : et fere perpetuum , cum praecedit aliud يِ descendens ex hamza ; ut أَحَبَّا يِ amici mei , أَبَّا يِ patres mei . Sic pro نِي occurrit نِ ; ut أَنْصَرُو نِ adiuva me .

Et vocibus nullam inducunt mutationem : nisi quod in no-

minibus *nun* causale tollunt, ut supra dictum est: et ى insuper ultimam vocalem; ut كُتَابٌ *liber*, كتابى *liber meus*: ac ۖ faemininum in ۖ mutant; ut عَمَّةٌ *amita*, عمّتك *amita tua*: nec non hamza ultimum in ۏ vel ى, iuxta canonem primum *elif*. In verbis autem pellunt ۏ otiosum post ۏ servile; ut نَصَرُونَا *adiuverunt*, نَصَرْوْنَا *adiuverunt nos*: et terminacioni قُمْ *adiüciunt*, و ۏ نَصَرْتُمْ *adiuvistis*, و ۏ نَصَرْتُمْ *adiuvistis eum*.

In utrisque autem, tum nominibus tum verbis, *ie* finale post fatha quiescens instar *elif*, libere in *elif* quiescens mutant vel relinquunt: ut رَمَاهُ *iecit*, رَمَاهُ *iecit eum*; et فَتَاهُ *puer*, فَتَاهُ *puer eius*. Nam in particulis ى hoc diphongescit; ut أَلَيْهِ *ad*, أَلَيْهِ *ad eum*.

Uni autem verbo duo interdum annectuntur affixa: ut أَعْطَانَيْهِ *dedit mihi eum*, يَكْفِيكُمْ *sufficere fecit tibi illos*.

Possunt quoque affixa separatim verbis apponi, sed praefixo اَيَّاً *ut*, اَيَّاً *te*, اَيَّاً *me*, etc. ضَرِبَكَ *atque etiam ضَرِبَكَ* اَيَّاً *verberavit te*.

Actiones autem reciprocae per nomen نَفْسٌ cum affixis exprimuntur: ut أَحَبَبْتُ نَفْسِي *dilexi me* (quasi dicat, *animam meam*) أَحَبَبْتُمْ نَفْسَكُمْ *dilexistis vos ipsos*, etc. rarissime per nudum affixum, ut أَحَبَنِي *diligo me*.

Finis libri tertii.

THOMAE ERPENII

## GRAMMATICAE ARABICAE

LIBER QUARTUS

DE PARTICULIS.

## C A P U T P R I M U M .

De particulis coniunctis.

**P**articularum orationis indeclinabilium aliae sunt coniunctae, quae perpetuo aliis vocibus praesiguntur; aliae separatae: coniunctae sunt octo litterae أَنْتُمْ فَكُلُو أَيُّوبُ اسْبَهُ .

habet fatha, estque nota interrogationis: ut أَمَاتْ an obiit? أَنْتْ an tu? أَفِي an in? et vocandi articulus; ut أَيُّوبُ o Iosephe, vocatque propinquum.

ب

semper possidet kesra, et

1. significat in: ut بِالْمَسْجِدِ in templo.

2. notat instrumentum: ut كَتَبْتُ بِقَلْمَنْ scripsi calamo:

3. valet cum; quando videlicet subiungitur verbis adven-tus et discessus, quae tum per adducere, afferre, abducere, auferre, exponuntur: ut أَتْوَى بِكِتَابٍ attulerunt librum; ذَهَبُوا بِالْفَتَنِ abduxerunt puerum vel iuvenem.

4. significat per: ut بِأَبِي per patrem meum.

5. valet *propter* : ut يَدْخُولُكَ *propter introitum tuum*.

6. est iurandi particula : ut بِاللَّهِ *per Deum*, بِالْأَرْضِ *per terram*.

7. nominativo praesfigitur pleonastice : ut اللَّهُ يَقْدِيرُ *Deus est in potente*, id est, *potens*; أنا بِمُؤْمِنٍ *ego sum in credente*, id est, *credens*.

8. constructioni verborum peculiariter inservit : ut مَرْبِي *praeteriit me*.

## ت

praesfigitur nomini اللَّهُ cum fatha, estque iurandi particula : ut تَاللَّهُ *per Deum*.

## س

cum fatha futuro praesfigitur, et valet *post*, vide pag. 37.

## ف

habet fatha, et significat *ac*, *dein*; subiungitque praecedenti id quod re ipsa posterius est, et sequitur, sed sine mora; quo differt a تُمْ. Initio tamen sententiae, et post dictiones completivas saepe redundat, et completa est. Emphasis egregiam importat, et per *igitur* commode saepe reddatur, cum imperativo praesfigitur. Exempla passim sunt obvia.

## ك

fatha quoque possidet, et significat *sicut*, *instar*, regitque genitivum, nec admittit affixa : ut كُرْجُلِ *sicut vir*.

## ل

1. est dativi nostri nota, regitque genitivum, ac obtinet kesra; ut لِرَبِّ *domino*: cum affixis tamen habet fatha, ut لَكَ *tibi*.

2. significat *ob*, *propter*, cum kesra: ut لَكْذِبَةٌ ضَرِبَتْهُ verberavi eum *ob* mendacium eius.

3. denotat *ad*: ut ضَرِبَتْهُ لِتَنَاهِيَّهُ verberavi eum *ad* eruendi.

4. iuramenti cum admiratione particula: et لَهُ *per Deum!*

5. cum fatha, est vocationis ad opem nota: ut يَا لَزِيدٍ o Zaide adiuva.

6. per pleonasmum eleganter vocibus praesigitur cum fatha, nec mutationem ullam inducit; cum alibi, tum maxime initio praedicati, cuius subiectum ante se habet ان: ut ان اللہ لَقَدْ يَعْلَمُ etenim seu utique Deus est potens; ان اللہ لَيُحِبُّ الْمُوْمِنِينَ etenim Deus est in caelo, namque, ان اللہ لَيُحِبُّ الْمُجْرِمِينَ equidem, Deus amat fideles.

7. praesigitur praeterito cum fatha, vertitque id in optativum, vide pag. 36.

8. praesigitur futuro cum kesra, et tunc aut format ex eo imperativum, inducitque apocopen; aut significat *ut*, inducitque antithesin, vide pag. 41. et 43.

9. peculiariter inservit verbis: ut دَفْكُمْ pro دَفِّنْ لَكُمْ eleicit vos.

habet fatha, estque

1. Coniunctio copulativa, *et*, *etiam*; sed non includit ordinem, ut ف; de quo supra vide sis:

2. iurandi particula, regit genitivum: ut وَرَبٌ *per Dominum*.

3. Praepositio aequivalens *cum*, et regit accusativum: ut جَاءَ الْأَمِيرُ وَالْجَيْشُ *venit Imperator cum exercitu.*

## Appendix.

عَنْ مَا مِمَّا وَعْدَتْ عَنْ مَا مِمَّا et videtur quoque serviles esse in pro

## CAPUT SECUNDUM.

## De particulis separatis.

**P**articulas separatas more nostro visum est distinguere in adverbia, coniunctiones, praepositiones, et interiectiones: quae omnes immutabiles sunt.

## Adverbia loci.

إِلَى أَيْنَ ; مِنْ حَيْثُ , مِنْ أَيْنَ ubi ; et hinc هَاهُنَا حَيْثُ , أَيْنَ هَاهُنَا هُنَّا , et هُنَّا quo : إِلَى حَيْثُ hic ; مِنْ هُنَّا illuc , مِنْ هُنَّا هُنَّا illinc , إِلَى هُنَّا هُنَّا huc , إِلَى هُنَّا illuc , etc.

## Temporis.

عَنْ مَنْ quando , cum : قَدْ iam , ante ; cum praeterito ; in ter dum cum futuro , saepe etiam cum praet. vacat , aut indicat praeteritum non venire loco futuri vel praesentis , aut em phasin solum aliquam importat ; ut et قَدْ et قَدْ un quam : أَيَّانَ quum ; يَوْمَ أَيَّانَ et أَذْ مَا , أَذْ , أَذْ deinde : ثُمَّ et ثُمَّ et ثُمَّ quum : أَيَّانَ quum ; يَوْمَ أَيَّانَ et أَذْ مَا , بَعْدَ , أَذْ , لَمَّا : tunc حَيْنَيْد , يَوْمَيْد et حَيْنَيْد من بَعْدَ مَا , بَعْدَ , أَذْ , لَمَّا : post بَعْدَ هَذَا , antehac قَبْلَ هَذَا : post سَفَ , سَفَ , سَوْفَ : سَوْفَ quum : أَنْ donee : إِلَى أَنْ et حَتَّى أَنْ , حَتَّى donee , قَبْلَ :

من قبْلُ آنَّ antea ; et بَعْدُ منَ postea ; et منَ قبْلُ tequam .

## Vocandi .

أَ propinquum vocat , de quo supra ; أَ mediocriter distans ; أَيَا et هَيْيَا remotum ; يَا omnia : et sequente articulo , أَيَا أَيْهَا et faem. يَا أَيْهَا أَيْهَا et faem. o يَا أَيْهَا أَيْهَا .

## Demonstrandi .

هَانَدَا ، هَانَدَا ، هَاهُوْذَا ، هُوْذَا ، هَا ، إِذَا ، أَذْهَبْتُ ، ecce .

## Interrogandi .

أَفْلَمْ ، أَلْمَ ، أَوْلَمْ ، أَفَكَ ، أَلَا ، أَمَا ؟ رُبْ ، هَلْ ، أَ ، أَوْلَمْ ، an non ?

## Affirmandi .

أَمْيَنْ ، أَنْ ، أَجْلَ ، جَيْرِ ، بَلْيَ ، نَعْمَ ، إِيْ amen .

## Negandi .

لَا non et ne prohib. كَلَّا nequaquam , minime gentium . لَيْسَ non ( sed hoc ultimum modo praeteriti quoque coniugatur , venitque pro verbo substantivo negante : ut لَيْسَ non est , لَسْتُمْ non estis , etc. ) أَنْ idem , sed non nisi sequente لَا nisi ; لَمَا idem , et nondum ; لَنْ nequaquam .

## Alia .

لِمَ quomodo , كَيْفَمَا quomodocunque , أَذْى , كَيْفَ quare , فَقَطْ solum , semper postponitur , أَنْما solummodo , tan-tum : لَعَلْ utinam , o utinam : يَا لَيْسَ fortasse : رُبْ idem , et interdum ; sed regit genitivum , seu nominativo dat

genitivi terminationem: أَنْ *age*: أَذَا *idem*, et *utique*: كُلَّا  
· *sicuti*: كَمَا *ac si*: كُلَّمَا *quotiescunque*.

### Reliqua.

Reliqua adverbia fere exprimuntur per accusativos nominum: ut حُسْنًا *bene*, شَرًّا *male*, حَكِيمًا *sapienter*, كَثِيرًا *multum*, جَدًّا *vehementer*, مَعًا *simul*, خَارِجًا *foris*, بَعِيدًا *emimus*, أَوْلًا *primum*, أَمْسًا *heri*, غَدًّا *cras*; et cum articulo, الْيَوْمُ *hodie*, الْآنُ *nunc*. Vel per genitivum cum praepositione: ut إِلَى الْآنِ *desuper*, إِلَى دَاخِلٍ *intro*, مِنْ فَوْقِ *hactenus*, مِنْ الْآنِ *posthac*, etc.

### Coniunctiones.

Copulativa, sub quibus et disiunctiva et adversativa continentur: ثُمَّ *et*, *deinde*; أَوْ *vel*, *aut*; أَمْ *an*, *vel*, بَلْ *لَكِنْ*, *لَكِنْ sed*: لَا *non autem*.

### Causales.

أَنْ *nam*, *etenim*, *utique*; أَنْ *et* *quod*; لَا *quia*; كَيْلَاد, لَيَاد, أَلَا: كَيْمَا, لَكِيْمَا, لَكِيْمَى, حَتَّى, أَنْ *ne*: idem لَيْئَنْ أَنْ *eo quod*, *si*, de praeterito; رِبِّيْمَا لَوْ *de futuro*, وَلَوْ *nisi*: هَلَّا *et* أَلَا, لَوْ لَا *etsi*, *quamvis*, منْ ثُمَّ *propterea*.

### Compleтивae.

فَانْ, وَامَا, قَامَا, ائِمَا, انْ, امِّا, etc. *autem*.

## Praepositiones.

من *a*, *ab*, *ex*, *de*, et saepe pleonastice nomini apponiatur الى *ad*, *cum*: حتى *usque ad*, *donec*; *cum*, *in*, *super*, *de*, عن *a*, *de*: على *super*, *de*, لـنـى *ludn*, *لـدـنـى*, *لـدـنـى apud*; من *ludn*, *لـدـنـى*, *لـدـنـى*, *لـدـنـى*, *apud*; من *inde a*, de tempore, حـاـشـاـ *inde*, خـلاـ *inde*, *praeter*. Quae omnia admittunt affixa, *praeter* من *حتـى*, من *مـنـى* et من *مـنـى*.

Reliquae autem praepositiones, exprimuntur per nomina substantiva adverbialiter posita, id est, in casu accusativo, sed abiiciente *nun* vocale ob regimen: ut فوق *supra*, تحت *infra*, قبل *ante*, قـدـام *coram*, مع *cum*; et دون *praeter*, et *infra* de numero, et non autem subintellecta simul praepositione, si qua praecessit, عبر *trans*, بـدـل *post*, بـيـن *inter*, خـلـف *versus*; et si quae similia: quo pertinent غير *سوـى*, سـوـى *superne*, من دون *praeter*, من اجل *propter*, لـأـجـلـ *idem*, etc.

## Interjectiones.

Has docebit facile usus, وـيـلـ *vici* autem *vae* nomen est; et cum articulo الـوـيـلـ *vici* dicitur: regitque genitivum cum *J*.

## Appendix.

كَمْ ac كَائِنْ quot , et كُلُّ tot , nomina quidem videntur potius esse quam particulae : sed tamen particularum more immutabilia sunt, quod et nominibus, sonitus animaliumque voces significantibus, et paucis etiam aliis praeteriti aut imperativi valorem obtinentibus contingit : ut فَاقِ  
crocitatio : هَاتِ da , offer ; نَزَالِ descendere .

Finis libri quarti.

THOMAE ERPENII

## GRAMMATICA ARABICA

LIBER QUINTUS

DE SYNTAXI.

## CAPUT PRIMUM.

De syntax nominum.

**C**oncordia substantivi cum adiectivo, relativi cum antecedente, ac nominativi cum verbo eadem hic quae in aliis linguis. Solum observandum est.

1. Plurale inhumanum ( sic voco quod non significat homines ) eleganter construi modo singularis faeminini : ut جَنَّاتٌ تَبَحْرِي مِنْ تَحْتَهَا الْأَنْهَارُ horti sub quibus currunt fluvii : ubi singularia faeminina هَا et تَبَحْرِي construuntur cum جَنَّاتٌ et أَنْهَارٌ pluralibus inhumanis .

2. Plurali humano eleganter quoque praeponi verbum singulare , eodem fere genere in praeterito , sed non raro discrepante in futuro : ut قَالَ النَّاسُ dixerunt homines , يَقُولُ قَالُوا و يَقُولُونَ dicunt sapientes , si verbum postponatur , omnia sunt regularia : ut أَلْنَاسُ قَالُوا و يَقُولُونَ homines dixerunt et dicent .

Idem de duali habendum .

3. Adiectivum appositum vocativo vel nomini affecto a vobula لِ cum substantivo suo , interdum non convenire casu .

Caeterum adiectivum et substantivum eandem partem enuntiationis constituentia hic etiam in restrictione et absentia eius

conveniunt, id est, si utrumque pertinet ad subiectum, aut ad praedicatum, ac unum restrictum est, necesse est etiam alterum restringi: ut **الكتاب العظيم** et **كتاب عظيم** liber magnus **أبي المكرم** أرسل إلى **إبراهيم الأمين**, **Abraham fidelis**, **هذا الرسالة** *pater meus reverendus misit ad me hanc epistolam*. Si vero non constituant illa eandem partem enuntiationis, id non obtinet: ut **الله قادر** *Deus est potens*, **هذا كتاب الصغير** *hic est liber*.

At substantivum appellativum cum adiuncto adiectivo nomen proprium constituens articulum abiicit: ut **باب المقدس** *porta sanctificata*, id est, **باب الصغير**; **porte parva**, nomen portae damascenae.

Substantivum cum substantivo genitivo casu iungitur: ut **يد الإنسان** *manus hominis*; **ابن مريم** *filius Mariae*. Sic quoque **كأس ذهب** *cyathus auri*, id est, *aureus*. Item **كل انسان** *universitas hominis*, id est, *omnis homo*, vel *omnes homines*, nam **كل** est substantivum.

#### Exceptio.

Sed nomen mensurae et ponderis regit mensuratum et ponderatum in accusativo: ut **قubit شعير** *modius*, vel potius **hemimedinus hordei**; **وطلل زيتنا** *libra olivarum*.

#### Observatio I.

Quaedam substantiva assumpto affixo cum praecedente substantivo congruente adiectiva quodammodo fiunt, et constru-

ctionem eorum imitantur : ut نفسُ *anima*, cum affixo alii substantivo appositum valet idem quod *ipse*, *ipsa*, *ipsum*; et كلٌ *universitas*, idem quod *totus*, *tota*, *totum* : conveniuntque cum praecedente substantivo, ut حَبِيبٌ نَفْسٌ *amicus* *ipse*, quasi dicas, *amicus anima eius*, حَبِيباً نَفْسَهُ *amicum ipsum*, خَبْزٌ كُلٌّ *panis totus*, خَبْزٌ كُلَّهُ *panis totius*, etc.

## Observatio II.

Numeri cardinales ratione regiminis substantiva sunt, unde a tribus ad decem, et qui supra 99. sunt, regunt numeratum in genitivo, more reliquorum substantivorum; sed minor denario plurale cupit, centenarius et maior eo, singulare: مَائَةُ *أَرْبَعَةُ رِجَالٍ*; tres *puellae*; ثَلَاثٌ جَارِيَاتٍ ut ألفٌ دينارٌ; *mille denarii*, reliqui a decem ad centum, ut substantiva ponderis et mensurae, regunt numeratum in accusat. singulari: خَمْسَةٌ عَشَرْ دِرْهَمًا *quindecim drachmae*, عَشْرُونَ ذِيَّبًا *viginti lupi*, etc. quam constructio- nem sequuntur, كَمْ دِرْهَمًا : ut كَذَا كَأَيْنَ, كَمْ quot drachmae ? كَأَيْنَ رَجُلٌ quot viri ? quae cum praepositione regunt genitivum: ut كَمْ مِنْ quot drachmis ? كَأَيْنَ مِنْ رَجُلٌ quot viri ? at ratione convenientiae adiectiva sunt, et masculina masculinis, faemina faeminiis, communia utrisque apponuntur, ut patet in exemplis allatis. Interdum etiam substantivis postponuntur more reliquorum adiectivorum.

## De syntaxi verborum.

**V**erba substantiva et nuncupandi, ut كَانَ fuit صَارَ, factus est ليسْ non est, مَا دَامَ quamdiu fuit vel mansit, et alia similia, quae esse vel fieri significant aut includunt, quaeque apud Latinos ante et post se nominativum adsciscunt, hic pro secundo nominativo, qui scilicet exprimit praedicatum, assumunt accusativum: ut كَانَ قَدِيرًا Deus est potens; زَيْدٌ صَارَ غَنِيًّا Zaydus factus est dives; أَبْنَةُ يَسْمَى مُحَمَّدًا filius eius vocatur Mohammad, etc. quod et interdum accedit omissio illo verbo substantivo; cum subiectum habet ante se مَا vel لَا non.

Verba activa pleraque accusativum regunt: plurima genitivum, mediante praepositione بِ, عَلَى, بِ, عَنْ, مِنْ فِي, مِنْ فِي, عَلَى, عَنْ, بِ, مِنْ : إِلَى quod usu discendum, et ex dictionarii.

Verba quaedam usque adeo tenacia sunt praepositionum, ut eas etiam non sequente nomine exigant; ut لَا أَقْبِرُ عَلَى أَنْ أُقُولُ non possum super ut dicam, id est, nequeo dicere.

Instrumentum per genit. praefixo بِ effertur. Motus ad rem, cum عَنْ et إِلَى et في. Sed nota, verba veniendi etiam per ellipsis praepositionis إِلَى cum accusativo eleganter construi: ut جَاءَنِي venit ad me, أَتَيْتُكَ veni ad te; pro جَاءَ إِلَيْكَ.

Ad quando et quamdiu respondetur per accusativum; ad quanto tempore, per genitivum, praemisso في.

Gerundium in do, seu participium quomodo res geratur

explicans , per accus. participii activi effertur : ut جاء راكباً explicans , per accus. participii activi effertur : ut جاء راكباً  
 venit equitans , seu equitando , يأكل واقفاً edit stans , صرخ  
 نائماً vociferatur dormiens .

Gerundium in *dum* , vel , ut verbo dicam , *finis* , per accus. nominis verbalis exprimitur : ut ضربته تأدبياً verberavi eum ad erudiendum , id est , ut erudirem eum .

Quod Latini ponunt post *quoad* vel *ratione* , *respectu* , id per nudum acc. hic effertur : ut طالب اسْهَاقَ نَفْسًا bonus est Isaac quoad animam ; لا مات يسوع الألهية بل مات ناسوتاً non mortuus est Jesus ratione naturae divinae , sed mortuus est ratione naturae humanae .

Infinitivus verbo suo , aut alii eiusdem notionis significacionis augendae causa appositus , est casus accusativi ; ut ضربته verberavi eum verberando ; قمت وقوتاً ضربت steti stando .

Atque in his omnibus accusativi terminatio adverbiale significacionem nomini videtur inducere .

Pro infinitivo autem nostro adhibetur verbale : ut أريد cupio verberationem , id est , verberare , vel cum praepos. لا أقدر على الضرر non possum verberare : aut futurum praeposito ، ut أريد أن اسمع cupio audire .


Sed verba notitiae et opinionis eleganter adsciscunt dupl. cem accusativum : ut ظننت أباك غنياً opinor patrem tuum esse divitem , scio Zaydum avarum esse .

De syntaxi particularum.

**C**oniunctiones copulativaes similes casus coniungunt: secus tamen interdum accidit, cum nomen praecedens est vocativus; aut nominativus cum accusativi terminacione: qua de re alias.

١١١ خَرَجَ غَيْرَ زَيْدٍ non est egressus nisi Zaidus ; et in negatione ،  
 ١١٢ مَا خَرَجَ انسَانٌ مَا ضَرَبَتْ غَيْرَ زَيْدٍ non verberavi nisi Zaidum ,  
 ١١٣ غَيْرَ زَيْدٍ non est egressus quisquam praeter Zai-  
 dum , etc. Observa autem per hanc voculam غَيْرَ solere expri-  
 mi nostra composita per *in* : ut غَيْرُ مُكَمِّلٍ imperfectus ، غَيْرُ مُكَمِّلةٍ imperfecta .

FINIS.



## FABULAE LOCMANI SAPIENTIS.

### \* أَسْدٌ وَثُورَانٌ \*

مَرَّةٌ خَرَجَ عَلَى ثُورَيْنِ فَاجْتَمَعَا جَمِيعًا وَكَانَا يَنْطَهِيَا  
بِفُرُونِهِمَا وَلَا يُمْكِنُهُمَا مِنَ الدُّخُولِ بَيْنَهُمَا فَانْفَرَدَ  
بِأَحْدَهُمَا وَيَخْدُعُهُمَا وَأَوْعِدُهُمَا إِلَّا يَعْرِضُهُمَا وَإِنْ يَتَخَلَّ أَحْدَهُمَا  
عَنْ صَاحِبِهِ . فَتَخَلَّ أَحْدَهُمَا وَافْتَرَسُهُمَا جَمِيعًا \*

\* هَذَا مَعْنَاهُ \*

أَنْ مَدِينَتَيْنِ إِذَا اتَّقَقَ عَلَى رَأْيٍ وَاحِدٍ أَهْلُهُمَا قَاتَهُ لَا تُمْكِنُ  
مِنْهُمَا عِدَوَاتٍ . فَإِذَا افْتَرَقَا هَلَكَا جَمِيعًا \*

### LEO ET DUO TAURI.

**L**eо aliquando egressus est contra duos tauros , qui simul congregati cornibus suis feriebant , ita ut ingredi inter eos non posset : unde desit eos invadere et petere , promisitque eis se non adversaturum eis , etiamsi recederet alter a socio suo . Recessitque alter : atque ille simul dilaceravit utrumque .

Significat hoc ,

Duabus civitatibus , cum cives earum consilio conveniunt , praevalere non posse inimicitias ; at discordes si sint , simul eas perire .

## Notae.

*Aliquando.* Arabice *semeḥ*, *una vice*: ut nos dicimus *una volta*, une fois.

*Petere.* Verbum خدع non solum *fallere* significat; sed etiam *insistere*, *rei alicui incumbere et operam dare*, quae notio huius loci esse videtur. \* Malim legere فـانـقـوـد seorsim recessit *abstititque*, et eos *petere coepit fraude*. ويأخذ يخدعهما

## \* غزال

أَيْلُ يُعْنِي غَرَالْ مَرَّةً عَطَشَ فَاتَى إِلَى عَيْنِ مَا يَشَرِبُ . فَنَظَرَ خَيَالَهُ فِي الْمَاءِ فَحَسِنَ لَدْقَةً قَوَابِيْهِ وَسَرَّ وَابْتَهَجَ لِعَظِيمِ قُرُونِهِ وَكَبِرَهَا وَفِي الْحَالِ خَرَجَ عَلَيْهِ الصَّيَادُونَ فَانهَزَمُوا مِنْهُمْ . فَامَّا هُوَ فِي السَّهْلِ فَلَمْ يَدِرِكُوهُ فَلَمَّا دَخَلَ فِي الْجَبَلِ وَعَبَرَ بَيْنَ الشَّجَرِ فَلَمْ يَحْقُّوهُ الصَّيَادُونَ وَقَتَلُوهُ ، فَقَالَ عَنْدَ مَوْتِهِ التَّوْيِلُ لِإِنَّا الْمَسْكِينُ الَّذِي أَزْدَرْتُ فِيهِ هُوَ خَلْصَنِي . وَالَّذِي رَجُوتُهُ أَهْلَكَنِي \*

## CERVUS.

**C**ervus cum aliquando sitiret, ad aquae venit fontem ut biberet, vidiisque imaginem sui in aqua, ac tristatus est ob pedum suorum gracilitatem. Gavisus vero est et superbivit cornuum magnitudine et excellentia. Ac statim egressi contra eum sunt venatores, a quibus fugit: cum autem in planicie esset, non assequunti sunt eum: at cum montem deinde ingressus esset, et inter arbores transiret, ceperunt eum venatores, atque occiderunt. Dixitque moriturus: vae mihi miserō, quod me servavit, id vilipendi, in eo confisus sum quod me perdidit.

## Notae.

*Cervus.* Textus habet, *ajul*, (potius *ijjel* et *ojjel*) id

est, *cervus*. Explicatur vox obscurior, et apud Hebraeos quam Arabes usitatorier ايل per notiorem غزال: sic fabella XIII. *bauda*, id est, *culex*.

*Ut biberet*. ل, id est, *ut*, hic et frequenter alibi in hac constructione omittitur.

### غَزَالٌ

غَزَالٌ مَرَّةً مُرِضٌ فَكَانَ أَصْحَابَهُ مِنَ الْوَحُوشِ يَأْتِي إِلَيْهِ وَيَبُودُهُ  
وَيَرْعَى مَا حَوْلَهُ مِنَ الْحَشَيشِ وَالْعَشْبِ. فَلَمَّا فَاقَ مِنْ مَرْضِهِ  
الشَّمْسُ شَيْئًا لَيَأْكُلُهُ فَلَمْ يَجِدْ. فَهَلْكَ جَوْعًا \*

### هَذَا مَعْنَاهُ

\* منْ كَثُرَ أَهْلَهُ كَثُرَتْ أَحْزَانُهُ \*

### C E R V U S .

**C**ervus aliquando cum aegrotaret, ad eum venerunt socii eius de feris, et custodiverunt eum, graminaque et herbas quae circum eum erant absumpsérunt: is autem cum convalescisset, quaesivit quod ederet, nec invenit quicquam; unde periit fame.

Hoc significat,

Multiplicari dolores eius, cuius familia multiplicatur.

Notac.

*Convalescisset*. Arabice est: *cum a morbo suo surrexisset*. Qui modus loquendi et Belgis est familiaris.

### أَسْدٌ وَتَعْلِبٌ

أَسْدٌ مَرَّةً أَشَدَّ عَلَيْهِ حَرَّ الشَّمْسِ فَخَلَّ إِلَيْهِ بَعْضُ الْمَغَايرِ  
فَنَظَلَّ بِهَا فَلَمَّا رَبِضَ أَتَى إِلَيْهِ جِرْدُونَ يَمْشِي عَلَى طَهْرَةٍ فَوَنَبَ

فَإِيمًا فَنَظَرَ يَمِينًا وَيُسَارًا وَهُوَ خَابِقٌ مَرْعُوبٌ . فَنَظَرَ الشَّعْلُ  
فَتَضَحَّكَ عَلَيْهِ فَقَالَ لَهُ الْأَسَدُ لَيْسَ مِنَ الْجِرَادُونِ خَوْفٌ إِنَّمَا  
أَكْبَرُ عَلَى احْتِقَارٍ \*

\* هَذَا مَعْنَاهُ \*

\* أَنَّ الْهُوَانَ عَلَى الْعَاقِلِ أَشَدُ مِنَ الْمَوْتِ \*

## LEO ET VULPES.

**L**eо aliquando cum molestus ei esset calor solis , ingressus est speluncam quandam , umbram in ea captans . Postquam autem procubuit , venit ad eum stellio , ambulans super dorso eius : unde subsiliit surgendo , et prospexit dextrorum , ac sinistrorum , timens et perterritus : veditque eum et irrisit vulpes : cui dixit leo : non metuo a stellione , sed graviter fero contemni me .

Hoc significat ,

Despectionem sapienti ipsa morte graviorem esse .

Notae .

*In speluncam quandam .* Arabice *in quandam speluncarum* . Observent autem studiosi , vocem بعض ، quae collective passim accipitur , et *quosdam , nonnullos , partem* significat , etiam singulariter interdum sumi pro احدى et واحد ، sine ulla tamen generis respectu ; ut hic et locis aliquot aliis in hoc opusculo .

\* *graviter fero* : seu *indignor* . Est autem proprie dicere , dicere ، الله اكبر *Allaho Acbar* : quam formulam in *precatione sacra* usurpare solent ; nec non extra Dei cultum , in percussi animi admiratione , indignatione , et metu .

\* أَسَدٌ وَثُورٌ \*

\* أَسَدٌ مَرَّةً أَرَادَ يَقْتَرِسُ ثُورًا قَلْمَنْ يَجْسِرُ عَلَيْهِ لَشَدَّتَهُ فَمَضَى إِلَيْهِ

لِيَحْتَالُ عَلَيْهِ قَائِدًا اعْلَمْ . أَنْتَيْ قَدْ ذَبَحْتُ خَرُوقًا سَمِينًا أَشْتَهَى  
 أَنْ تَأْكُلَ عَنْدِي فِي هَذِهِ اللَّيْلَةِ خُبْزًا . فَاجْبَاهُ إِلَى ذَلِكَ . فَلَمَّا وَصَلَ  
 إِلَى الْمَوْضِعَ وَنَظَرَ إِذَا قَدْ اسْتَعْدَدَ الْأَسْدُ حَطْبًا كَثِيرًا وَخَلَقِينَ  
 مُكْبَارًا فَوْلَى النَّوْرَ هَارِبًا . فَلَمَّا عَانَ ذَلِكَ فَقَالَ لَهُ الْأَسْدُ ، لِمَاذا وَلَيْتَ  
 بَعْدَ مُجْهِيْكَ إِلَى هَافِئَنَا . قَالَ لَهُ النَّوْرُ لَأَنِّي عَلِمْتُ أَنَّ هَذَا  
 اسْتَعْدَادُ لِمَا هُوَ أَكْبَرُ مِنَ الْمُخْرُوفِ \*

\* \* \* هَذَا مَعْنَاهُ \*

أَنَّ مَا سَبِيلُ الْعَاقِلِ أَنْ يُصْدِقُ عَدُوَّهُ وَلَا يَأْتِي إِلَيْهِ \*

## LEO ET TAURUS.

**L**eо aliquando cum vellet dilacerare taurum , nihil contra eum est ausus , ob robur eius ; abiitque ut deciperet eum , dicens : scito me agnum pinguem mactavisse : cupio ut hac nocte cibum apud me sumas . Quod is facturum se promisit . Ut autem ad locum pervenit , eumque vidit , ecce , praeparaverat leo ligna multa , et ollas magnas : abiitque taurus fugiens : quod ut vidit leo , dixit ei ; cur abis postquam huc advenisti ? Respondit taurus . Quia scio hunc apparatum esse rei alicui maiori agno .

Hoc significat ,

Non oportere sapientem credere inimico suo , aut associari ( seu potius familiarem esse ) illi .

## Notae .

*Cibum* . Arabice est *panem* : sed *edere panem* Arabibus est *cibum sumere* .

*Promisit* . Arabice , *respondit ei ad hoc* , id est *annuit* , *non recusavit* . Phrasis elegans , et passim obvia .

*Ollas* . Arab. *quam ego vocem alibi non memini*

me legere, unde nec satis certo scio quid significet: sed suspicor id esse quod dixi. \* Utique singulare eius est خلقين chalkinon, nempe graec. χαλκηνον, ahenum.

Oportere. Arabice, non esse semitam sapientis.

Associetur. انس est socium esse, associari, unde inson, et انسى insan, et انسیون insanion, hominem significant, quod animal sit sociabile. \* Hic potius familiarem esse reddi posset.

اسد وتعلت الْأَسْدُ وَتَعْلَتْ  
 أَسْدٌ مَرَّةً شَانِحٌ وَضُعْفٌ وَلَمْ يَقْبِرْ عَلَى شَيْءٍ مِنَ الْوُحُوشِ فَسَارَادَ  
 أَنْ يَنْخَتَالَ لِنَفْسِهِ فِي الْمَعِيشَةِ فَتَمَارَضَ وَالْقَنْقَبَةُ فِي بَعْضِ الْمَعَايِرِ  
 وَكَانَ كُلَّمَا أَتَاهُ شَيْءٌ مِنَ الْوُحُوشِ لِيُوَدِّعُهُ أَفْتَرَسَ دَاخِلَ الْمَغَارَةِ  
 وَأَكَلَهُ . قَاتَى النَّعْلَى إِلَيْهِ فَوَقَّفَ عَلَى بَابِ الْمَغَارَةِ مُسْلِمًا عَلَيْهِ  
 فَأَيْدَاهُ . كَيْفَ حَالَكَ يَا سَيِّدَ الْوُحُوشِ فَقَالَ لِهِ الْأَسْدُ لِمَاذَا لَا  
 تَدْخُلُ بِيَا أَبَا الْحُسْنِ فَقَالَ لِهِ النَّعْلَى يَا سَيِّدُ قَدْ كُنْتُ عَوْلَتْ  
 عَلَى ذَلِكَ غَيْرَ أَنِّي أَرَا عِنْدَكَ آثَارَ أَقْدَامٍ كَثِيرَةٍ قَدْ دَخَلُوا وَلَا  
 أَرَا أَنْ خَرَجُ مِنْهُمْ وَلَا وَاحِدٌ \*

هذا معناه هَذَا مَعْنَاهُ

\* أَنَّ مَا سَبَبَلَ الْأَنْسَانُ أَنْ يَهْجُمَ عَلَى أَمْرٍ أَلَا حَتَّى يَمْبِرَهُ

### LEO ET VULPES.

Leo aliquando cum senuisset et debilis factus esset, nec praevaleret ulli ferarum, voluit sibi dolo acquirere victum, et morbum simulans, se in speluncam quandam abiecit. Accidit autem ut quotiescumque accederet ad eum ferarum ali-

qua ipsum custoditura , eam in specu dilaceraret , et devoraret . Venitque ad eum vulpes , et substitit ad ostium speluncae , ac salutavit eum , dicens : qualis est status tuus , o princeps ferarum ? Dixitque ei leo : quamobrem non ingrederis , o pater pulchri ? Respondit vulpes : considerem ego in hoc , domine , nisi viderem apud te vestigia multorum pedum , qui ingressi sunt , quorum ne unum quidem video egressum esse .

Hoc significat ,

Non oportere hominem rem aliquam aggredi , antequam probe eam perpenderit .

Notae .

\* **لِيُوَدِعَهُ** Hoc in Coni . II. notat *valediceret* , et in Coni . IV. *depositum relinqueret custodiendum* : quorum néutrūm hic quadrat . Itaque levi facta metathesi legendū puto , يَعْوِدَهُ , *visitaret aegrotantem* .

اب **لَوْ** *Pater bonitatis vel pulchritudinis* . Arabismus , in quo *venit pro* .

*Considerem ego in hoc* . id est , *crederem bonis verbis tuis , nisi , etc.* est enim تعویل *inniti , confidere* . \* *vel minime veritus eram id facere* .

الْأَسْدُ وَإِنْسَانٌ

الْأَسْدُ مَرَّةً وَجَدَ إِنْسَانًا عَلَى الْطَّرِيقِ فَجَعَلَ يَتَشَاجِرُانِ بِالْكَادِمِ  
عَلَى الْقُوَّةِ وَشَدَّةِ الْبَأْسِ فَالْأَسْدُ كَانَ يَطْبِيبُ فِي شَدَّتِهِ وَبِاسْتَهْنَانِ إِنْسَانٍ  
عَلَى حَائِطٍ صُورَةً رَجُلٍ وَهُوَ يَخْتَمِقُ الْأَسْدُ فَضَحِكَ إِنْسَانٌ فَقَالَ لَهُ  
الْأَسْدُ لَوْ كَانَ السَّبَاعُ مُصْوِرِينَ مِثْلَ بَنِي آدَمِ لَمْ كَانَ يَقْدِرُ إِنْسَانٍ  
يَخْتَمِقُ سَبْعَاً بَلْ كَانَ السَّبَعُ يَخْتَمِقُ إِنْسَانٌ \*

هَذَا مَعْنَاهُ

أَنَّ مَا يُزَكِّي إِنْسَانٌ بِشَهَادَةِ أَهْلِ بَيْنَهُ \*

## LEO ET HOMO.

**L**eo aliquando invenit hominem in via , coeperuntque velitari inter se sermone de virtute et roboris vehementia . Leo quidam suam laudabat virtutem et robur . At homo vidit in pariete figuram hominis strangulantis leonem , ac risit . Leo vero ei dixit : si leones pictores essent , ut filii hominis , non posset homo strangulare leonem ; sed leo strangularet hominem .

Hoc significat ,

Non iustificari quemquam testimonio domesticorum suorum.

## Notae .

*Coeperunt* . Verbum جعل hic et linea sequenti servile est , ut verbum كان : et sic passim alibi .

*Filiī hominis* , seu *filii Adami* , id est homines , phrasis est Arabibus etiam valde usitata .

## غزال واسد

غزال مرأة من خوفه من الصياديَن انهزم إلى مغاربة فدخل إليه الأسد فافترسه فقال في نفسه الويل لي أنا الشقى لأنى هربت من الناس ووقيعت في يد من هو أشد منهم بأسا \*

## هذا معناه

\* من يفتر من خوف يسبِر يقع في بلاد عظيم

## CERVUS ET LEO.

**C**ervus ( vel dorcas ) aliquando timens sibi a venatoribus fugit in antrum , ingressusque ad eum est leo , ac dilaceravit eum , dixitque secum ; vae mihi misero , qui ab hominibus fugi , et incidi in manum eius qui vehementior illis est labore .

Hoc significat ,

Eum , qui fugit prae timore parvo , incidere in infortunium magnum .

Notae .

*Secum . Arab. in anima sua , id est , apud se .*

*Manum . id est , potestatem : ut in aliis linguis .*

### غَزَالٌ وَّتَعْلِبٌ

غَزَالٌ مَرَّةً عَطَشَ فَجَاءَ إِلَيْهِ عَيْنَ مَا يُشَرِّبُ وَكَانَ الْمَاءُ فِي جُبٍ عَمِيقٍ ثُمَّ أَنَّهُ لَمَّا دَامَ عَلَى الظَّلْوَعِ لَمْ يَقْدِرْ فَنَظَرَ التَّعْلِبُ فَقَالَ لَهُ يَا أخِي أَسِينْ فِي فَعْلِكِ إِذْ لَمْ تُمِيزْ طَلْوَعَكَ قَبْلُ ذُرْولِكَ \*

### هَذَا مَعْنَاهُ

الَّذِي يَنْزُلُ إِلَى أَسْفَلِ الْبَحْرِ وَلَا يَعْرُفُ يَعْوُمُ حَتَّى إِلَى فَوْقِ وَجْهِهِ الْمَاءِ \*

### C E R V U S E T V U L P E S .

**C**ervus aliquando cum sitiret , venit ad fontem aquae , ut biberet : erat autem aqua in puteo profundo , unde cum ille deinde conaretur ascendere , non potuit . Viditque eum vulpes , et dixit ei : o frater mi , fecisti male quod non perpendaris ascensum tuum ante descensum tuum .

Hoc significat ,

Hominem , qui descendit in imum maris , neque scit natare , donec super facie eius sit aqua .

Notae .

*Fecisti male . Ad verbum , deliquisti in actione tua .*

\* Estque <sup>اسأ</sup> pro ساء : nam thema est , idem quod in coni. IV. scil. male fecit ; et opponitur <sup>احسن</sup> تپ.

*Significat hominem . id est , fabula est in hominem : et sic post aliquoties , cum videlicet accusativum non sequitur infinitivus .*

### أَرَانِبُ وَتَعَالِيٌ

النَّسُورُ مَرَةً وَقَعَتْ بَيْنَهُمْ وَبَيْنَ الْأَرَانِبِ حَرْبٌ فَمَضَوْا إِلَيْهَا الْأَرَانِبُ إِلَى التَّعَالَى يُسَوِّمُونَ مِنْهُمْ الْخَلْفَ وَالْمَعَاصِدَةَ عَلَى النَّسُورِ فَقَالُوا لَهُمْ لَوْلَا عَرَقْنَاكُمْ وَنَعْلَمُ لِمَنْ تُحَارِبُونَ لَفَعَلَنَا ذَلِكَ \* أَنْ سَبِيلُ الْإِنْسَانِ إِلَّا يُحَارِبُ لِمَنْ هُوَ أَشَدُ بَاسًا مِنْهُ \*

هَذَا مَعْنَاهُ

أَنْ سَبِيلُ الْإِنْسَانِ إِلَّا يُحَارِبُ لِمَنْ هُوَ أَشَدُ بَاسًا مِنْهُ \*

### L E P O R E S E T V U L P E S .

O rtum aliquando inter aquilas et lepores est bellum : abieruntque lepores ad vulpes , petentes ab iis contrarietatem et resistantiam contra aquilas . At dixerunt eis : nisi nossemus vos , et sciremus quibuscum bellum geritis , utique faceremus illud .

Hoc significat ,

Non decere hominem ut cum eo belligeret , qui plus ipso virtute pollet .

Notae .

\* الْخَلْفُ وَالْمَعَاصِدَةُ : malim legere hilfa , ut in foedus coirent opemque ferrent .

### أَرَنِبٌ وَلَبْوَةٌ

أَرَنِبٌ مَرَةً عَبَرَ عَلَى لَبْوَةٍ فَأَيَادُهُ أَنْتَجَ فِي كُلِّ سَنَةٍ أَوْلَادًا

كَثِيرِينَ وَأَنْتَ أَنْمَا تَلَدِينَ فِي كُلِّ عُمْرِكَ وَاحِدًا أَوْ أَتَيْنِينَ فَقَالَتْ  
لَهُ الْلَّبْوَةُ صَدَقْتُ غَيْرَ أَنْ وَانْ شَانَ وَاحِدًا فَهُوَ سَبْعَةٌ \*

هَذَا مَعْنَاهُ

أَنْ وَلَدًا وَاحِدًا مُبَارَكًا خَيْرٌ مِنْ أَوْلَادِ كَثِيرِينَ عَاجِزِينَ \*

### LEPUS ET LEAENA.

Lepus quidam aliquando adortus est (*vel proprie* prae-  
teriit, transiit iuxta *vel ad*) leaenam, dicens: pario ego sin-  
gulis annis complures filios (*seu foetus*); tu autem tota tua  
aetate solummodo unum aut duos. Dixit ei leaena: credo;  
sed ille, licet unus sit, septem valet.

Hoc significat,

Quod filius unus probus praestat pluribus ignavis.

### Notae.

*Septem valet.* Arab. *est septem.* \* Potius <sup>سبعة</sup> legen-  
dum, reddendumque, *est leaena*.

*Probus.* Proprie *benedictus*.

أمْرَةٌ وَدَجَاجَةٌ

امْرَأَةٌ كَانَ لَهَا دَجَاجَةٌ تَبِيعُ فِي كُلِّ يَوْمٍ بِيَضْنَةٍ فَضْنَةٌ فَقَالَتْ  
الْأَمْرَأَةُ فِي نَفْسِهَا أَنَّ أَنَا كَثُرْتُ عَلَفْهَا تَبِيعُ بِيَضْنَتِينِ فَلَمَّا كَثُرَ  
عَلَفْهَا انْسَقَتْ حُوَصْلَتْهَا فَمَاتَتْ \*

هَذَا مَعْنَاهُ

أَنْ نَسَاءً كَثِيرِينَ بِسَبَبِ رِيمٍ كَثِيرٍ يَهْلِكُونَ رَأْسَ مَالِهِمْ \*

Mulieri cuidam erat gallina singulis diebus ovum pariens argenteum. Dixitque mulier secum: si multiplicavero cibum eius, pariet ova bina. Ut autem cibus eius fuit auctus, rupta est ingluvies eius, et mortua est.

Hoc significat,

Multos homines quaestus multi causa perdere caput opum suarum.

Notae.

*Caput opum*, id est, quod Arabes uno verbo dicunt بضاعة ونور، id est, summa principalis quae faenori exponitur, *il capitale nostratisbus*.

بعوضة ونور

بعوضة يعني ناموسه وقفَت على قرني ثورٍ فظننت أنها تقتل علية فقالت له إن كنت قد تقتلْ عليك أعلمُ من حتى أطير عنك فقالَ آثارُ يا هذَا مَا شعرت لمن تزلت ولا أدرى لمن ضررتْ هذَا معناه

\* من يطلب أن يجعل له ذكرًا ومجده وهو ضعيفٌ حقيرٌ \*

CULEX ET TAURUS.

Culex, quae et bauda (arabice) dicitur, constitit super cornu tauri, ac arbitratus est se oneri ei esse, dixitque ei: si oneri tibi sum, dic id mihi; ut a te avolem. Respondit ei taurus: o tu, non animadverti in quem descenderis, neque scio cui noceas.

Hoc significat,

Hominem, qui quaerit sibi ponere famam et gloriam cum debilis sit et contemptibilis.

﴿ انسان والموت ﴾

انسان مرّة حمل جرزاً خطباً فشققت عليه فلما أعيى وضجر  
من حملها رمى بها عن كتفه ودعا على روحه بالموت فشخص  
له قايداً هوذا أنا لماذا دعوتك ف قال له الانسان دعوتوك لترفع  
هذا جرزاً الخطباً على كتفي \*

﴿ هذا معناه ﴾

أن العالم يأسراً يحب الحياة الدنيا وما يمل من الضعف  
والشقا

## HOMO ET MORS.

**H**omo aliquando ferebat fascem lignorum, qui gravabat eum: cumque lassus factus esset, taedioque afficeretur gestationis eius, abiecit eum ab humero suo, vocavitque ad se mortem; quae se coram eo stit, dicens: ecce me; cur me vocavisti? Respondit ei homo: vocavi te ut fascem hunc lignorum superimponeres humero meo.

Hoc significat,

Quod universus mundus vitam diligit mundanam, neque lassatur infirmitate, et miseria.

﴿ بستانى ﴾

بستانى يوماً كان ينقى البقل فقيل له لماذا البقل  
البرى بهى المنظر وهو غير مخدوم قال بستانى تربية أممه  
وهذا تربية امرأة أبيه

هذا معناه

أن تربى الأم لذلوك أفضـل من تربـي امرأة لأبِ \*

## HORTULANUS.

**H**ortulanus aliquando, cum herbas purgaret (a zizaniis), dictum ei fuit: cur herba silvestris aspectu est speciosa, cum non colatur? Respondit hortulanus: educat eam mater eius; at haec a noverca sua educatur.

Hoc significat,

Praestantiorem esse educationem matris, quam novercae.

Notae.

*Noverca*. ad verbum, *uxor patris*, phrasii hebraica: nam uno alioqui vocabulo *noverca* Arabibus dicitur رابة، \* sc. *Rab-baton*, faem. راب، quod proprie est *educator*.

إنسان وصنم

إنسان كان له صنم في بيته يعبدة وكان يذبح له في كل يوم ذبيحة فافنى جميع ما يملكته على ذلك الصنم فشخص له قابلا لا تفه مالك على ثم تلومتني لله آخر \*

هذا معناه

من نفق ماله في الخطيبة ثم يختぬ ان الله افقره

## HOMO ET IDOLUM.

**E**rat homini cuidam idolum domi suae, quod colebat, et cui quotidie sacrificabat sacrificium, consumpsitque omne id quod possidebat propter idolum illud: quod se coram eo sistens, dixit: ne consume opes tuas propter me, et me deinde culpa apud Deum alium.

Hoc significat,

Eum, qui facultates suas erogat in peccato (*seu peccatum*), et deinde queritur (*causatur*) quod Deus ipsum pauperem fecerit.

إنسان أسود

إنسان مرة رأى وجاد أسود وهو واقف في الماء يسأله كم ف قال له يا أخي لا تتعكر الدهر فainك لا تستطيع البياض ولا تقدر

عليه أبد الدهر \*

هذا معناه

أن المطبع لا يغير طبعة \*

### HOMO NIGER.

Vidit quidam aliquando hominem nigrum, qui in aqua stabat sese lavans; dixitque ei: o frater mi, ne turba (*iniquina*) fluvium: non enim potes albescere, nec albitudinem acquirere in aeternum.

Hoc significat,

Quod a natura quid habens, non mutat naturam suam.

### Notae.

*Non enim potes.* Arabismum hunc latinus sermo non admittit: sic sonat ad verbum; *non potes albesceriam, neque valebis super ea in aeternitatem seculi;* \* et potius legendum الابيضان، Act. a conj. IX.

إنسان وفرس

إنسان كان يركب فرسا وكان حاملاً وفيما هو في بعض الطريق انتبهت إبنته فتبعد عنه غير بعيد ثم وقف وقال لصاحبه

يَا سَيِّدِي قُرْآنِي صَغِيرًا وَلَا أَسْتَطِيعُ الْمَشْيَ وَمَضِيَنِي وَتَرَكْتُنِي هَاهُنَا  
فَهَلْكَتْ وَانْ اَنْتَ اَخْذَنِي مَعْكَ وَرَبِّنِي إِلَى اَنْ اَقْوَى فَحَمِلْتُكَ  
عَلَى ظَهْرِي وَأَوْصَلْتُكَ سَرِيعًا إِلَى حَيْثُ تَشَاءُ \*  
هَذَا مَعْنَاهُ

\* اَنْهُ يُحِبُّ اَنْ يَشَدَّ الْمَعْرُوفَ لِأَهْلِهِ وَمَسْتَحْقِيقِهِ وَلَا يُطْرُحُهُ

## HOMO ET EQUULEUS.

**H**omo quidam vehebatur equa, quae gravida erat: cumque in via quadam esset, peperit filium, (pullum) qui sequentus est matrem suam non longe: deinde substitit, dixitque domino suo: o domine mi, vides me parvum esse, neque posse incedere; si itaque abieris et reliqueris me hic, peribo: at si acceperis me tecum, et educaveris me, donec robustus fiam, feram ego te super dorso meo, et perducam te celeriter, quoquaque voles.

Hoc significat,

Oportere, ut quod aequum ac iustum est iis reddatur qui eo sunt digni, illudque non abiiciunt.

## Notae.

**Equa.** Miror hic فرس faeminine usurpari; alioqui رامکون proprio *equam* significat. فرس est comm. gen. et pec. faem. licet pro eo quoque فرسة *feresaton* dicatur. رمکة autem, non رمک, est *equa vilioris generis*. Ca. in inscriptio pro *hinnulus*, quod aliae editiones habent, reposui *equuleus*; quanquam non proprio ipsa vox فرس, sed vox مهر *muhron*, *equuleum* notet.

**Gravida.** حامل in faeminino ponitur genere; ita ut عاقر *sterilis*, passim in alkorano.

**Via quadam.** ut supra *spelunca quadam*: vel, in partem aliquam viae; id est; cum aliquousque progressus esset.

*Et si abieris . Arabice abieris : per ellipsis voculae si : quae Turcis est usitatissima .*

*Res nobilis . معروف est notus , cognitus , item , iustus , aequus . Hic rem praestantia celebrem , et omnibus notam significat , quam et nos nobilem dicimus . \* Quin et hic المعروف fuerit id quod aequum et iustum est , τὸν καθηκόν ; contrarium τὸν μητρὸν almunkero : ita uti etiam Graecis usurpantur τὸν γνώμον et τὸν ἀγνώμον . يشد cordi et curae sit verti possit .*

### إنسان ومخزير

إنسان مرأة حمل على بهيمة كبشًا وعنزاً وخنزيراً وتوجه إلى المدينة ليبيع الجميع فالكبش والعنز فلم يكتُنوا يضربان على البهيمة وأما الخنزير فإنه كان يعرض دائمًا ولا يهدى فقال له الإنسان يا أشر الوجوه لماذا الكبش والنبيس مكتوت لا يضربان وانت لا تهدى ولا تستقر قال له الخنزير كل واحد يعلم نفسه أنا أعلم أن الكبش لصوفه والعنز يطلب للبهيمها وإنما الشقى لا صوف لي ولا لبن إنما عند وصولي إلى المدينة أرسل إلى المسلي لا محالة \*

### هذا معناه

أن الذين يعرفون في الخطايا والذنوب التي قدمت أيديهم يعلمون سو متقلبيهم مَاذا تكون آخرتهم \*

### HOMO ET PORCUS.

**H**omo aliquando portabat super iumento agnum , capram , et porcum , abiitque in civitatem , ut ea omnia venderet . Agnus autem et capra non percutiebant iumentum : at

porcus continue repugnabat , neque quiescebat : dixitque ei homo : o pessimum animalium , quare agnus et capra silent , nec percutiunt ; tu autem non quiescis , nec tranquillus es ? Dixit ei porcus : unusquisque novit se ipsum : ego scio quod agnus ob lanam , capra autem ob lac quaeratur . At ego miser , non est lana mihi , neque lac ; cum in urbem venero , mittar procul dubio in carnificinam .

Hoc significat ,

Eos , qui neverunt peccata et delicta , quae manus eorum commiserunt , agnoscere pravitatem conversationis suaे cum finis eorum instat .

#### Notae .

*Animalium* . تهدى proprio significat feras . \* وحش leg. iahdaو، Hamz. ult. vel يهدن iahdeno ، مسلخ est lanienia ، proprio locus ubi excoriatur quid ، aut exuitur .

\* من سوء تقليفهم . سوء lege , et verte ; qui noti sunt per delicta et peccata a se commissa , cognoscere ex pravitate conversationis suaے , quinam futurus sit finis suus .

سلحفاة وارنب

سلحفاة وارنب مرأة نسابقاً وجعلت الحد بينهما الجبل  
يسبقان اليه أما الارنب لأجل دلته وخفته وجريه توانى في  
الطريق ونام وأما السلحفاة فلعلتها تقل طبيعتها لم تكن  
تستقر ولا تتوانى في الجري فوصلت الى الجبل . عند ما استيقظ  
الارنب من نومه فوجد السلحفاة قد سقطت فندم حيث لا  
تنفع الندامة \*

هذا معناه

ان اذا كانا اثنان في حرب فكان الواحد ضعيفاً والآخر

فَوْيَا فَالضَّعِيفُ لَمْ يَنْمِ مِنْ خَوْفِهِ عَلَى نَفْسِهِ فَرِيمَا أَنَّ الضَّعِيفَ  
ظَفَرَ بِالْقُوَّى لِيَحْسِبَ تَوَانِيهِ وَيَعُودَ يَنْدَمُ حِينَ لَا تَنْفَعُهُ النَّدَامَةُ \*

## TESTUDO ET LEPUS.

**T**estudo et lepus certarunt aliquando uter alterum anteverteret, et posuerunt inter se terminum montem, ad quem certalim contendenter. Lepus autem ob subtilitatem, (gracitatem) levitatem, et velocitatem tardavit in via, et dormivit: sed testudo, quod nosset gravitatem naturae suae, non quievit, nec tardavit in cursu; venitque ad montem, cum expersiceretur lepus a somno suo: invenitque testudinem quae anteverterat eum. Paenituitque eum, ubi non prodesset paenitentia.

Hoc significat,

Quod cum duo sunt in certamine, quorum alter est debilis, alter fortis; debilis vero non dormit, quod timeat sibi saepe contingit, ut debilis fortem vincat, propter negligenciam huius, abeatque paenitens, ubi non prosit ei paenitentia.

## Notae.

\* دَلَّة . A دل , quod et per ضوى exponitur , *gracilis corpore fuit* : at pro illa voce forte دقَّة legendum .

\* جَرْبَة . وجربة . نجربة . *experientia* . Ideoq. legendum puto في جربة , vel cursum , vel *in cursu suo* .

\* *Invenit* . Vel ita trasferendum , qui comperit testudinem anteveruisse .

ذِيْبُ ذِيْبُ

ذِيْبُ مَرَّةً اخْتَطَفَ خَنَوْصًا صَغِيرًا وَفِيمَا هُوَ ذَاهِبٌ بِهِ لَقِيَهُ  
الْأَسَدُ فَلَاحَنَهُ مِنْهُ فَقَالَ الْذِيْبُ فِي نَفْسِهِ أَعْتَدْجِبُ كَيْفَ شِئْتُ  
أَغْتَصَبْتَهُ لَا يَتَبَيَّنُ مَعِي \*

هذا معناه

أَنْ مَا يُكْسِبُ مِنَ الظُّلْمِ لَا يُقْيِمُ مَعَ صَاحِبِهِ وَإِنْ هُوَ  
قَامٌ مَعَهُ فَلَا يَتَهَنَّ بِهِ

## LUPUS.

Lupus aliquando porcellum rapuit parvum, et auferenti illud occurrit leo, qui id ei eripuit: dixitque lupus apud se; miror ego quomodo res quam rapui non maneat mecum.

Hoc significat,

Id, quod per nefas acquiritur, non permanere cum domino suo: et, si maneat, illum non bearri eo.

Notae.

Auferenti illud. Ad verbum, *cum abiret cum eo*, vide Gram. p. 122. hic est pro يتهنى hamz. ultima.

العوسج

العوسج قال مرةً للبستانى لو أن لي من بهم بي وينصبى  
في وسط البستان وبسيقينى وبخدمتى لكانوا الملوك يشهوننى  
وبينظرون زهرى وثمرى فاختده ونصبه في وسط البستان في أجود  
الأرض وكان يسقيه في كل يوم دفتين فتشى وقوى شوكة  
وافرغته وأغضنته على جميع الشجر التي حوله فاملت عروقه في  
الأرض وامتداد البستان منه ومن كثرة شوكة ولم يكن أحد أن  
يستطيع أن ينقدم اليه \*

هذا معناه

من يخلو انسان سوء فانه كلما أكرمه كثرت شروره  
وتمد وكلما أحسنت إليه أساء الفعل معك \*

### RUBUS.

**R**ubus dixit aliquando hortulano : si mihi esset quispiam qui curam mei gereret , meque plantaret in medio horti , et irrigaret me , et coleret me ; utique reges desiderarent me , et aspicerent ( contemplarentur ) florem meum , et fructum meum . Unde accepit eum , plantavitque in medio horti , in optimo terrae , irrigavitque eum quotidie bis : ac invaluerunt spinae eius , et germina ac rami eius ; supra omnes arbores quae circum ipsum erant , et operuerunt folia eius terram , et impletus est hortus ab eo ac multitudine spinarum eius , neque potuit quisquam accedere ad eum .

Hoc significat ,

Eum , qui conversatur cum homine malo : hunc enim quotiescumque honoras , multiplicantur malitia eius , et rebellis est , et quotiescumque bene facis ei , male facit tibi .

### Notae .

\* *Rubus* . proprio *rhamnus* . At *rubus* عليه عوسج *olleikon* dicitur .

ونفرعت اغصانه *germina eius* . vel *lege* وافرغته واغصانه *et propagati sunt rami eius* .

فامثلت *et operuerunt folia eius terram* : *lege* فامثلت *feasolet* , *firmiterque fixae sunt radices eius in terra* .

أسود

أسود في يوم نزع ثيابه وأقبل يأخذ الثلوج ويعرف به جسمه  
فقبل له ماذا تعرف حسنه بالثلوج فقال لعلى أبيض فأتى

رَجُلٌ حَكِيمٌ قَالَ لَهُ يَا هَذَا لَا تُنْعَبْ نَفْسَكَ فَقَدْ يُمْكِنُ أَنْ  
جَسْمُكَ يُسْوِدَ الشَّلْجَ وَهُوَ لَا يُزِيلُ السَّوَادَ \*  
هَذَا مَعْنَاهُ \* \* \*  
أَنَّ الْشَّرِيرَ يَقْدِرُ أَنْ يُفْسِدَ الْخَيْرَ وَأَمَّا لَا يَقْدِرُ أَحَدٌ عَلَى  
إِصْلَاحِ الْشَّرِيرِ \*

## NIGER.

**N**iger die quodam exuit vestes suas , incepitque accipere nivem , eaque corpus suum fricare . Dictum autem ei fuit : quare fricas corpus tuum nive ? Ait ille , fortassis albescam . Venitque vir quidam sapiens , qui dixit ei : o tu ne afflige te ipsum : fieri enim potest , ut corpus tuum nigram faciat nivem ; ipsum autem non amittet nigredinem .

Hoc significat ,

Quod malus potest corrumpere bonum : sed nemo potest emendare malum .

## Notae .

O tu . Ad verbum , o hic . Graeci , φέρετος .

\* خَنَقَةٌ وَنَحْلَةٌ \*

خَنَقَةً مَرَّةً قَالَتْ لِنَحْلَةَ العَسْلَ لَوْ أَخْدَتْنِي مَعَكَ لَعَمِلْتُ  
عَسْلًا مِثْلَكَ وَأَكْثَرَ فَاجَابَتْهَا النَّحْلَةُ إِلَى ذَلِكَ . فَلَمَّا لَمْ يَقْدِرْ  
عَلَى مِثْلِ ذَلِكَ ضَرَبَهَا النَّحْلَةُ بِحَمَالَهَا فِيمَا هِيَ تَمُوتُ قَالَتْ فِي  
نَفْسِهَا لَقَدْ أَسْتَوْجَبْتُ مَا نَالَتِي مِنَ السَّوَاءِ وَلَا يُمْكِنُ لِي عَمَلُ  
الْزِفْرِ لِمَاذَا الْتَّمَسْ عَمَلَ الْعَسْلِ \*

هَذَا مَعْنَاهُ

أَنَّ نَاسًا كَثِيرًا يُحْطِّونَ أَنفُسَهُمْ بِأَشْيَاً كَثِيرَةً وَيَدْعُونَ  
أَنَّهُمْ بِهَا خَبِيرُونَ فَعَنْدَ مَا كَشَفُوا عَلَيْهَا قَوْلُهُمْ كَذَبٌ فَيُكَافِئُونَ  
عَلَى قَدْرِ فَعْلِهِمْ \*

## ARANEA ET APES.

**A**ranea aliquando dixit api melliferae: si me tecum sumeres, facerem ego mel sicut tu, et plus eo. Ascultavit ei apes. Cum autem non posset simile quid facere, ferriit eam apes aculeo suo: unde mortua est; dicens apud se: digna certe ego sum malo hoc, quod mihi evenit, cum non possum facere piccem, cur volui mel facere?

Hoc significat,

Homines multos immiscere se rebus multis, quarnm se existimant esse peritos, cumque eas aggrediuntur, sermo eorum est mendax, et accipiunt praemia digna opere suo.

## Notae.

\* خنفة . Vox Arabibus non cognita, quod sciām . Itaque vel خرزقة seu *chazarnakon* legendum est; vel خنفصة *chonfasaton*; at quod non *aranea* est, verum *scarabaeus*.

\* Ausculavit ei apes, id est, annuit hoc illi apes.

\* بحمالها Aculeo suo . Arabicum sonat, *impetu suo*, quare potius legendum fuerit بحماتي *bihomatihī*, a rad. حمو: quod *virus scorpionis*, etc. atque *aculeum* notat: nempe a *fervore*, qui pungendo infligi videtur.

\* كشفوا . Potius in pass. *cusiifou* efferendum, cum manifesti sunt res eas efficiendo: nisi quis priori servata lectio ne, in accus. ponat قولهم *kaulahum*, reddatque, cum iis rebus conscientis manifestant seu cognoscendum praebent sermonem suum: atque etiam كذب, in pass. coni. II. *cuddiba* rectius efferatur, *mendacii coarguitur*. potest et pro كشفوا

legi تَكْلِفُوا *cullifou vel id est, cum adiguntur ad eas res efficiendas.*

صَبَيْ

صَبَيْ مَرَةً رَّأَى نَفْسَهُ فِي نَهْرٍ مَّا وَلَمْ يَكُنْ يَعْرِفَ يَسْبِحُ  
فَأَشْرَفَ عَلَى الْغَرَقِ فَاسْتَعَانَ بِرَجُلٍ عَابِرٍ فِي الْطَّرِيقِ فَأَقْبَلَ إِلَيْهِ  
وَجَعَلَ يَلْوَمَهُ عَلَى نَزْوَلِهِ إِلَى النَّهَرِ فَقَالَ لَهُ الصَّبَيْ يَا هَذَا خَلْصَنِي  
أَوْلًا مِنَ الْمَوْتِ وَبَعْدَ ذَلِكَ لَوْمَنِي \*

هَذَا مَعْنَاهُ

إِنْ أَذَا وَقَعَ صَدِيقُكَ فِي شَدَّةٍ نَجِهْ وَخَلِصْهُ وَفِيمَا بَعْدَ لَوْمَهُ  
فَيَكُونُ أَحْسَنُ جَمِيلِ \*

P U E R .

Puer aliquando coniecit se in fluvium aquae , neque natare sciebat , parumque aberat quin suffocaretur , et opem imploravit viri cuiusdam in via transeuntis : qui accedens ad eum , coepit eum obiurgare , quod in fluvium descendisset . Dixit que ei puer : o tu , libera me primum a morte , et deinde reprehende me .

Hoc significat ,

Quod , cum amicus tuus incidit in calamitatem aliquam , liberare eum primum debes et salvare , deinde vero reprehendere : eritque longe melior .

Notac .

*Liberare debes , etc. Ad verbum , libera eum etc.*

*Longe melior . Arabice optimus honesti , seu decori ; vel neutraliter , optimum decori ; id est , longe convenientius .*

صَبِيٌّ وَعَرْبٌ  
 صَبِيٌّ فِي مَرْأَةٍ كَانَ يُصِيدُ الْجَرَادَ فَنَظَرَ عَرْبًا فَظَنَ أَنَّهَا  
 جَرَادَةٌ كَبِيرَةٌ فَمَدَ يَدَهُ لِيَأْخُذُهَا ثُمَّ تَبَعَّدَ عَنْهَا فَقَالَتْ لَهُ لَوْ  
 أَنْكَ قَبَضْتَنِي فِي يَدِكَ فَخَلَيْتَ عَنْ صَيْدِ الْجَرَادِ \*  
 هَذَا مَعْنَاهُ

أَنَّ سَبِيلَ الْأَنْسَانِ أَنْ يُمِيزَ الْخَيْرَ مِنَ الشَّرِّ وَيَدِيرَ لِكُلِّ  
 شَيْءٍ تَدْبِيرًا عَلَى حَدِيدَ \*

## PUER ET SCORPIO.

Puer aliquando venabatur locustas : vidiisque scorpionem , quem putavit locustam esse magnam : extenditque manum suam , ut eum caperet ; at deinde recessit ab eo : qui dixit illi : si prehendisses me manu tua , abstinuisses a venatione locustarum .

Hoc significat ,

Quod oportet hominem distinguere bonum a malo , et rem omnem tractare convenienter naturae suae .

## Notae .

\* Abstinuisses , etc. Vertendum potius , equidem desiüsses venari locutas .

Convenienter naturae suae . Ad verbum , secundum terminum , normam aut definitionem suam , \* aut pro حَدِيدَ non alium fuerit legere حَدِيدَ hidatin , a وَحْدَهِ , id est seorsim , separatis , vel singulari quodam modo .

## حمامَةٌ

حَمَامَةٌ مَرَّةٌ عَطَشَتْ فَاقْبَلَتْ نَحْوَهُ عَلَى حَابِطٍ فِي طَلْبِ آمَاءٍ  
 فَنَظَرَتْ عَلَى حَابِطٍ صَحْفَةٌ مَمْلُوَّةٌ مَاءً فَطَارَتْ بِسُرْعَةٍ وَضَرَبَتْ نَفْسَهَا

إلى تلك الصورة فانشققت حوصلتها فقالت التوبل لي أنا الشقيقة  
 لأنني أسرعت في طلب الماء وأهملت روحي \* هـ هذا معناه  
 أن التبدد والتلواني على الأشياء أخير من المبادرة  
 والمسارعة إليها \*

## COLUMBA.

Columba aliquando sitiens, coepit vagari (circumvolitare) circa parietem, quaerens aquam, vidi que in pariete scutellam aqua plenam, et volavit celeriter allisitque se ad illam picturam, (formam, rem extantem) ita ut ingluvies eius rumperetur. Dixitque; vae mihi miserae, quae festinavi in aquae petitione, et me ipsam perdidii.

Hoc significat,

Quod tarditas et mora in rebus praestat festinationi et celeritati.

## \* قُطْ \*

قط مرة دخل إلى دكان حداد فاصاب المبرد المرمي فاقبلا  
 يلحسه بلسانه ولسانه يسبيل منه الدم وهو يبلعه ويظن أنه  
 من المبرد إلى أن فنى لسانه ومات \*

هـ هذا معناه

من ينفق ماله بغير الواجب ثم لم يحسن حتى يقلس  
 وهو لا يعلم وأيضاً الخطية حلوة وصاحبها يتلذذ فيها وهو لا  
 يعلم أنها نقص في عمره وذلك من جملة البجهل الأكبر \*

## FELIS.

**F**elis aliquando ingressa est officinam fabri ferrarii, inventaque limam projectam, eamque coepit lingere lingua sua; ita ut a lingua eius manaret sanguis, quem ipsa deglutiens putavit a lima esse; donec lingua eius deficeret, et ipsa extingueretur.

Hoc significat,

Eum, qui erogat facultates suas sine necessitate, neque sese emendat, donec exhaustus sit, neque id animadvertisit. Est autem peccatum hoc dulce, et auctor eius delectatur eo, ignorans ipsum detrahere vitae sua, quae certe stultitia maxima est.

Notae.

*Exhaustus.* فليس est non habere pecuniam, non Arabibus tantum; sed et Belgis; nam et hi dicunt *blus zijn*, \* in coniug. quarta tantum, افلس, ea usurpatur significatione.

*Stultitia maxima.* Ad verbum, e summa maximae stultitiae (pro summa reputandum est stultitia.)

\* حَدَادٌ وَكُلْبٌ \*

حَدَادٌ كَانَ لِهِ كُلْبٌ وَكَانَ لَا يَرَالُ نَائِمًا مَا دَامَ الْحَدَادُ  
يَعْمَلُ شُغْلًا فَإِذَا رَفَعَ الْعَمَلَ وَجَلَسَ هُوَ وَاصْحَابُهُ لِيَأْكُلُوا  
خُبْزًا أَسْتَيقَطَ الْكُلْبُ فَقَالَ الْحَدَادُ يَا كُلْبَ السُّوءِ لَأَنِّي سَبَبَيْ  
صَوْتَ الْمَرْزِبَاتِ الَّذِي يُزَعِّزُ الْأَرْضَ لَا يُبِقِّظُكَ وَصَوْتَ الْمَضْغَ  
الْمَحْفَى إِذَا أَنْتَ سَمِعْتَهُ فَاسْتَيْقِظْنَ \*

\* هَذَا مَعْنَاهُ \*

أَنَّ الْأَنْسَانَ إِذَا سَمِعَ الصَّلَوةَ وَالْوَعْدَ يَنْامُ وَمَنْ يُسْمِعُ الْطَّبَلَ

وَالْزَمْرُ وَالْغَنَاءُ يَجْرِي خَلْفَهُ فَذَلِكَ مِنْ جُمْلَةِ الْجَهَلِ الْأَكْبَرِ .  
وَإِيْضًا مِنْ يَسْمَعُ مَا لَا يُصْلِحُ بِهِ شَانَهُ وَيَتَغَافِلُ عَمَّا فِيهِ مِنْ فَعَّةٍ \*

## FABER ET CANIS.

Fabro cuidam erat canis, qui non desinebat dormire quamdiu faber laborabat, cumque opus intermitteret et sederet ipse cum sociis suis, ut cibum sumerent, evigilabat canis. Unde dixit ei faber: o pessime canis, quam ob causam sonitus maleorum, qui terram concutit, non excitat te? sonum autem masticationis obscurum ecce audivisti et evigilasti.

Hoc significat,

Dormire hominem, cum audit precationem et institutionem; post eum autem currere, qui tympanum, cantum, et vanitatem profert: quae certe stultitia maxima est. Item eum, qui auscultat id quo non corrigitur indoles (status, conditio) eius; negligit vero id quod utile est.

## Notae.

*Profert* يسمع est audiri facit. \* زمر cum cantum omnem, tum proprie fistulae tibiaeque denotat.

\* *institutionem*. Verbum notat praedicere boni quid, etiam mali; promittere, et quoque minari. Itaque hic exhortationem, vel concionem sacram significet, quae proprie وعظ dicitur; quin ita potius hic legendum fuerit.

Item. Supple, significat haec fabula.

## كَلْبٌ وَتَعْلِبٌ

كَلْبٌ مَرَّةً أَصَابُوا جَلْدَ سَبْعَ فَاقْبَلُوا عَلَيْهِ فِينَهُ شَوْهَةٌ فَنَظَرُهُمْ التَّعْلِبُ فَقَالَ لَهُمْ أَمَّا لَوْا نَهْ كَانَ حَيَا لَرَأَيْتُمْ مَخَالِبِيَّةَ كَاحِدٍ مِنْ أَنْيَابِكُمْ وَاطَّوْلَ \*

هذا معناه \*

الذين يشتمون بقوم قد ماتوا ولا يقدرون البواب على

\* أنفسهم

## CANES ET VULPES.

**C**anes aliquando invenerunt pellem leonis , eamque arrodere coeperunt , quod videns vulpes , dixit eis : at si ille vivus esset , videretis unum ex dentibus vestris , et longiores .

Hoc significat ,

Eos , qui detrahunt ei qui iam vita excessit , et non potest se defendere .

كلب وارنب \* هذا معناه \*

كلب مرة طرد اربابا فلما ادركه فبعض عليه واقبل بعضه  
بانيا به فإذا الدم قد جرى لحسه بلسانه فقام الارنب اراك  
بعضني كاني عدوك ثم نيوستي شانك صديقى \*

هذا معناه \*

من يكتون في قلبها غش ودخل وبطهر اشقافاً ومحبة \*

## CANIS ET LEPUS.

**C**anis aliquando inseguutus est leporem , quem ut est assequutus , prehendit eum , et mordere coepit dentibus suis ; cumque sanguis emanaret , lambit eum lingua sua : dixitque lepus ; video te mordentem me , ac si ego hostis tuus essem ; deinde oscularis me , ac si tu amicus meus essem .

Hoc significat,

Eum, in cuius corde est dolus et fraus, ostenditque benevolentiam et amorem.

### البَطْنُ وَالرِّجَلُونِ

البَطْنُ وَالرِّجَلُونِ تَحَاصِمُوا فِيمَا بَيْنَهُمْ يَحْمِلُ الْجِسْمُ  
قَالَ الرِّجَلُونِ نَحْنُ بِقُوَّتِنَا نَحْمِلُ الْجِسْمَ قَالَ الْجَنُوفُ إِنْ  
أَنَا لَمْ أَغْدِ مِنَ الطَّعَامِ شَيْئًا فَإِذَا كُنْتُمَا تَسْتَطِيْعَانِ الْمَهْيَ قَضَيْ  
نَحْمِلُكُمْ شَيْئًا \*

هَذَا مَعْنَاهُ

مَنْ يَتَوَلَّ أَمْرًا فَإِنْ لَمْ يَعْضُدْهُ الَّذِي هُوَ أَرْفَعُ مِنْهُ وَأَشَدُ مِنْهُ  
فَمَا لَهُ قُدْرَةٌ عَلَى خَدْمَتِهِ وَلَا مَنْفَعَةٌ لِرُوحِهِ \*

### VENTER ET PEDES.

**V**enter et pedes contenderunt inter se quis ferret corpus. Dixerunt pedes: nos robore nostro ferimus corpus. At venter ait: si nihil ego cibo alerem; non possetis vos ire, nedum ferre quidquam.

Hoc significat,

Eum, qui negotium aliquod suscipit, nisi adiuvetur ab eo, qui ipso maior et potentior est, non posse perficere (obire) ministerium suum, et frustra esse.

Notae.

*Contenderunt inter se.* Arabice, contenderunt de eo quod inter se erat: pharsi usitata et eleganti.

\* *Agerem.* Legendum forte *اعد oiddo*, si ego non praeparem cibi quicquam.

*Frustra esse. Ad verbum, non esse utilitatem spiritui (seu animae) eius.*

### ﴿النَّمُوسُ وَالدَّجَاجُ﴾

يَلْعَ النَّمُوسُ أَنَّ الدَّجَاجَ قَدْ مَرَضُوا فَلَبِسُوا جَلْوَدَ الظَّاوِسِ  
وَأَتَوْا تَزُورُهُمْ فَقَالُوا لَهُمُ السَّلَامُ عَلَيْكُمْ إِيَّاهَا الدَّجَاجُ كَيْفَ  
أَنْتُمْ وَكَيْفَ أَحْوَالُكُمْ فَاجْأَبُوا مَا نَعْنَ مَا لَا يَعْلَمُ يَوْمَ لَا  
نَرِى وَجْهَكُمْ \*

﴿هَذَا مَعْنَاهُ﴾

مَنْ يُظْهِرُ الْمَحِبَّةَ رِبَّاً وَفِي قَلْبِهِ الدَّغْلُ \*

### FURONES ET GALLINAE.

**I**ntellexerunt furones aegrotare gallinas; indutaque pelle pavonis venerunt eas visitatum; dixeruntque iis: pax vobis sit o gallinae: quomodo valetis? Responderunt; bene nobis est, cum non videmus facies vestras.

Hoc significat,

Eum, qui per hypocrisin ostendit amorem, in corde autem suo ('gerit) dolum et odium.

### Notae.

*Furones.* نَمُوس plurale est, a singulari (nimson.) quod significat animal quoddam gallinis inimicum, in oriente frequens, auctori glossarii raphelengiani furo, quod mihi nomen visum fuit retinere. *Musta Ben Achmed* in lexico suo ait et دلق arabice vocari, et turcice سکسار; capiteque et ore canino esse, crine caprino, oculis fulvis, corpore caeruleo, (mustelino) etc. \* نَمُوس proprio *mustela* est *vulgaris*, quae alias metonymice ابن عَرِس ibin irsin dicitur.

*Quomodo valetis. Ad verbum, quomodo vos et status vestri.  
Bene nobis est. Arabice, nos in bono sumus.*

### الشمس والريح

الشمس والريح تخاصمان فيما بينهما من متنهما يقدر أن  
يُجرِّدَ الإنسان ثيابه فأشتدَّ الريح بالهيبوب وعصفه جداً فكان  
الإنسان إذا اشتَدَ هبوب الريح ضم ثيابه إليه والتَّفَ بها من  
كل جانب وارتفع النهر وأشتدَّ التَّحر فخلع الإنسان ثيابه  
وحملها على كتفه من شدة التَّحر \*

هذا معناه

من كان معه الاتضاع وحسن الخلق ينال من صاحبه  
ما يريد \*

### SOL ET VENTUS.

**S**ol et ventus contenderunt inter se, uter eorum posset ef-  
ficere ut homo exueret vestes suas. Intenditque se vehemen-  
ter ventus impetu et tempestate. Homo autem, cum inten-  
deretur vis venti, collegit ad se vestes suas, involvitque se  
iis ab omni latere. Cumque ortus esset dies, et intenderetur  
calor, exuit homo vestes suas, tulitque eas super humero suo  
prae vehementia caloris.

Hoc significat,

Eum, qui cum est humilitas et naturae bonitas, consequi  
a socio suo quod vult.

### Notae.

\* باليهيبوب Lege *Bilhuboubi*, uti et linea sequenti,  
*flatu, flando*: nam الهيبوب est formidulosus Act. et Pass.

\* عصفه . Lege عصفه *afflhi* , *vehementi spiratione sua* , vel عاصفة *asifatin* , *procella quadam ac tempestate* .

### ديكان

ديكان يقاتلkin في قارورة فغلب الواحد والآخر مرضى من وقتنه في بعض الأماكن فاما الذي على صعد فوق سطح عال وجعل يسفل بمحناهه وبصيح ويختبر فنظره يعطي التجواز فانقض عليه واختطفه لوقته \*

### هذا معناه

أن لا يجب للإنسان أن يفتخرا بقوته \*

### DUO GALLI.

Duobus gallis in vase pugnantibus alter vicit ; et alter illico in locum quendam secessit : at gallus , qui vicit , ascen- dit supra tectum altum , coepitque complodere alias suas , et clamare ac gloriari ; veditque eum vultur , qui celerrime in eum irruit , eumque statim rapuit .

Hoc significat ,

Quod non oportet hominem gloriari virtute sua et robo-  
ris vehementia .

Notae .

\* قارورة . Tantum *ampullam vitream* , aut *oculi pupillam* designat , quae hic locum non habent . Neque enim *in vel sub ampulla* pugnare possint gallinacei duo . Itaque reddendum potius foret , *ob ampullam* , scil . *pabulum ea contentum* , vel legendum قهقور *kakhourin* , quod *longiorem ex la-  
pidibus structuram notat* , quam parare pueri solent : ita uti tradit ea . forte an *sepimento similem* , *intra quod tale certamen fiebat* .

*Vultur.* Hoc certe animal puto significari duabus vocibus الْجَوَارِحُ بِعِظَمٍ quanquam de scriptura non nihil dubito , forte legendum من يعيّد *eminus* : ut solum جَوَارِحٌ sit animalis nomen . \* Cum vox الْجَوَارِحُ proprie quidem signet *vulnificas* , id est , *rapaces aves* , utique الْجَوَارِحُ quasi *clamosus accipiter* , (nam  $\pm$  initio non nunquam servit ) non inconvenienti metonymia *vulturem* denotarit , alias una voce حَدَاءُ *hidaon* appellatum ; quod vix alia eius generis avis voce magis strepera sit . Festo *iugere* *vultur* , alijs *lippire* dicitur ; unde forsitan recentioribus Graecis ipse ἄγριον vocatur .

### ذِيَابٌ

ذِيَابٌ أَصَابُوا جُلُودَ بَقَرٍ فِي جَوَرَةٍ مَاءٍ تَسْيِلُ وَلَيْسَ عَنْدَهُمْ  
أَحَدٌ فَانْتَقَدُوا عَلَى أَكْلِهِمْ جَمِيعٌ وَتَوَامَرُوا أَنْهُمْ يَشْرِبُونَ الْمَاءَ  
كُلَّهُ حَتَّى يَصْلُوْلُوا لِلْجَلْوِيدِ وَيَأْكُلُوهُمْ فَمَنْ كَثُرَ مَا شَرَبُوا  
أَنْفَلَقُوا أَكْلِهِمْ وَمَاتُوا وَلَمْ يَصْلُوْلُوا إِلَى الْجَلْوِيدِ \*

هَذَا مَعْنَاهُ

مَنْ هُوَ قَلِيلٌ الرَّأْيِ يَعْمَلُ مَا لَا يَجِدُ عَمَلَهُ \*

### L U P I .

**L**upi invenerunt pelles boum in fovea aquae fluentis , nec quisquam iis aderat , et unanimiter statuerunt eas edere , decreveruntque omnem aquam eibere , ut attingerent pelles , easque devorarent . Prae multitudine autem eius quod biberunt ( hausti potus ) , crepuit venter eorum , et mortui sunt , neque pervenerunt ad pelles .

Hoc significat ,

Eum , qui consilio non valet , facere id quod fieri non oportet .

## Notae.

*Crepuit venter eorum.* Arabice, *rupti sunt stomachum*, seu, *quoad stomachum*: puto enim الكل stomachum significare hoc loco. \* Verum id ab usu abhorret: quare vix dubito quin redundet, legendumque sit كلهم, *crepuerunt omnes*.

## الوز والخطاف

الوز والخطاف اشترکوا في المعیشة فكان مرعى الجميع في مكان واحد ورأيا توهّم الصيادين فاما الخطاف فالجل خفته طار وسلم وأما الوز فادرکه الصيادون فذهبوا \*

هذا معناه

من يعاشر من لا يشاكلا وليس هو ابن جنse \*

## ANSER ET HIRUNDO.

**A**nser et hirundo societatem inierunt vitae, erantque paucula utriusque in loco uno. Visis autem aliquando insidiis venatorum, hirundo propter levitatem suam avolavit, et evasit: at anserem ceperunt venatores, et occiderunt.

Hoc significat,

Eum, qui amicitiam init cum eo cum quo non convenit, nec qui eiusdem est generis.

## Notae.

*Utriusque.* Proprie, universitatis seu omnium: frequenter enim vox etiam de duobus usurpatur.

*Eiusdem generis.* Arabice, qui non est filius generis eius.

Finis Fabularum.

شِدَّةُ الْعَذَابِ مِنْ كَلَامِ الْعَرَبِ

SELECTAE QUAEDAM ARABUM SENTENTIAE.

١. بِالْعَمَلِ يُحَصَّلُ الْوَابِ لَا بِالْكَسْلِ \*

Opere acquiritur praemium, non segnitie.

\* ٢. حُبُ الدُّنْيَا يُقْسِدُ الْعُقْلَ وَيُضْعِفُ الْقَلْبَ عَنْ سِمَاعِ الْحِكْمَةِ

Amor mundi ingenium corrumptit, et cor reddit surdum, ne audiat sapientiam.

٣. الْكَسْلُ وَكَثْرَةُ النَّوْمِ يَبْعَدُانِ مِنْ اللَّهِ وَيُورِثُانِ الْفَقْرَ \*

Pigritia et multitudo somni abducunt a Deo et adducunt paupertatem.

٤. قَلْةُ الْأَكْلِ يَمْنَعُ كَثِيرًا مِنْ أَعْدَالِ الْجَسْمِ \*

Parum comedere corporis morbos arcet multos.

٥. قَلْبُ الْأَحْمَقِ فِي فِيهِ وَلِسَانُ الْعَاقِلِ فِي قَلْبِهِ \*

Cor stulti in eius ore, et lingua sapientis in corde eius est.

٦. كُنْ قَنْعًا تَكُنْ غَنِيًّا كُنْ مُهْوِكًا تَكُنْ قُوَي়ًا

Esto contentus, eris dives; esto confidens, potens eris.

٧. كَيْسٌ مِنْ عَادَةِ الْكِرَامِ تَاخِرُ الْأَنْعَامِ لَيْسَ مِنْ عَادَةِ الْأَشْرَافِ

تَعْجِيلُ الْأَنْتِقَامِ

Differre beneficia non est generosi hominis; neque hominis eminentis est accelerare vindictam.

٨. لَا تَسْتَصْغِرْ عَدُوًا وَإِنْ ضَعْفَ \*

Inimicum ne parvi aestimes, licet sit debilis.

٩. مَنْ رِضِيَ عَنْ نَعْمَةٍ كَثُرَ السَّاجِطُ عَلَيْهِ \*

Qui sibi placet , multos habet , qui indignantur ipsum .

١٠. الْصَّدِيقُ الْمَدْوُقُ مَنْ نَصَحَكَ فِي غَيْبِكَ وَأَرَكَ عَلَى \*

نَفْسَهُ

Amicus sincerus est qui te de vitiis tuis admonet , et te sibi praefert ipsi .

١١. أَيَّاكَ وَحْنَ الْدُّنْيَا فَانِهَا رَأْسٌ كُلُّ خَطْيَةٍ وَمَعْدُنٌ كُلُّ

بَلِيهٌ \*

Cave tibi ab amore mundi , est enim peccati omnis fons , et cuiuslibet aerumnae fodina ,

١٢. الْحَسْدُ دَاءٌ عَيَّاءٌ لَا يَزُولُ إِلَّا بِهَلْكَ الْخَيَاصِدِ أَوْ مَوْتٍ

الْمَحْسُودُ \*

Invidia est morbus incurabilis ; non cessat nisi cum extio invidi , aut morte eius , cui invidetur .

١٣. الْأَمْلُ كَالْسَّرَابِ يَغْرِي مَنْ رَاهُ وَيَخْلُفُ مَنْ رَجَاهُ

Spes est instar vaporis meridiani camporum , qui decipit intuentem , et fallit sperantem .

\* ١٤. تَذَكَّرَ يَمْتَحِنُ بِهِنْ عَقْلُ الرِّجَالِ الْمَهَلُ وَالْوِلَايَةُ وَالْمَصِيرَةُ

Tria sunt , quibus virorum ingenium tentatur , divitiae , imperium et fortuna adversa .

١٥. جَالِسٌ أَهْلُ الْعِلْمِ وَالْحِكْمَةِ وَأَكْثَرُ مُنَافِقَتِهِمْ فَإِنْكَ إِنْ

كُنْتَ جَاهِدًا عَلَمُوكَ وَإِنْ كُنْتَ عَالِمًا إِزْدَدَتْ عِلْمًا \*

Asside doctis et sapientibus , eorumque colloquia frequen-

tato; etenim si fueris insipiens, te docebunt; et si fueris doctus, augeberis scientia.

16. خمس يُستقبِّحُ في خمس كثرة الفجور في العلماء  
وآخرون في الحكماء والبعـلـ في الأغـيـاءـ والقـبـحـةـ في النـسـاءـ وفي  
المـشـائـجـ الزـنـاءـ \*

Quinque improbantur in quinque; multitudo improbitatis in doctis; cupiditas in sapientibus; avaritia in dicitibus; deformitas in mulieribus; et scortatio in senibus.

17. ذو الشرف لا تُبـطـرـهـ مـنـزـلـةـ نـالـهـاـ وـانـ عـظـمـتـ كـلـجـبـلـ الـذـىـ  
لـاـ تـزـعـزـعـ الـرـيـاحـ وـالـدـنـىـ تـبـطـرـهـ أـدـنـىـ مـنـزـلـةـ كـلـكـلـادـهـ الـذـىـ  
يـخـرـكـهـ مـرـ النـسـيمـ \*

Nobilem non facit insolentem dignitatis gradus, quem obtinet, etiamsi sit altus adinstar montis, quem venti non concutunt; vilem vero inferior gradus dignitatis insolentem facit, adinstar graminis, quam movet aura praeteriens.

18. زـيـنـ فـيـ اـصـطـنـاعـ الـمـعـوـرـ وـأـكـثـرـ مـنـ أـشـدـاءـ الـأـحـسـانـ فـائـةـ  
أـيـقـنـ ذـخـرـ وـأـجـمـلـ ذـخـرـ \*

Abundans esto in praestandis beneficiis, et multiplica largissime beneficentiam; est enim thesaurus certissimus, et recordatio iucundissima.

19. سـلـ عـنـ الرـفـيقـ قـبـلـ الـطـرـيقـ سـلـ عـنـ الـجـارـ قـبـلـ الدـارـ \*

Interroga de socio, priusquam viam (cum eo) ingrediaris, et de vicino, priusquam domum conducas.

20. شـرـ الـنـوـالـ مـاـ تـقـدـمـةـ الـمـطلـ وـتـعـقـبـةـ الـمـنـ \*

Pessimum donum, quod praecedit procrastinatio, et sequitur exprobratio.

\* 21. شَرُّ النَّاسِ مَنْ يُعِينُ عَلَى الْمُظْلُومِ وَيُنَصِّرُ الظُّلُومَ

Pessimus hominum, qui auxilium praestat contra oppressum, et iuvat opprimentem.

\* 22. شَيْءٌ لَا يُعْرَفُ فَضْلُهُمَا أَلَا مِنْ فَقْدِهِمَا الشَّبَابُ وَالْعَافِيَةُ

Duae sunt res, quarum praestantia non cognoscitur, nisi quum desiderantur, iuventus et sanitas.

\* 23. صُنْ اِيمَانَكَ مِنَ الشَّكِ فَإِنْ تَشَكَّ يُفْسِدُ الْاِيمَانَ

كَمَا يُفْسِدُ الْمِلْحُ الْعَسْلَ \*

Custodi fidem tuam a dubitatione; nam dubitatio corrumpit fidem, sicuti sal corrumpit mel.

\* 24. طَوْبَى لِمَنْ كَظِمَ غَيْظَهُ وَلَمْ يُطْلِقْهُ وَعَصَى اِمْرَةً نَفْسِهِ

وَلَمْ تُفْلِكْهُ \*

Beatus ille, qui iram suam reprimit, neque habenas ei committit, et qui imperio appetitus sui se opponit, nec ab ea perditur.

\* 25. لَا تُخْمِلْ عَلَى يَوْمِكَ هُمْ سَتْنَكَ كَفَاكَ كُلُّ يَوْمٍ مَا قُسِّدَ

لَكَ فِيهِ فَإِنْ تَكُنْ السَّنَةُ مِنْ عُمْرِكَ فَإِنَّ اللَّهَ سُبْحَانَهُ سَيَّاتِيكَ

فِي كُلِّ غَدِيرِ جَدِيدٍ بِمَا قُسِّمَ لَكَ فَإِنْ لَمْ تَكُنْ مِنْ عُمْرِكَ فَمَا

هُمْكَ بِمَا لَيْسَ لَكَ \*

Ne imponas diei tuo sollicitudinem anni totius; quolibet die sufficiat tibi, quod in eo tibi decretum est; si enim an-

nus ille sit ex vita tua ( i. e. si totum illum annum sis vi-  
cturus ), utique Deus O. M. quolibet crastino die recenti id  
tibi dabit , quod tibi destinatum est ; sin vero annus iste non  
sit ex vita tua , ecquid sollicitudo tua tunc erit de eo , quod  
tibi non est ?

26. قَالَ أَمِيرُ الْمُؤْمِنِينَ عَلَى بْنِ أَبِي طَالِبٍ كَرَمُ اللَّهِ وَجْهَهُ مِنْ  
عُرْفٍ بِأَذْكُرْتُمُ الْأَخْطَمَةَ الْعَيْنَوْنَ بِالْوَقَارِ \*

Dixit princeps fidelium , Ali , Abi Talebi filius , quem  
Deus summo honore afficiat ! Qui cognitus est sapientia , eum  
adspiciunt oculi cum reverentia .

27. قَالَ يَعْصُمُ الْحَكْمَاءُ تَحْتَاجُ الْقُلُوبُ إِلَى افْوَاتِهَا مِنَ الْحَكْمَةِ  
كَمَا تَحْتَاجُ الْأَجْسَامُ إِلَى افْوَاتِهَا مِنَ الظَّعَامِ \*

Sapiens quidam dixit : egent mentes ad corroborationem  
suam sapientia , quemadmodum corpora ad suam corrobor-  
ationem cibo .

28. قَالَ أَفَلَكُطُونُ أَحْكَمِمُ لَا تَطْلُبُ سُرْعَةَ الْعَمَلِ وَاطْلُبْ  
مُجْوِيدَهُ فَإِنَّ النَّاسَ لَا يَسْلِيُونَ فِي كُمْ فَرَغُ وَإِنَّمَا يَنْظُرُونَ إِلَى  
اِتْقَانِهِ وَجُودَهِ صَنْعَتِهِ \*

Dixit Plato sapiens : ne hoc studeas , ut opus aliquod  
celeriter perficias ; sed , ut illud bene egregieque perficias ,  
stude ; siquidem homines non interrogabunt , quanto tempo-  
re sit absolutum ; sed , num recte , diligenter et bene sit  
concinnatum , considerabunt .

29. وَقَالَ أَفَلَكُطُونُ أَيْضًا حُبِّكَ لِلشَّئْءِ هُنْتَ بِيَنْكَ وَبَيْنَ مَسْلَيْهِ  
وَبِغَصْبِكَ لَهُ هُنْتَ بِيَنْكَ وَبَيْنَ مَحَاسِنِهِ \*

Platonis et hoc: amor, qui te tenet rei alicuius, velum est te inter et vitia illius; uti, quo es imbutus, odium eius, velum est te inter et virtutes illius.

30. مَنْ فَدَحَكَ بِمَا لَيْسَ فِيهِ مِنْ الْجَمِيلِ وَهُوَ رَاضٌ عَنْكَ

ذَمَكَ بِمَا لَيْسَ فِيهِ مِنْ الْقَبِيجِ وَهُوَ سَاخِطٌ عَلَيْكَ \*

Qui te laudat ob egregium quid, quod in te non est, idem et sibi in eo placebit, ut te insimulet vitii, quod in te non est, et est malo in te animo affectus.

31. أَصْعَفُ النَّاسَ مِنْ ضُعْفٍ عَنْ كِتْمَانِ سُرَّةٍ وَاقْوَافِمِ مِنْ قُوَّىٰ

عَلَى غَضَبِهِ وَاصْبَرْهُمْ مِنْ سُتْرٍ فَاقْتَتَهُ وَاغْنَاهُمْ مِنْ قُنْعَنِ بِمَا تَيَسَّرَ لَهُ \*

Hominum infirmissimus est, qui secretum suum celare non valet; fortissimus, qui irae suae imperat; patientissimus, qui egestatem suam velat; ditissimus, qui contentus est eo, quod sorte ipsi obtigit.

32. مَنْتُلُ الَّذِي يَعْلَمُ النَّاسَ الْخَيْرَ وَلَا يَعْمَلُ بِهِ كَمِثْلٍ أَعْمَىٰ

بِيَدِهِ سَرَاجٌ يَسْتَضِي بِهِ غَيْرُهُ وَهُوَ لَا يَرَاهُ \*

Qui alios quid bonum et rectum sit docet, non vero ipse recte agit, is similis est caeco, in cuius manu lucerna, qua lucem alii praebet, quam autem ipse non videt.

33. فِي كِتَابِ كَلِيلَةٍ وَمِنْهُ اذَا احْدَثْتَ لَكَ الْعُدُوْ مُسَدَّدَةً

لَعْلَةً الْجَاهَةَ إِلَيْكَ فَمَعَ ذَهَابِ الْعُلَةِ رُجُوعُ الْعَدَاوَةِ كَالْمَاءِ تَسْخِينَهُ

فَإِذَا أَمْسَكْتَ نَارًا عَنْهُ عَادَ إِلَى أَصْلِهِ بَارِدًا وَالشَّجَرَةُ الْمَرَّةُ لَوْ

طَلَبَيْهَا بِالْعَسْلِ لَمْ تُنْتَرِ أَلْأَمِرَا \*

E libro Calila va Dimna; Inimicus, causa aliqua ad te compulsus, si amicitiam erga te prae se ferat, iterum, ces-

sante causa, hostis tibi erit; quemadmodum aqua calefacta, igne remoto, naturale suum frigus recipit, et sicut arbor amara, etiamsi melle eam oblinas, tamen nonnisi amaros fructus proferat.

34. مَثَلُ الْأَغْنِيَاءِ الْبَخْلَاءِ كَمَثَلِ الْبَيْعَالِ وَالْحَمِيرِ حَمْلُ الْذَّهَبِ  
وَالْفِضَّةِ وَتَعْتِيقُ بَالَّتَّبَّانِ وَالشَّعْبَرِ

Divites avari similes sunt mulis et asinis, qui aurum et argentum portant, ipsi vero palea et hordeo vescuntur.

35. قَبِيلٌ لِلْدَّحْنِ فِي قَبِيلٍ مَا أَحَلْمُكَ قَالَ لَسْتُ بِمُلْكِيْمِ  
وَلَكُنِي أَخَالْمُ وَاللَّهُ أَنِي لَا سَمِعْ الْكَلْمَةِ فَاحْمِ لَهَا شَدَّدَا مَا  
يَمْنَعُنِي مِنِ الْجَوَابِ عَنْهَا إِلَّا خَوْفُ مِنْ أَنْ أَسْمَعْ شَرَا مِنْهَا

Ahhna fus, Kaisi filius, alicui, mansuetudinem eius laudanti, respondit: per Deum! minime sum mansuetus, sed talis videor; nam cum dictum aliquod audio, propter quod per triduum succenseo, ne quid regeram, nil nisi metus me prohibet, ne peius quid audiam.

36. قَبِيلٌ لِبَعْضِهِمْ مَتَى يَحْمِدُ الْكَذْبَ قَالَ إِذَا جَمْعُ بَيْنِ  
مُنْقَاطِعِينَ قَبِيلٌ فَمَتَى يَنْدِمُ الصَّدْقَ قَالَ إِذَا كَانَ غِيَّبَةً فَمَتَى يَكُونُ  
الصَّمْتُ خَيْرًا مِنَ النَّطْقِ قَالَ عَنْدَ الْمَرْءِ \*

Interrogatus quidam: quando laudatur mendacium? respondit: cum iungit qui alienati fuerant. Quando vituperatur veritas? Cum de absente minus laudanda prodit. Et quando silentium praestat loquendo? In altercatione.

37. قَالَ عَامِرُ بْنُ عَبْدِ الْقَيْسِ إِذَا خَرَجَتِ الْكَلْمَةُ مِنَ الْقَلْبِ  
دَخَلَتِ فِي الْقَلْبِ وَإِذَا خَرَجَتِ مِنَ اللِّسَانِ لَمْ تَتَجَلَّ أَذَانَ \*

Dictum Ameri , Abdol-Caisi filius : sermo qui e pectore prodit , pectus ingreditur ; sed qui e lingua ( tantum ) prodit , non excedit aures ( i. e. auribus quidem percipitur , sed in animum non penetrat ).

38. قَالَ حَكِيمٌ لَاخْرَ يَا أَخِي كَيْفَ أَصْبَحْتَ قَالَ أَصْبَحْتُ

وَبِنَا مِنْ نَعْمَ اللَّهُ مَا لَا نَحْصِيهِ مَعَ كَثِيرٍ مَا نَعْصِيهِ فَمَا نَدْرِي أَجْهَمًا

نَشَّكُرُ جَمِيلًا مَا يَنْشَرُ أَوْ قَبِيجًا مَا يَسْتَرُ \*

Sapiens quidam , interrogatus ab alio ( sapiente ), quomodo se haberet ? optime , respondit , siquidem Deus T. O. M. , licet parum ei obtemperemus , tamen tam inumerabilia in nos confert beneficia , ut nesciamus , utrum propter bona , quae diffundit , an vero , quod tot mala a nobis arcet , plus ei gratiarum agamus .

39. قَالَ بَعْضُ الْحُكَمَاءِ لَا يَنْبَغِي لِلْفَاضِلِ أَنْ يُخَاطِبَ ذُرِى

الْأَنْقُصِ كَمَا لَا يَنْبَغِي لِلصَّاحِي أَنْ يُكَلِّمُ السَّكَارِ \*

Quam parum homini sobrio cum ebrisi , tam parum viro praestanti decet cum homine nequam confabulari .

40. قَالَ أَبْنُ الْمَعْتَزِ أَهْلَ الدُّنْيَا كُرْكَابٌ سَفِينَةٌ يُسَارُ بِهِمْ

\* وَمِنْ نُيَامٍ

Dictum Ebnol - Motaassi ; homines mundani sunt instar illorum , qui navi vehuntur , et quibuscum iter conficitur dum dormiunt .

41. قَالَ أَبْنُ الْمَقْفَعِ إِذَا حَاجَجْتَ فَلَا تَغْضِبْ فَإِنَّ الْغَضَبَ

يُقْطِعُ عَنْكَ الْحِجَةَ وَيُظَاهِرُ عَلَيْكَ الْخَصمَ \*

Dictum Ebn-ol-Mocaffae : in litigando ne irae indulgeas :

nam ira adimit tibi argumenta pro causa tua , et adversarium te superiorem reddit .

وَجَدَ عَلَى صِنْمٍ مُكْتُوبٌ حَرَامٌ عَلَى النَّفْسِ الْخَبِيْشَةِ أَنْ 42.

قَخْرَجَ مِنْ هَذِهِ الدُّنْيَا حَتَّى تَسْبِيَ إِلَى مِنْ أَحْسَنِ إِلَيْهَا

Statuae cuidam hoc insculptum reperiebatur : animae scelestae non est concessum hoc mundo egredi , priusquam illi , qui bene de ipsa meritus esset , mala rependerit .

قَالَ أَبُو مُسْلِمَ الْخَرَاسِيَّ خَاطَرَ مِنْ رَبِّ الْبَحْرِ وَشَدَّ مِنْهُ 43.

مُخَاطَرَةً مِنْ دَاخِلِ الْمُلُوكِ

Dixit Abu-Moslim , Chorasanus : periculo se exponit , qui mari vehitur , sed multo maiori periculo sese exponit , qui regibus se miscet .

قَالَ أَمِيرُ الْمُؤْمِنِينَ عَلَى كَرْمِ اللَّهِ وَجْهَهُ . الْأَدَبُ حَلَّ 45.

فِي الْغُنْيِ كَنزٌ عِنْدَ الْحَاجَةِ عَوْنٌ عَلَى الْمَرْوَةِ صَاحِبٌ فِي الْمَجْلِسِ  
مُونِسٌ فِي الْوَحْدَةِ تُعْمَرُ بِهِ الْقُلُوبُ الرَّاهِيَّةُ وَتُنْكِيَا بِهِ الْأَلْبَابُ  
الْمَيْتَةُ وَتُنْفَدَ بِهِ الْأَبْصَارُ الْكَلِيلَةُ وَيُدْرِكُ بِهِ الْطَّالِبُونَ مَا  
حَاوُلُونَ

Dixit Imperator fidelium , Ali , quem Deus summo honore afficiat ! Litterae sunt ornamentum in opulentia , thesaurus in necessitate , auxilium adversus vim , sodalis in consessu , familiaris oblectans in solitudine , illis mentes aegrae sanantur , et corda demortua vivificantur ; visus hebes illis fit acutus , et sapientiae studiosi per illas quod quaerunt assequuntur .

45. قَالَ لِقَمَانَ لَابْنِهِ يَا بُنَيْ لَتَكُنْ أَوْلُ شَيْءٍ تَكْسِبُهُ بَعْدَ  
الْأَيْمَانَ خَلِيلًا صَاحِبًا فَإِنَّمَا مَثَلُ الْخَلِيلِ الصَّالِحِ كَمَثَلِ النَّخْلَةِ  
أَنْ قَعَدْتَ فِي ظِلِّهَا أَطْلَكَ وَإِنْ احْتَطَبْتَ مِنْ حَطَبِهَا نَفَعَكَ وَإِنْ  
أَكَلْتَ مِنْ ثَمَرِهَا وَجْدَتَهُ طَيِّبًا

Dixit Locmanus filio suo : primum , quod tibi post veram religionem est acquirendum , est probus amicus ; talis enim est sicut palma , cuius sub umbra si sedes , ea te operit : si ex ea ligna colligis , utilitatem tibi praestat ; et cum de eius fructibus comedis , eos suaves invenis .

46. قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ثَدَّتْ مُهَلَّكَاتٍ  
وَثَدَّتْ مُنْجَيَاتٍ فَمَا الْمُغْلِكَاتُ فَشَّقَ مُطَاعَهُ وَهُوَ مُتَبِّعٌ  
وَاعْجَابُ الْمَرءِ بِنَفْسِهِ وَمَا الْمُنْجَيَاتُ فَخَشْيَةُ اللَّهِ فِي الْخِيرِ  
وَالْعَدْلِيَّةِ وَالْقَصْدُ فِي الْغَنَى وَالْفَقْرِ وَالْعَدْلُ فِي الرِّضَاءِ وَالْغَضْبِ

Dixit legatus Dei , cui propitium sit Numen ! Tria sunt , quae perdunt , et totidem quae servant ( hominem ) . Et illa quidem quod attinet , quae perdunt , sunt haec : avaritia cui indulges , cupiditas , quam sequeris , et admiratio tui ipsius . Quae vero servant , sunt : timor Dei clam et pallam ; rectitudo in opulentia et egestate ; et aequitas in gratia et ira .









